

JINDAL WORLDWIDE LIMITED			
FY 2021-2022			
Lists of Dates of Publication in English and Regional Newspaper			
Sr. No	Particulars of Agenda	Gujarati	English
1	Financial Results for the year ended 31st March , 2021	24th June 2021	24th June 2021
2	Notice for Transfer of Share to IEPF (FY 2013-2014)	23rd July 2021	23rd July 2021
3	Financial Results for the quarter ended 30th June, 2021	14th August 2021	14th August 2021
4	Notice of 35th AGM	07th September 2021	07th September 2021
5	Notice of Candidature	07th September 2021	07th September 2021
6	Notice of Postal Ballot	14th October 2021	14th October 2021
7	Notice of Candidature	14th October 2021	14th October 2021
8	Financial Results for the quarter and half year ended 30th Sept, 2021	31st October 2021	30st October 2021
9	Financial Results for the quarter ended 31st December, 2021	12th February, 2022	12th February, 2022

GUJARAT

DEFAMATION CASE

Rahul Gandhi to appear before Surat court today

EXPRESS NEWS SERVICE
SURAT, JUNE 23

CONGRESS MP Rahul Gandhi is expected to appear before a magistrate's court in Surat on Thursday to record his statement in a criminal defamation suit filed by BJP MLA Purnesh Modi.

The Wayanad MP will appear before the Chief judicial magistrate court of AN Dave to record his statement in the defamation suit filed over his "Modi surname remark".

The case pertains to his remarks at a Lok Sabha election rally at Kolar in Karnataka on April 13, 2019.

During the rally, Rahul had said, "Why all the thieves have Modi in their names whether be it Nirav Modi, Lalit Modi, and Narendra Modi?"

In his complaint lodged on April 16, Surat West MLA Purnesh Modi had alleged that Rahul

Gandhi had defamed the entire Modi community with his remarks. Rahul's lawyer Kirit Panwala told *The Indian Express*, "The statements of all the six witnesses in this case had been examined and arguments were concluded on the evidence put forward before the court. Now the next step of the court is to know what Rahul Gandhi wanted to say on the evidence."

He added, "We have not submitted an application before the court for his exemption from the further statement procedures."

Rahul had earlier appeared before the Surat district court on October 11, 2019 in connection with the case and had pleaded not guilty to the charges levelled against him.

Sources said that Gujarat Congress leaders including Purnesh Dhanani and Anit Chawda have camped in Surat city Wednesday to oversee the security measures ahead of Rahul's arrival.

Woman, boy found dead in river

Surat: A woman and a minor boy were found dead by local fishermen in the Tapi river in Surat on Wednesday afternoon.

Fisherman, Abu Lokhat, who was on his fishing boat with a friend, spotted the bodies near Amboli village in Kamrej taluka and informed the police.

Police recovered the bodies with the woman's hand tied to a

hand of the boy. Police said the woman was expected to be around 40 years old and the boy around 13 years.

Sub-inspector BB Pradhan of Kamrej police station said, "We held a postmortem and doctors said the death was caused due to drowning. We suspect they are mother and son... An investigation is on." **ENS**



MIGHTY FALL

A huge tree fell on the premises of Sidi Syed mosque in Ahmedabad on Wednesday. *Express*

IN-PRINCIPLE NOD FOR GLOBAL BIDDING PROCESS

Govt tries to develop Nargol port again

EXPRESS NEWS SERVICE
AHMEDABAD, MAY 23

AFTER A failed attempt to develop Nargol port in South Gujarat, the state government on Wednesday once again gave "in-principle" approval to construct the port through a global bidding process.

The port project in Valsad district is expected to attract Rs 3,800 crore of investment in the first phase, a statement from the government stated. The port is expected to handle solid, liquid and container cargo.

In August 2012, a consortium of Cargo Motors Pvt Ltd and Israel Ports Co. was se-

lected to develop the Nargol port. The consortium however failed to develop the port within the stipulated time frame, forcing the government to invite fresh bids. Nargol was chosen as a spot for building the port, after local fishermen and farmers agitated against possible land acquisition at the original site near village Maroli, which is about 10 kilometers away from Nargol.

The Gujarat government in the statement issued on Wednesday stated that by 2025, the Jawahar Nehru Port near Mumbai is expected to reach its optimal operational capacity and therefore a greenfield port in South Gujarat can help serve

industries in Gujarat, Maharashtra and Madhya Pradesh.

The government will be offering a BOOT (Build, Own, Operate and Transfer) period of 50 years instead of the 30 years usually offered for greenfield port development. "This presents the potential port developer with an assurance for greater Return on Investment (RoI)," the release stated.

The new proposal from the government "also offers interested developers the flexibility to quote discounted waterfront royalty rate in addition to the prevailing system of quoting premium on the base rates," the release added.

KHEDA

INDEPENDENT COUNCILLOR, BJP LEADER JOIN AAP

An independent sitting municipal councillor from Kapadvanj, Manubhai Patel and a former vice president of BJP, Kheda district Narottam Patel joined the Aam Aadmi Party on Wednesday. AAP also launched a tele-medicine helpline 7900094242 for Covid patients in Ahmedabad.

PLEAS CHALLENGING PROHIBITION ACT IN HC

Right to privacy not like a bull in China shop: State

EXPRESS NEWS SERVICE
AHMEDABAD, JUNE 23

THE STATE government on Wednesday submitted before the Gujarat High Court that right to privacy is not "like a bull in a China shop" and said state interference in controlling consumption of liquor cannot be equated to a hypothetical interference in individual food habits.

The division bench headed by Chief Justice Vikram Nath reserved its order after arguments concluded on the third consecutive day on maintainability of a bunch of petitions challenging provisions of the state's Prohibition Act.

Petitioners challenging the prohibition law submitted that on constitutional issues, the state should not insist that the matter be thrown out in the initial stage itself and that it should "grapple with the merits and assist the court in coming to the right decision".

Responding to an argument by the petitioners on June 22 that if the state controls consumption of liquor in the privacy of homes, it might as well control consumption of food in homes, Advocate General Kamal Trivedi, representing the state government, registered his "serious objection" and said, "Their argument sounds like a plea of aristocracy... a right to eat non-

veg within the four walls of your home can never be equated with right to consume intoxicating drink which is injurious... tomorrow somebody may say that you should not trouble me or harass me if I'm taking drug within the four walls of my house... This concept of privacy right is not like a bull in a China shop... it may also be subjected to reasonable restrictions, depending upon social environment, moral background, public interest... and these are propositions laid down by the judgments (of the SC) relied upon by the petitioners."

AG Trivedi further submitted that while a law which was declared valid years ago can be declared invalid years later. According to Trivedi, the changes effected in the Gujarat Prohibition Act over the years, "are cosmetic in nature," and "the substance of the original section has been kept intact".

Supporting AG Trivedi's case, senior advocate Prakash Jani, representing Ahmedabad Women's Action Group, added, "Essentially, the entire prohibition law centres around section 12 and 13, which is held to be constitutionally valid and has remained enforced since the past 70 years and people of Gujarat are extremely happy with the prohibition law, barring certain petitioners," Jani said that women's organisations "would earnestly urge not to accept sub-

missions of petitioners..."

Senior advocate Mihir Joshi, representing the petitioners, submitted that "if it is accepted that various sections are new sections and have never been tested, rejecting the petition as not maintainable is not permissible".

He argued, "...whether there is a right of privacy, whether it includes a choice of intoxicating drink... whether that right is newly conferred, it involves an examination on merits and if that be so, that right newly conferred in 2017, cannot be held to have been answered in the negative in a judgment of 1951..."

Senior counsel Percy Kavina, also representing the petitioners, added, "The reliance being placed upon judgments (by the state and others supporting the law and objecting to the maintainability) which are more than half a century old, must always give way to a new look at a matter. Otherwise constitutional progress will never take place."

Contending the argument of AG Trivedi that the SC had upheld the "Act as a whole", Joshi also pointed out that the interpretation was in the context of three issues (of encroachment on a field which is of Central legislature, interference with interstate trade and provisions of section 297 of Government of India Act), only. "It is not a general rubric..."

BRIEFLY

PM to inspect affordable housing project

Rajkot: Prime Minister Narendra Modi will on Friday inspect the under-construction 1144 affordable houses being constructed in Raiya village area of Rajkot city under the Central Government's Light House project (LHP) initiative. The PM will inspect the housing project being constructed by using tunnel form technology selected at the Global Housing Technology Challenge organised by the Centre. Municipal Commissioner Udit Agrawal said that Modi will inspect the project site through video-conferencing and live video-feed provided by drone cameras. **ENS**

Arun Mahesh Babu is new Rajkot collector

Rajkot: Arun Mahesh Babu on Wednesday assumed the charge as the new collector of Rajkot district. The 2013 batch IAS officer was earlier posted as the district development officer of Ahmedabad before his transfer as Rajkot district collector on June 19. He succeeded 2007 batch IAS officer Remya Mohan who has been transferred and appointed mission director of National Health Mission in Gandhinagar. This will be Babu's second stint in Rajkot district. Earlier, he had served as the deputy municipal commissioner in RMC before being transferred to Ahmedabad in April 2018. **ENS**

EXPRESS Careers

GOKHALE INSTITUTE OF POLITICS AND ECONOMICS

(Deemed to be University u/s 3 of UGC Act 1956) Pune 411004

APPOINTMENT OF VICE CHANCELLOR

The Gokhale Institute of Politics and Economics (Deemed to be University), Pune, Maharashtra, India is one of the premier research institutes in India in Economics and allied subjects. Established in 1930, the Institute has grown in stature and first became a Centre for Advanced Studies in Economics and later on a Deemed to be University in 1993. Renowned academicians like Prof. D. R. Gadgil, Prof. V. M. Dandekar, Prof. P. N. Mathur, Prof. Nilakantha Beeth etc. who have contributed immensely towards policy making in the country, served as the Director of the Institute in the past.

The Institute invites applications for the post of Vice-Chancellor from eligible and interested candidates who shall be appointed by the Chancellor out of a panel to be recommended by a Search-cum-Selection Committee constituted in accordance with the UGC (Institutions Deemed to be Universities) Regulations 2019. The Vice-Chancellor shall be a visionary with proven leadership qualities, administrative capabilities as well as teaching and research credentials. For details about qualifications, experience and skills please visit Institute's website <http://www.gipe.ac.in>. The age limit for the candidates is 65 years.

The salary and other perks of the Vice Chancellor will be as per UGC norms for Seventh Pay Commission Scale. The Institute also offers residential accommodation within walking distance of the Institute.

Application for the above post containing the details of educational, administrative, select publications and other achievements along with names of two referees may be sent to registrar@gipe.ac.in and the hard copy duly self-authenticated on each page is to be policy making in the country, served as the Director of the Institute in the past.

Please visit the University Website <http://www.gipe.ac.in> for further details and instructions. The Search cum Selection Committee reserves the right to invite applications for their own for consideration for the post of Vice Chancellor in addition to the candidates who may have applied for the post.

REGISTRAR

Gokhale Institute of Politics and Economics (Deemed to be University u/s 3 of UGC Act) B.M.C.C. Road, Deccan Gymkhana, Pune 411004 (Maharashtra), India


IRCON INTERNATIONAL LTD.
(A Govt. of India Undertaking)
CIN: L45203WB1975GO0088171. Web: www.ircon.org
E-Procurement Notice (National Competitive Bidding)
e-Tender No. IRCON2020/CRP/01/TENDER/21-2020/RA-PENDRA/BS-48. Dated: 23.06.2021
e-Tender for and on behalf of Chhattisgarh East West Railway Limited is invited from bidder meeting qualifying requirements for the work of "Providing consultancy services for progress Monitoring and presenting through Primavera EPPM based progress scheduler and providing a cloud-based for document controlling and storage for New BC Electrified Double Railway line over South East Central Railway between Gwari (Km 0) to Pendra (Km 135) in the State of Chhattisgarh."
Estimated cost of the work: ₹ 28.73,690.00/-
Last Date & Time of Bid Submission: 15.07.2021 up to 15.00 Hrs. (IST)
For further details, visit website <https://tenders.gov.in/epprocure/app> Corrigendum, any, would be hosted only on the website. CGMICEWRL, North Avenue, Bilsapur-49500


MUNOTH CAPITAL MARKET LIMITED
CIN: L99999GJ1986PLC083614
Regd. Office: Shanti Nivas, Opp. Shapath-V, Mr. Karnamulab, S G Road, Ahmedabad-380055
E-mail address: munoth@gmail.com. Contact No.: 022-2284144, 2287078, 2993754
NOTICE
Notice is hereby given as per Regulation 47 of SEBI (LODR) Regulation, 2015 meeting of Board of Directors of **Munoth Capital Market Limited** will be held on Wednesday, 30th June, 2021 at 4:00 P.M. at the registered office of the Company for consideration of Audited Financial results for Quarter and year ended on 31st March, 2021.
For, **MUNOTH CAPITAL MARKET LIMITED** Sd/-
Date: 23/06/2021 Bhagyashree Jasmin Satari
Place: Ahmedabad Company Secretary

Palco Metals Limited
CIN:L27310GJ1990PLC00998
Registered Office: 1715, Saijprasad Industrial Park-II, Besides Ramol Police Station, CTM- Ramol Road, Ramol, Ahmedabad-382449. Tele Ph No: 9426078920
Email: cs@palcometals.com. Website: www.palcometals.com

NOTICE is hereby given that the Extraordinary General Meeting (EGM-121-22) of the Members of Palco Metals Limited will be held on Thursday, 16th July, 2021 at 12:30 P.M. at the Registered Office of the Company at Block No. 1715, Saijprasad Industrial Park-II, Besides Ramol Police Station, CTM-Ramol Road, Ramol, Ahmedabad-382449 to transact the business as set out in the notice of the EGM. Electronic copies of Notice of EGM are sent to all the Shareholders whose email id are registered with RTA/Depository Participant(s). The same are also available on the website of the Company at www.palcometals.com. Physical copies of the Notice has been sent to all other Shareholders at their registered addresses through permitted mode and dispatch of same is completed. Any person, who acquires shares and becomes a Member of the Company after dispatch of the notice and holding shares as of the cut-off date, may obtain login details and password sending a request at evoting@nsdl.co.in. However, if a person is already registered with NSDL for remote e-voting then existing user ID and password can be used for casting vote. The details of Remote e-voting process is mentioned: i. The resolutions set forth in the Notice of the EGM will be transacted through voting by electronic means. ii. The remote e-voting shall commence on Monday, 12 July, 2021 (09:00 AM) and ends on Wednesday, 14 July, 2021 (05:00 PM). Remote E-Voting shall not be allowed beyond the said date and time. iii. The cut-off date for determining the eligibility to vote by electronic means or at the EGM is Thursday, 11 July, 2021. iv. Members may note that: a) The remote e-voting module shall be disabled by NSDL after 5.00 p.m. on 14 July, 2021; b) The facility for voting through ballot paper shall be made available at the EGM; c) The members who have casted their vote by remote e-voting prior to EGM may also attend the EGM but shall not be entitled to cast their vote again; and d) A person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting or voting at the EGM through ballot papers. v. The Company has appointed Mr. Punit S. Lath, Practicing Company Secretary (COP No: 11139) as the Scrutinizer to scrutinize the e-voting as well as voting by poll process in a fair and transparent manner. vi. The Notice is also available on the Company's website www.palcometals.com and on the website of NSDL <https://www.evoting.nsdl.com>. In case of any members have any queries or issues regarding remote e-voting may refer the Frequently Asked Questions (FAQs) and e-voting manual available at <https://www.evoting.nsdl.com> under 'help section' or write an email to evoting@nsdl.co.in or call at toll free no 1800-222-9990. vii. The Notice is also available on the Company's website www.palcometals.com and on the website of NSDL <https://www.evoting.nsdl.com>. In case of any grievances regarding the facility of remote voting, Members may contact: Mr. Anil Vishal, Sr. Manager, Address Trade World, A Wing, 4th and 5th Floors, Kamla Mills Compound, Lower Parel, Mumbai-400013. E-mail id: iamv@nsdl.co.in and Phone Number(s): 022-24943900; Tollfree no: 1800-222-9990. A Member entitled to attend and vote at the EGM is entitled to appoint a proxy to attend and vote at the meeting on his/her behalf. Such proxy need not be a Member of the Company, Proxies, in order to be effective, must be received at the Registered Office of the Company not less than 48 hours before the commencement of EGM. Proxies submitted on behalf of limited companies, societies, etc., must be supported by an appropriate resolution or authority as applicable. Corporate Members intending to send their authorized representatives to attend the EGM are requested to send a certified copy of the Board Resolution to the Company, authorizing their representative to attend and vote on their behalf at the EGM. For and on behalf of Board of Directors Palco Metals Limited Mukesh Tiwari Company Secretary & Compliance officer

Place : Ahmedabad
Date : 18/06/2021

<div> JINDAL WORLDWIDE LIMITED</div> <div>Regd. & Corp. Off: 'Jindal House', Opp. Dmart, I.O.C. Petrol Pump Lane, Shivranjani Shyamal 132 Ft Ring Road, Satellite, Ahmedabad -380015 • CIN: L17110GJ1986PLC008942 • Ph:079-71001500 Website: www.jindalworldwide.com • E-mail id: csjindal@jindalworldwide.com</div>						
STATEMENT OF STANDALONE & CONSOLIDATED AUDITED FINANCIAL RESULTS (AS PER SCHEDULE III OF COMPANIES ACT, 2013 AND IND-AS) For the Quarter and Financial Year ended 31st March, 2021 { Pursuant to Regulation 47(1)(b) of SEBI (LODR) Regulations, 2015}						
(Rs. in Lakhs except EPS)						
Sr. No.	Particulars	Quarter Ended			Year Ended	
		3 months ended C.Y.	Preceding 3 months ended C.Y.	Corr. 3 months ended in P.Y.	Year to Date figures of C.Y. ended	Year to Date Figures of P.Y. ended
		31st March, 2021	31st Dec, 2020	31st March, 2020	31st March, 2021	31st March, 2020
(Audited) (Un-Audited) (Audited) (Audited) (Audited)						
STANDALONE						
1	Total Income from operations (net)	64713.65	62829.51	52854.71	170969.63	201655.22
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary Items)	2673.17	2965.26	691.30	6200.28	4272.22
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary Items)	2673.17	2965.26	691.30	6200.28	4272.22
4	Net Profit / (Loss) for the period after tax (after exceptional and / or Extraordinary Items)	1767.53	2221.32	528.78	4409.83	3202.71
5	Total Comprehensive Income for the period after share of profit after associates and minority interest [Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	1767.53	2221.32	528.78	4409.83	3202.71
6	Equity Share Capital	2005.20	2005.20	2005.20	2005.20	2005.20
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet as at Previous Financial Year ended 31st March, 2020 and Current Financial Year ended 31st March 2021	N.A.	N.A.	N.A.	39977.20	35567.37
8	Earnings per share (of Rs. 1/- each)(for continuing and discontinued operations) : 1. Basic :	0.88	1.11	0.26	2.20	1.60
	2. Diluted :	0.88	1.11	0.26	2.20	1.60
CONSOLIDATED						
1	Total Income from operations (net)	64185.07	58954.97	63966.23	169961.52	219894.94
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	2539.56	3290.78	190.66	6241.09	3920.72
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary Items)	2539.56	3290.78	190.66	6241.09	3920.72
4	Net Profit / (Loss) for the period after tax (after exceptional and / or Extraordinary Items)	1629.16	2521.44	32.78	4420.48	2841.13
5	Total Comprehensive Income for the period after share of profit after associates and minority interest [Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	1629.03	2521.48	27.07	4420.82	2848.31
6	Equity Share Capital	2005.20	2005.20	2005.20	2005.20	2005.20
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet as at Previous Financial Year ended 31st March, 2020 and 31st March 2021	N.A.	N.A.	N.A.	40038.94	35618.12
8	Earnings per share (of Rs. 1/- each)(for continuing and discontinued operations) : 1. Basic :	0.81	1.26	0.01	2.20	1.42
	2. Diluted :	0.81	1.26	0.01	2.20	1.42
Notes:						
1. The above Audited Standalone & Consolidated Financial Results of the Company for the quarter and year ended 31st March, 2021 have been reviewed by the Audit Committee and are approved by the Board of Directors in the Meeting held on 22nd June, 2021.						
2. The Company has adopted, Indian Accounting Standards prescribed under Section 133 of the Companies Act, 2013 (Ind-AS) from 1st April, 2017 and accordingly these financial results and all the periods presented have been prepared in accordance with the recognition and measurement principles laid down in Ind-AS 34 "Interim Financial Reporting" read with relevant rules issued thereunder and the other accounting principles generally accepted in India and discloses the information required to be disclosed in terms of Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015 (as amended).						
3. The Board of Directors in its meeting held on 22nd June, 2021 have recommended a Final Dividend of 5% of the paid up equity share capital (i.e. Rs. 0.05 paise per equity share of Rs. 1/- each) for the Financial Year 2020-2021.						
4. The Statutory Auditors of the Company have carried out an Audit of the above Standalone & Consolidated Financial Results & Statement of Assets & Liabilities of the Company for the quarter and financial year ended 31st March 2021 in terms of Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015 and have issued an unmodified Independent Auditor's Report thereon.						
5. The figures for the corresponding previous periods have been regrouped/rearranged wherever necessary, to make them comparable.						
6. Pursuant to SEBI Circular No. SEBI/HO/ODS/CIR/P/2018/144 dated 26th November, 2018 "Fund Raising by Issuance of Debt Securities by Large Entities", the Company do not fall under the category of Large Corporates as per the given applicability framework of the said circular as on 31st March, 2021.						
7. The above is an extract of the detailed format of Audited Standalone & Consolidated Financial Results for the quarter and year ended 31st March, 2021 filed with the Stock Exchanges (BSE & NSE) under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The detailed statement of Financial Results along with Statement of Assets & Liabilities along with Standalone & Consolidated Independent Auditor's Report is available on the website of BSE Limited (www.bseindia.com), National Stock Exchange of India Limited (www.nseindia.com) and also on the website of the Company (www.jindalworldwide.com).						
Date : 22nd June, 2021 Place : Ahmedabad						
For and on behalf of the board Jindal Worldwide Limited Sd/- Amit Agrawal Managing Director - DIN: 00169061						
*REQUEST TO THE SHAREHOLDERS FOR UPDATION OF THEIR E-MAIL IDS: Pursuant to the circulars issued by the MCA and SEBI stating the requirement of conducting AGM upto 31st December, 2021 through Video Conferencing or other audio visual means due to ongoing COVID-19 Pandemic and in order to effectively communicate the necessary informations related to AGM and such other matters of the Company to the Shareholders, the Company hereby requests to the all the shareholders to kindly update their respective E-Mail IDs and other related details with the Company Secretary or Register and Transfer Agent (RTA) of the Company in the manner prescribed in the Form as placed on the website of the Company.						

<div>  <div> JINDAL WORLDWIDE LIMITED Regd & Corp. Off: 'Jindal House', Opp. Dmart, I.O.C. Petrol Pump Lane, Shivranjan Shyamal 132 Ft Ring Road, Satellite, Ahmedabad - 380015 • CIN: L17110GJ1986PLC08942 • Ph:079-71001500 Website: www.jindaltexiles.com • E-mail Id: csjindal@jindaltexiles.com </div> </div>						
STATEMENT OF STANDALONE & CONSOLIDATED AUDITED FINANCIAL RESULTS (AS PER SCHEDULE III OF COMPANIES ACT, 2013 AND IND-AS) For the Quarter and Financial Year ended 31st March, 2021 { Pursuant to Regulation 47(1)(b) of SEBI (LODR) Regulations, 2015}						
(Rs. In Lakhs except EPS)						
Sr. No.	Particulars	Quarter Ended			Year Ended	
		3 months ended of C.Y.	Preceding 3 months ended of C.Y.	Corr. 3 months ended in FY.	Year to Date figures of C.Y. ended	Year to Date Figures of FY ended
		31st March, 2021	31st Dec, 2020	31st March, 2020	31st March, 2021	31st March, 2020
		(Audited)	(Un-Audited)	(Audited)	(Audited)	(Audited)
STANDALONE						
1	Total Income from operations (net)	64713.65	62829.51	52854.71	170969.63	210655.22
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary Items)	2673.17	2965.26	691.30	6200.28	4272.22
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary Items)	2673.17	2965.26	691.30	6200.28	4272.22
4	Net Profit / (Loss) for the period after tax (after exceptional and / or Extraordinary Items)	1767.53	2221.32	528.78	4409.83	3202.71
5	Total Comprehensive income for the period after share of profit after associates and minority interest [Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	1767.53	2221.32	528.78	4409.83	3202.71
6	Equity Share Capital	2005.20	2005.20	2005.20	2005.20	2005.20
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet as at Previous Financial Year ended 31st March, 2020 and Current Financial Year ended 31st March 2021	N.A.	N.A.	N.A.	39977.20	35567.37
8	Earnings per share (of Rs. 1/- each)(for continuing and discontinued operations) : 1. Basic :	0.88	1.11	0.26	2.20	1.60
	2. Diluted :	0.88	1.11	0.26	2.20	1.60
CONSOLIDATED						
1	Total Income from operations (net)	64185.07	58954.97	63966.23	169961.52	219894.94
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary Items)	2539.56	3290.78	190.66	6241.09	3920.72
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary Items)	2539.56	3290.78	190.66	6241.09	3920.72
4	Net Profit / (Loss) for the period after tax (after exceptional and / or Extraordinary Items)	1629.16	2521.44	32.78	4420.48	2841.13
5	Total Comprehensive income for the period after share of profit after associates and minority interest [Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	1629.03	2521.48	27.07	4420.82	2848.31
6	Equity Share Capital	2005.20	2005.20	2005.20	2005.20	2005.20
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet as at Previous Financial Year ended 31st March, 2020 and 31st March, 2021	N.A.	N.A.	N.A.	40038.94	35618.12
8	Earnings per share (of Rs. 1/- each)(for continuing and discontinued operations) : 1. Basic :	0.81	1.26	0.01	2.20	1.42
	2. Diluted :	0.81	1.26	0.01	2.20	1.42
Notes:						
1. The above Audited Standalone & Consolidated Financial Results of the Company for the quarter and year ended 31st March, 2021 have been reviewed by the Audit Committee and are approved by the Board of Directors in the Meeting held on 22nd June, 2021						
2. The Company has adopted, Indian Accounting Standards prescribed under Section 133 of the Companies Act, 2013 (Ind-AS) from 1st April, 2017 and accordingly these financial results and all the periods presented have been prepared in accordance with the recognition and measurement principles laid down in Ind-AS 34 "Interim Financial Reporting" read with relevant rules issued thereunder and the other accounting principles generally accepted in India and discloses the information required to be disclosed in terms of Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015 (as amended).						
3. The Board of Directors in its meeting held on 22nd June, 2021 have recommended a Final Dividend of 5% of the paid up equity share capital (i.e. Rs. 0.05 paise per equity share of Rs. 1/- each) for the Financial Year 2020-2021.						
4. The Statutory Auditors of the Company have carried out an Audit of the above Standalone & Consolidated Financial Results & Statement of Assets & Liabilities of the Company for the quarter and financial year ended 31st March, 2021 in terms of Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015 and have issued an unmodified Independent Auditor's Report thereon.						
5. The figures for the corresponding previous periods have been regrouped/rearranged wherever necessary, to make them comparable.						
6. Pursuant to SEBI Circular No. SEBI/HO/ODHS/CIR/P/2018/144 dated 26th November, 2018-"Fund Raising by Issuance of Debt Securities by Large Entities", the Company do not fall under the category of Large Corporates as per the given applicability framework of the said circular as on 31st March, 2021.						
7. The above is an extract of the detailed format of Audited Standalone & Consolidated Financial Results for the quarter and year ended 31st March, 2021 filed with the Stock Exchanges (BSE & NSE) under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The detailed statement of Financial Results along with Statement of Assets & Liabilities under Standalone & Consolidated Independent Auditor's Report is available on the website of BSE Limited (www.bseindia.com), National Stock Exchange of India Limited (www.nseindia.com) and also on the website of the Company (www.jindaltexiles.com).						
For and on behalf of the board Jindal Worldwide Limited Sd/- Amit Agrawal Managing Director - DIN: 00169061						
*REQUEST TO THE SHAREHOLDERS FOR UPDATION OF THEIR E-MAIL IDs: Pursuant to the circulars issued by the MCA and SEBI						

સહી/-અધિકૃત અધિકારી, કેનરા બેંક

GUJARAT

Groundnut acreage crosses annual average of last 3 yrs

EXPRESS NEWS SERVICE
RAJKOT, JULY 23

FOR THE second consecutive year, groundnut acreage in the state has remained higher than average and stands at 17.64 lakh hectare (ha) or 104 per cent of the last three-year's annual average of 16.95 ha.

According to latest data available with the Directorate of Agriculture of Gujarat, the groundnut sowing in the state stands at 17,64,503 hectare. It is marginally higher than 16,95,077 ha, the last three-year's annual average sowing area for this oilseed crop. But it is lower as compared to 19.70 lakh acreage in the year during the corresponding period last Kharif season. Last year, farmers had sown groundnut in total 20.72 lakh, the highest in the last two decades in the state.

Gujarat accounts for almost half of groundnut acreage and production in the country. After cotton, groundnut is the second

most important cash crop of Gujarat in Kharif season. The state's overall sowing area stands at 57,20 lakh or 66.87 per cent of the annual average of 86.14 lakh for 2020-21, the highest for any single crop this season and groundnut is the second highest. The progressive cotton acreage is 18.19 per cent of the crop's average sowing area of 25.53 lakh.

The higher planting area of groundnut comes in the backdrop of farmers realising prices at par with the Rs 5,272 per quintal minimum support price (MSP) fixed by the Central government last season. This year, the government has hiked the MSP to Rs 5,541 amid increasing prices of edible vegetable oils in retail market.

Within Gujarat, Saurashtra accounts for 14.46 lakh of groundnut acreage, followed by 2.88 lakh in north Gujarat.

Overall, oilseeds have been planted in 14.46 lakh of groundnut acreage, followed by 2.88 lakh in north Gujarat. It is the highest for group of

crops. Besides groundnut, other major oilseeds grown in the country include sesame, castor and soybean. For the first time in recent decades, soybean acreage has gone past two lakh and presently stands at 2,00,951. That is 156.11 per cent, the highest increase for any crop so far this Kharif season.

Kharif groundnut sowing starts in Gujarat in June and continues till early July. However, state government keeps on updating sowing data well through August as field reports are received. Castor, another major oilseed crop is sown in July-August.

Overall, farmers have so far sown cereals in 5,95 lakh (43.97 per cent of average), pulses in 3,02 lakh (71.34%) and oilseeds in 20.34 lakh (78.86%). Among pulses, tur accounts for 1.73 lakh (74.68%) and black gram 95,168 ha (96.79%). Among cereals, paddy (2.37 lakh) and maize (2.51 lakh) account for most of the acreage with pearl millets (94,609 ha) standing third.

MAHISAGAR ABORTION Accused sent to judicial custody

VADODRA: A local court in Mahisagar on Friday sent to judicial custody two women arrested for running an alleged illegal abortion centre from a private residence in Santarpur. The accused, Kati Sangada, 41, a nurse, and her accomplice Muni Harjan had been remanded to three days in police custody on Tuesday for investigation but the police have not found any link to the two.

On Friday, the Santarpur police station did not seek further remand of the accused in the case who were produced before a Magistrate's Court. The court remanded the two women to judicial custody and sent them to Sub-Jail Santarpur. The accused also filed bail application in the court of the Chief Judicial Magistrate of Santarpur on Friday. The court, however, rejected the bail application. **ENS**

Man 'impersonates' advisory committee member at PMO to visit SoU, booked

EXPRESS NEWS SERVICE
VADODARA, JULY 23

THE NARMADA district police booked two persons, one of whom allegedly impersonated as a member of the advisory committee at the Prime Minister's Office (PMO), in order to visit the Statue of Unity located in Kevadia in Narmada district.

According to an FIR filed at the Kevadia police station late on Thursday by a police sub-inspector (PSI), AD Rathwa attached to Statue of Unity Area Development and Tourism Governance Authority (SOUGATGA), the incident took place on July 17, when the accused were accompanied by four other persons on a visit to SoU.

The FIR suggests that the accused established contact with the officials of SOUGATGA through the district administration and sought a complimentary visit to the SoU. "When the accused and the five persons arrived in the office of the SOUGATGA at around 1 pm on July 17, one of them introduced himself as a member of the advisory council of Prime Minister Narendra Modi and an employee of the PMO, New Delhi. The other accused identified himself as a senior journalist from Vadodara city. They said they desired to visit the SoU. When we communicated to them that we had not received any official intimation about a visit from an advisor of the Prime Minister, they agreed to book tickets to the Statue of Unity. They booked tickets

worth Rs 380 for five persons through the online booking system from their mobile phones," PSI Rathwa has said in his complaint. Rathwa has further added that the "suspicious conduct" of the accused prompted the officials to verify the credentials of the impostor and upon enquiring with the PMO, they confirmed that no such person is appointed in the advisory committee of the PMO. On Friday, the senior journalist from Vadodara was detained while Kevadia police officials had initiated the process to also arrest the main accused, a resident of New Delhi, who impersonated as a PMO official. The accused have been booked under sections of the IPC for pretending to hold a particular office as a public servant, knowing that he does not hold such office and impersonating as an official (170) as well as abetment of crime (114). The accused will be formally arrested and produced before a magistrate, where they can apply for bail.

Incidentally, this is the second such incident to have occurred in recent times. In June, a man posing as a Cabinet Minister from Maharashtra state had the Vadodra Municipal Corporation (VMC) on its toes to conduct RTI-PCR tests for Covid-19 for his group of 14 persons during a visit to SoU and other tourist attractions around Vadodra.

NGO TO CENTRE AFTER MV KANCHAN SINKS 'Oil spillage may harm marine life, ship needs to be removed'

EXPRESS NEWS SERVICE
SURAT, JULY 23

AN NGO has written to the Union Ministry of Environment and Forest and the Central Pollution Control Board demanding immediate removal of the cargo ship MV Kanchan that sank seven nautical miles west off Umargam in Gujarat on Wednesday night.

It was going from Hazira to Mangalore port and the engines failed.

In the letter to the central government sent on Friday, Gujarat president of Brackish Water Research Centre, MSH Sheikh, raised concern that the oil spillage from the cargo ship

will harm marine life. "It is the fish breeding season in the west coast of India. The oil spillage from the ship will have negative impact on the fish. The adverse impact that the sunken ship will have on marine life should be assessed by an expert. The coastlines between South Gujarat and North Maharashtra are regularly witnessing incidents of oil spillage. Due to such oil spillages, local fishermen complain reduction in fish catch. The Umargam coast has favourable condition for fish breeding. Varieties of fishes like Bombay duck, pomfret, crabs, lobsters, shrimps are found here which are even exported outside the country."

According to police, an FIR was lodged against the accused on October 10, 2016, under IPC Sections 376 for rape, 511 for punishment for committing offences punishable with life imprisonment along with sections of POCSO act at Pipavav police station. **ENS**

24-yr-old gets life term for raping minor

AHMEDABAD: A 24-year-old man has been sentenced to life imprisonment by a Protection of Children against Sexual Offences (POCSO) court in Rajula for allegedly raping a 14-year-old girl in 2016. The accused was convicted by the court of Judge SP Bhatt on July 22. The accused has also been asked to pay a penalty of Rs 1.5 lakh to the girl as compensation.

According to police, an FIR was lodged against the accused on October 10, 2016, under IPC Sections 376 for rape, 511 for punishment for committing offences punishable with life imprisonment along with sections of POCSO act at Pipavav police station. **ENS**

AUM VIDYA MANDIR, UDAYNAGAR REQUIRES PRINCIPAL

Applications are invited for the post of Principal for Aum Vidya Mandir Higher Secondary School (Non-granted) run by Adhyatmik Uthan Mandal Trust from eligible candidates as per details mentioned below:

Education Qualification: Candidate should possess Post Graduate Degree with B.Ed. and have cleared Head Master Aptitude Test.

Experience: At least 15 Years Teaching Experience in Secondary / Higher Secondary Gujarati Medium School. Candidates having work experience as Principal will be given preference.

Note: Applicant should not have completed 50 Years as on 01.07.2021. In case of overwhelming applications candidates will be called on merit basis for interview and School management reserves the right to reject applications without assigning any reason. Convancing in any form shall disqualify candidature.

Eligible candidates should e-mail their application along with relevant certificates with respect to qualification and experience and a Passport size Photograph within fifteen days from the date of publication of this advertisement.

secretary.avm.school@gmail.com
Hon. Secretary, Aum Vidya Mandir, Udaynagar, Gandhidham

भारतीय प्लाईवुड उद्योग अनुसंधान और प्रशिक्षण संस्थान INDIAN PLYWOOD INDUSTRIES RESEARCH AND TRAINING INSTITUTE

(एनएचआर, का. ए. ए. नवसुखी विलियम रोड का. ए. ए. नवसुखी, भारत सरकार)
(An Autonomous body of the Ministry of Environment, Forests & Climate Change, Govt. of India)
P.B. No. 2273, (Behind to Peenya Metro Station), HMT Link Road, Off Tumkur Road, P.O. Yeswanthpur, Bengaluru - 560 022. Ph. 080-30534000, 30534001, 30534040, 28394231-32-33 Fax. 080-28396361/30534021, 28395970
E-mail: upadhyay@iprti.gov.in contactus@iprti.gov.in

ADMISSION NOTIFICATION

IPRTI announces the commencement of 32nd Batch of one-year POST GRADUATE DIPLOMA IN WOOD AND PANEL PRODUCTS TECHNOLOGY. Application for the course can be downloaded from IPRTI website and submitted by enclosing DD Rs. 500/- (non-refundable) drawn in favour of Director, IPRTI, payable at Bangalore along with photocopies of certificates/mark sheets.

Eligibility: Graduate in Science (B.Sc. in Chemistry/Physics/Mathematics/Forestry/Agriculture) / Engineering (B.E./B.Tech) from any recognized University.

Age limit: 28 years (as on 01.11.2021) Relaxable for SC/ST/OBC/PH as per Govt. Rules. Age limit is also relaxable for candidates sponsored by Industries.

Selection method: Based on marks obtained in 8 Subjects and any other criteria decided by admission committee. Reservation will be as per Govt. Rules.

Career Prospects: Institute facilitates industrial placement of students every year through campus recruitment.

Last Date for receipt of filled application along with photocopy of all documents (mark sheets, age proof, caste certificate etc.) is 27th August 2021. Application form, prospectus & other information available on institute website www.iprti.gov.in.

Corrigendum changes (if any) will be posted at IPRTI website only. Sd/- Administrative Officer

Vistaar Financial Services Pvt Ltd
Registered Office: Plot No 59 & 60-23/22nd Cross, 29th Main
BTM 2nd Stage, Bengaluru 560076. www.vistaarfinance.com

APPENDIX IV [See rule 8 (1)]

POSSESSION NOTICE (For Immovable Property)
Whereas, the undersigned, being the Authorized Officer of Vistaar Financial Services Private Limited under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13 (1) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notice, dated 16/04/2021 calling upon the Borrowers to VIMAL, GUSAL, JAIN & GHISUAL, SUMERAM, JAIN to repay the amount mentioned in the Notice being Rs. 28,63,006/- (Rupees Twenty Eight Lacs Three Thousand Six Hundred and Six Only) against Loan Account No. 013158ML00909 as on 27/03/2021 and interest thereon within 60 days from the date of receipt of the said Notice.

The Borrowers having failed to repay the amount, Notice is hereby given to the Borrowers and the public in general that the undersigned has taken Synchronised possession of the property described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of Section 13 of the Act read with Rule 6 of the Security Interest (Enforcement) Rules, 2002 and the 20th day of July of the year 2021.

The Borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Vistaar Financial Services Private Limited for an amount of Rs. 28,63,006/- (Rupees Twenty Eight Lacs Three Thousand Six Hundred and Six Only) as on 27/03/2021 and interest thereon.

The Borrowers' attention is invited to provisions of Sub-Section (8) of Section 13 of the Act in respect of time available to redeem the Secured Assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY: All that piece and parcel of the immovable property Sh. No. 2, wing A, C, and D, situated at the intersection of VAP, Vaidat, (Survey No. 195/4A, 195/4B, 195/4C, 195/4D, 195/4E, 195/4F, 195/4G, 195/4H, 195/4I, 195/4J, 195/4K, 195/4L, 195/4M, 195/4N, 195/4O, 195/4P, 195/4Q, 195/4R, 195/4S, 195/4T, 195/4U, 195/4V, 195/4W, 195/4X, 195/4Y, 195/4Z, 195/4AA, 195/4AB, 195/4AC, 195/4AD, 195/4AE, 195/4AF, 195/4AG, 195/4AH, 195/4AI, 195/4AJ, 195/4AK, 195/4AL, 195/4AM, 195/4AN, 195/4AO, 195/4AP, 195/4AQ, 195/4AR, 195/4AS, 195/4AT, 195/4AU, 195/4AV, 195/4AW, 195/4AX, 195/4AY, 195/4AZ, 195/4BA, 195/4BB, 195/4BC, 195/4BD, 195/4BE, 195/4BF, 195/4BG, 195/4BH, 195/4BI, 195/4BJ, 195/4BK, 195/4BL, 195/4BM, 195/4BN, 195/4BO, 195/4BP, 195/4BQ, 195/4BR, 195/4BS, 195/4BT, 195/4BU, 195/4BV, 195/4BW, 195/4BX, 195/4BY, 195/4BZ, 195/4CA, 195/4CB, 195/4CC, 195/4CD, 195/4CE, 195/4CF, 195/4CG, 195/4CH, 195/4CI, 195/4CJ, 195/4CK, 195/4CL, 195/4CM, 195/4CN, 195/4CO, 195/4CP, 195/4CQ, 195/4CR, 195/4CS, 195/4CT, 195/4CU, 195/4CV, 195/4CW, 195/4CX, 195/4CY, 195/4CZ, 195/4DA, 195/4DB, 195/4DC, 195/4DD, 195/4DE, 195/4DF, 195/4DG, 195/4DH, 195/4DI, 195/4DJ, 195/4DK, 195/4DL, 195/4DM, 195/4DN, 195/4DO, 195/4DP, 195/4DQ, 195/4DR, 195/4DS, 195/4DT, 195/4DU, 195/4DV, 195/4DW, 195/4DX, 195/4DY, 195/4DZ, 195/4EA, 195/4EB, 195/4EC, 195/4ED, 195/4EE, 195/4EF, 195/4EG, 195/4EH, 195/4EI, 195/4EJ, 195/4EK, 195/4EL, 195/4EM, 195/4EN, 195/4EO, 195/4EP, 195/4EQ, 195/4ER, 195/4ES, 195/4ET, 195/4EU, 195/4EV, 195/4EW, 195/4EX, 195/4EY, 195/4EZ, 195/4FA, 195/4FB, 195/4FC, 195/4FD, 195/4FE, 195/4FF, 195/4FG, 195/4FH, 195/4FI, 195/4FJ, 195/4FK, 195/4FL, 195/4FM, 195/4FN, 195/4FO, 195/4FP, 195/4FQ, 195/4FR, 195/4FS, 195/4FT, 195/4FU, 195/4FV, 195/4FW, 195/4FX, 195/4FY, 195/4FZ, 195/4GA, 195/4GB, 195/4GC, 195/4GD, 195/4GE, 195/4GF, 195/4GG, 195/4GH, 195/4GI, 195/4GJ, 195/4GK, 195/4GL, 195/4GM, 195/4GN, 195/4GO, 195/4GP, 195/4GQ, 195/4GR, 195/4GS, 195/4GT, 195/4GU, 195/4GV, 195/4GW, 195/4GX, 195/4GY, 195/4GZ, 195/4HA, 195/4HB, 195/4HC, 195/4HD, 195/4HE, 195/4HF, 195/4HG, 195/4HH, 195/4HI, 195/4HJ, 195/4HK, 195/4HL, 195/4HM, 195/4HN, 195/4HO, 195/4HP, 195/4HQ, 195/4HR, 195/4HS, 195/4HT, 195/4HU, 195/4HV, 195/4HW, 195/4HX, 195/4HY, 195/4HZ, 195/4IA, 195/4IB, 195/4IC, 195/4ID, 195/4IE, 195/4IF, 195/4IG, 195/4IH, 195/4II, 195/4IJ, 195/4IK, 195/4IL, 195/4IM, 195/4IN, 195/4IO, 195/4IP, 195/4IQ, 195/4IR, 195/4IS, 195/4IT, 195/4IU, 195/4IV, 195/4IW, 195/4IX, 195/4IY, 195/4IZ, 195/4JA, 195/4JB, 195/4JC, 195/4JD, 195/4JE, 195/4JF, 195/4JG, 195/4JH, 195/4JI, 195/4JJ, 195/4JK, 195/4JL, 195/4JM, 195/4JN, 195/4JO, 195/4JP, 195/4JQ, 195/4JR, 195/4JS, 195/4JT, 195/4JU, 195/4JV, 195/4JW, 195/4JX, 195/4JY, 195/4JZ, 195/4KA, 195/4KB, 195/4KC, 195/4KD, 195/4KE, 195/4KF, 195/4KG, 195/4KH, 195/4KI, 195/4KJ, 195/4KK, 195/4KL, 195/4KM, 195/4KN, 195/4KO, 195/4KP, 195/4KQ, 195/4KR, 195/4KS, 195/4KT, 195/4KU, 195/4KV, 195/4KW, 195/4KX, 195/4KY, 195/4KZ, 195/4LA, 195/4LB, 195/4LC, 195/4LD, 195/4LE, 195/4LF, 195/4LG, 195/4LH, 195/4LI, 195/4LJ, 195/4LK, 195/4LL, 195/4LM, 195/4LN, 195/4LO, 195/4LP, 195/4LQ, 195/4LR, 195/4LS, 195/4LT, 195/4LU, 195/4LV, 195/4LW, 195/4LX, 195/4LY, 195/4LZ, 195/4MA, 195/4MB, 195/4MC, 195/4MD, 195/4ME, 195/4MF, 195/4MG, 195/4MH, 195/4MI, 195/4MJ, 195/4MK, 195/4ML, 195/4MN, 195/4MO, 195/4MP, 195/4MQ, 195/4MR, 195/4MS, 195/4MT, 195/4MU, 195/4MV, 195/4MW, 195/4MX, 195/4MY, 195/4MZ, 195/4NA, 195/4NB, 195/4NC, 195/4ND, 195/4NE, 195/4NF, 195/4NG, 195/4NH, 195/4NI, 195/4NJ, 195/4NK, 195/4NL, 195/4NM, 195/4NN, 195/4NO, 195/4NP, 195/4NQ, 195/4NR, 195/4NS, 195/4NT, 195/4NU, 195/4NV, 195/4NW, 195/4NX, 195/4NY, 195/4NZ, 195/4OA, 195/4OB, 195/4OC, 195/4OD, 195/4OE, 195/4OF, 195/4OG, 195/4OH, 195/4OI, 195/4OJ, 195/4OK, 195/4OL, 195/4OM, 195/4ON, 195/4OO, 195/4OP, 195/4OQ, 195/4OR, 195/4OS, 195/4OT, 195/4OU, 195/4OV, 195/4OW, 195/4OX, 195/4OY, 195/4OZ, 195/4PA, 195/4PB, 195/4PC, 195/4PD, 195/4PE, 195/4PF, 195/4PG, 195/4PH, 195/4PI, 195/4PJ, 195/4PK, 195/4PL, 195/4PM, 195/4PN, 195/4PO, 195/4PP, 195/4PQ, 195/4PR, 195/4PS, 195/4PT, 195/4PU, 195/4PV, 195/4PW, 195/4PX, 195/4PY, 195/4PZ, 195/4QA, 195/4QB, 195/4QC, 195/4QD, 195/4QE, 195/4QF, 195/4QG, 195/4QH, 195/4QI, 195/4QJ, 195/4QK, 195/4QL, 195/4QM, 195/4QN, 195/4QO, 195/4QP, 195/4QQ, 195/4QR, 195/4QS, 195/4QT, 195/4QU, 195/4QV, 195/4QW, 195/4QX, 195/4QY, 195/4QZ, 195/4RA, 195/4RB, 195/4RC, 195/4RD, 195/4RE, 195/4RF, 195/4RG, 195/4RH, 195/4RI, 195/4RJ, 195/4RK, 195/4RL, 195/4RM, 195/4RN, 195/4RO, 195/4RP, 195/4RQ, 195/4RR, 195/4RS, 195/4RT, 195/4RU, 195/4RV, 195/4RW, 195/4RX, 195/4RY, 195/4RZ, 195/4SA, 195/4SB, 195/4SC, 195/4SD, 195/4SE, 195/4SF, 195/4SG, 195/4SH, 195/4SI, 195/4SJ, 195/4SK, 195/4SL, 195/4SM, 195/4SN, 195/4SO, 195/4SP, 195/4SQ, 195/4SR, 195/4SS, 195/4ST, 195/4SU, 195/4SV, 195/4SW, 195/4SX, 195/4SY, 195/4SZ, 195/4TA, 195/4TB, 195/4TC, 195/4TD, 195/4TE, 195/4TF, 195/4TG, 195/4TH, 195/4TI, 195/4TJ, 195/4TK, 195/4TL, 195/4TM, 195/4TN, 195/4TO, 195/4TP, 195/4TQ, 195/4TR, 195/4TS, 195/4TT, 195/4TU, 195/4TV, 195/4TW, 195/4TX, 195/4TY, 195/4TZ, 195/4UA, 195/4UB, 195/4UC, 195/4UD, 195/4UE, 195/4UF, 195/4UG, 195/4UH, 195/4UI, 195/4UJ, 195/4UK, 195/4UL, 195/4UM, 195/4UN, 195/4UO, 195/4UP, 195/4UQ, 195/4UR, 195/4US, 195/4UT, 195/4UU, 195/4UV, 195/4UW, 195/4UX, 195/4UY, 195/4UZ, 195/4VA, 195/4VB, 195/4VC, 195/4VD, 195/4VE, 195/4VF, 195/4VG, 195/4VH, 195/4VI, 195/4VJ, 195/4VK, 195/4VL, 195/4VM, 195/4VN, 195/4VO, 195/4VP, 195/4VQ, 195/4VR, 195/4VS, 195/4VT, 195/4VU, 195/4VV, 195/4VW, 195/4VX, 195/4VY, 195/4VZ, 195/4WA, 195/4WB, 195/4WC, 195/4WD, 195/4WE, 195/4WF, 195/4WG, 195/4WH, 195/4WI, 195/4WJ, 195/4WK, 195/4WL, 195/4WM, 195/4WN, 195/4WO, 195/4WP, 195/4WQ, 195/4WR, 195/4WS, 195/4WT, 195/4WU, 195/4WV, 195/4WW, 195/4WX, 195/4WY, 195/4WZ, 195/4XA, 195/4XB, 195/4XC, 195/4XD, 195/4XE, 195/4XF, 195/4XG, 195/4XH, 195/4XI, 195/4XJ, 195/4XK, 195/4XL, 195/4XM, 195/4XN, 195/4XO, 195/4XP, 195/4XQ, 195/4XR, 195/4XS, 195/4XT, 195/4XU, 195/4XV, 195/4XW, 195/4XX, 195/4XY, 195/4XZ, 195/4YA, 195/4YB, 195/4YC, 195/4YD, 195/4YE, 195/4YF, 195/4YG, 195/4YH, 195/4YI, 195/4YJ, 195/4YK, 195/4YL, 195/4YM, 195/4YN, 195/4YO, 195/4YP, 195/4YQ, 195/4YR, 195/4YS, 195/4YT, 195/4YU, 195/4YV, 195/4YW, 195/4YX, 195/4YY, 195/4YZ, 195/4ZA, 195/4ZB, 195/4ZC, 195/4ZD, 195/4ZE, 195/4ZF, 195/4ZG, 195/4ZH, 195/4ZI, 195/4ZJ, 195/4ZK, 195/4ZL, 195/4ZM, 195/4ZN, 195/4ZO, 195/4ZP, 195/4ZQ, 195/4ZR, 195/4ZS, 195/4ZT, 195/4ZU, 195/4ZV, 195/4ZW, 195/4ZX, 195/4ZY, 195/4ZZ, 195/4AAA, 195/4AAB, 195/4AAC, 195/4AAD, 195/4AAE, 195/4AAF, 195/4AAG, 195/4AAH, 195/4AAI, 195/4AAJ, 195/4AAK, 195/4AAL, 195/4AAM, 195/4AAN, 195/4AAO, 195/4AAP, 195/4AAQ, 195/4AAR, 195/4AAS, 195/4AAT, 195/4AAU, 195/4AAV, 195/4AAW, 195/4AAX, 195/4AAZ, 195/4AAA, 195/4AAB, 195/4AAC, 195/4AAD, 195/4AAE, 195/4AAF, 195/4AAG, 195/4AAH, 195/4AAI, 195/4AAJ, 195/4AAK, 195/4AAL, 195/4AAM, 195/4AAN, 195/4AAO, 195/4AAP, 195/4AAQ, 195/4AAR, 195/4AAS, 195/4AAT, 195/4AAU, 195/4AAV, 195/4AAW, 195/4AAX, 195/4AAZ, 195/4AAA, 195/4AAB, 195/4AAC, 195/4AAD, 195/4AAE, 195/4AAF, 195/4AAG, 195/4AAH, 195/4AAI, 195/4AAJ, 195/4AAK, 195/4AAL, 195/4AAM, 195/4AAN, 195/4AAO, 195/4AAP, 195/4AAQ, 195/4AAR, 195/4AAS, 195/4AAT, 195/4AAU, 195/4AAV, 195/4AAW, 195/4AAX, 195/4AAZ, 195/4AAA, 195/4AAB, 195/4AAC, 195/4AAD, 195/4AAE, 195/4AAF, 195/4AAG, 195/4AAH, 195/4AAI, 195/4AAJ, 195/4AAK, 195/4AAL, 195/4AAM, 195/4AAN, 195/4AAO, 195/4AAP, 195/4AAQ, 195/4AAR, 195/4AAS, 195/4AAT, 195/4AAU, 195/4AAV, 195/4AAW, 195/4AAX, 195/4AAZ, 195/4AAA, 195/4AAB, 195/4AAC, 195/4AAD, 195/4AAE, 195/4AAF, 195/4AAG, 195/4AAH, 195/4AAI, 195/4AAJ, 195/4AAK, 195/4AAL, 195/4AAM, 195/4AAN,



MEGHMANI FINECHEM LIMITED

REG. OFF: Ch-1, CH-2, Goda Road, Industrial Estate, Charing, Tal. Vagra, Bhavnagar, Gujarat-392130
 Phone : 07971176100, Fax : 07972975905, Email : info@meghmanifinechem.com
 Website : <http://www.meghmanifinechem.com>

NOTICE TO SHAREHOLDERS

For transfer of shares to the Investor Education and Protection Fund (IEPF) Account

This notice is published pursuant to the provisions of Section 124(b) of the Companies Act, 2013 read with Investor Education and Protection Fund (IEPF) Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2018 (the "IEPF Rules") which came into effect from 7th September 2016, stipulates that shares on which dividend has not been encashed or claimed for Seven (7) consecutive years or more, than such shares are to be transferred to the Investor Education and Protection Fund (IEPF) Account constituted by the Government of India under Section 125 of the Companies Act, 2013.

Accordingly, Meghmani Finechem Limited (the "Company") has sent a letter dated 14th July, 2021, to transfer the shares of the Company issued to those shareholders of Meghmani Organics Limited [MOL] [CIN:124110G19959P.G024052 [under the Scheme] whose dividend remained unpaid or unclaimed for a period of seven consecutive years, to the IEPF Account established by the Central Government.

Further, inform that the Composite Scheme of Arrangement between Meghmani Organics Limited ("Transferor Company"), Meghmani Organochem Limited ("Resulting Company"), Meghmani Finechem Limited ("Transferee Company") and their respective Shareholders and Creditors under Sections 230 to 232 read with Section 16 and other applicable provisions of the Companies Act, 2013 ("Scheme") has been sanctioned by the Hon'ble National Company Law Tribunal, Ahmedabad Bench vide its order dated 31st May 2021 and the same has been made effective from 10th May 2021. In terms of the Scheme, all the shareholders of MOL, whose names appeared in the Register of Members and records of the depositary as on the Record Date i.e. 19th May 2021 that have been allotted equity shares of the Company in the ratio as mentioned in the Scheme, by way of credit to IEPF Account.

Therefore, Notice is hereby given to the shareholders that the Company will proceed to initiate action for transfer of shares of the shareholders whose dividend remained unclaimed in MOL from financial year 2013-14 onwards with 30 days from the date of this notice without any further notice as per the amended Rules.

As per amended Rules, the concerned shareholders holding shares in physical form and whose shares are liable to be transmitted to IEPF, may please note that the Company would be issuing new share certificate held by them for the purpose of conversion into DEMAT form and subsequent transfer shares issued in DEMAT accounts opened by the IEPF Authority with CDSL through SBICAP Securities Limited. Upon such issue, the original share certificate which is registered in the name of the shareholder as mentioned herein above shall be cancelled and be deemed null and void in case of shareholders holding shares in demat form, the transmission of shares in DEMAT account of the IEPF Authority will be by way of corporate action through their respective Depository.

A list of such shareholders of MOL, who have not claimed/encashed their dividends of MOL, for seven consecutive years and whose shares are therefore liable to transfer to the IEPF Account, is uploaded on the website of the Company <https://www.meghmanifinechem.com/investor-relations>. Respectably, the Equity Shares of MOL issued under the Scheme as mentioned herein above shall be transferred to IEPF if the shareholders fail to claim/encash the unpaid dividend of FY 2013-14.

Please note that no claim shall lie against the Company in respect of unclaimed dividend amount and shares transferred to IEPF pursuant to the said Rules. Please also note that, upon such transfer, shareholders can claim the transferred shares along with dividends from the IEPF, for which details are available at www.iepf.gov.in

For information/clarifications on this matter, concerned shareholders may write to or contact RTA Ms. Linkine Linkine India Pvt. Ltd., 5th Floor, 506 To 508, Amanath Business Centre-1 (ABC-1), Beside Ganga Business Centre, Nr. St. Xavier's College Group, Off C.G Road, Navrangpura/Ahmedabad-380009, Tel No. 079-26465179, e-mail: iepf.shares@linkintime.co.in

For, Meghmani Finechem Limited
 Kamlesh Mehta
 Company Secretary

Place : Ahmedabad

Hy India Limited,

mefirstindia.com

હોમ સુરક્ષિત મિલકતના વેચાણની નોટિસ- (અધિનિયમ ૮(૬) ઢેઠળ નોટિસ)

(જો કે કુપા કરી ચમાડી નીકે આગવ તારીખના રોજ તમને મોકલવામાં આવેલી નોટિસના હર્દનંબર અને જાણ કરી કરી કે સમજાસામન્ય માટે)

એ (**Private Treaty**) કરનાર વેચાણ અને કુપામાં રાખી છે. આથી, તે ઢેઠળ સ્થળ અધિનિયમ અને નિકાસની જેન્ચરફાળોની શરતોમાં, અને અધિનિયમના લેવાવા અંગેના નમ્બર દ્વારા ઢેઠળ પ્રિસ્તાવના નમ્બર ડોમેઇન અધિકારી માટે પૂર્ણક વિના રહેશે.

કિયાન્સ નોટિસ ની બાકી રકમ (રૂ.માં)	વેચાણ નોટિસની તારીખ	અખબાર	ઈ-ફારાજીની તારીખ	અનામત કિંમત (રૂ.માં)	અધિકૃત અધિકારીના સર્પિઝ નંબર
₹. ૭૫૧,૦૯૮	૧૪-૦૬-૨૦૨૧	કર્લાનાલીકા સેલ સેલસેસ (અંગ્રેજી+ગુજરાતી)	૧૫-૦૬-૨૦૨૧	૧૧,૪૭,૦૦૦	૯૮૮૮૮૮૬૪૮

અમીની ફારાજી વેચાણ કરવામાં આવશે અને બાકી રકમ, જો કોઈ હોય તો, બાયજ અને ખર્ચ સહીત વસુલાવામાં આવશે.

સહી/- અધિકૃત અધિકારી, હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કંપની ઇન્ડિયા લીમિટેડ

Hy India Limited,

mefirstindia.com

નોટીસ

સિસ્ટરફિટી ઈન્વેસ્ટર (ઓન્જોસેમ્બે) અધિનિયમ ૨૦૦૨ ની કલમ ૮(૬) ની સિસ્ટરફિટી

આ સિસ્ટરફિટી ફાઇનાન્સ કંપની ઇન્ડિયા લિ.ના અધિકૃત અધિકારી દ્વારા વેચા બાકી વેચાણ વગર એ વેચા બાયજની ઉપર જેમ થશે જે છે', અને 'જ્યાં છે, જે છે' અને 'જે કંઈ છે તે જ' ના આધાર પર વેચાવામાં આવશે. હોમ ફર્સ્ટ ફાઇનાન્સ

કળને લીધેના તારીખ	રીઝર્વ કિંમત (રૂ.)માં	ઈએમડી (રૂ.)માં	ઈ-ફારાજીની તારીખ અને સમય	ઈએમડી અને ટ્રાન્સપેર જમા કરવાની છેલ્લી તારીખ અને સમય	અધિકૃત અધિકારીના સર્પિઝ નંબર
૦૭-૦૬-૨૦૨૧	૧૦,૩૩,૬૦૦	૧૦,૩૩,૬૦૦	૦૬-૦૮-૨૦૨૧ (સાથે ૧૧ થી ગરમે ૨)	૦૭-૦૮-૨૦૨૧ (સાથે ૧ વાગ્યા પહેલાં)	૯૮૮૮૮૮૬૪૮

શાખા IFSC કોડ	લાભાર્થીનું નામ
UTIB0000395	અધિકૃત અધિકારી, હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કંપની ઈન્ડિયા લિમિટેડ,

ફોર્મ, જાહેરાત, સામાન્ય નિયમો એ શરતો ઓનલાઈન સેલ પોર્ટલ સાઈટ પર ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે મેલિસ્ટ પર અસર કરતી બાબતો અંગેની પોતાની સ્વતંત્ર પુષ્કળ કરી લેવી. ઈ-ફારાજીની જાહેરાત રવાના કરવા દ્વારા કોઈપણ રીતે જવાબદાર રહેશે નહીં. તેલુગુરીટાઈગ્રેશન અને રીફરન્સકેશન ઓફ ફાઇનાન્સીયલ એસેટ્સ

આવશે અને બાકી રકમ બાકી રહેશે, જો કોઈ હોય તો, બાયજ અને કિંમત સાથે પુનઃઆસ કરવામાં આવશે.

અધિકૃત અધિકારી - હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કંપની ઇન્ડિયા લિમિટેડ

BLOOM DEKOR LIMITED				
CIN: L20210G1992PLC017341				
Regd. Office: Block No. 267, Village Oran, Taluka Prantij, N. H. 8, Dist. Sabarkantha, North Gujarat-383 205.				
Corporate Office: 2/F, Sumel, S. G. Highway Road, Thaltej, Ahmedabad-380 059, Gujarat.				
Tel. Phone: +91 - 79 - 2684 1916/17. Fax: +91 - 79 - 2684 1914 E-mail: redressal@bloomdekor.com. Website: www.bloomdekor.com				
Unaudited Financial Result For The Quarter Ended On June 30, 2021				
Particulars	Quarter ended on 30/06/2021	Quarter ended on 31/03/2021	Quarter ended on 30/06/2020	
	Unaudited	Audited	Unaudited	(₹ in Lakhs except EPS)
Total Income From Operations	661.89	3,167.17	440.83	
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	(216.56)	(1,014.11)	(165.48)	
Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	(216.56)	(1,014.11)	(165.48)	
Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	(186.06)	(770.22)	(127.02)	
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(184.82)	(765.28)	(126.85)	
Equity Share Capital	685.00	685.00	685.00	
Reserves (excluding Revaluation Reserve as per the audited Balance Sheet of the previous year)	-	(1,288.94)	-	
Earnings Per Share (for continuing and discontinued operations)-				
Basic: (not annualized for the quarter ended)	(2.72)	(11.24)	(1.85)	
Diluted: (not annualized for the quarter ended)	(2.72)	(11.24)	(1.85)	

Note:- The above financial is an extract of the detailed format of quarterly Financial Results filed with the BSE Limited under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015. The full format of the quarterly Financial Results are available on the Website of BSE Limited at www.bseindia.com and Company's website at www.bloomdekor.com.

Date: August 13, 2021
Place: Ahmedabad

For, Bloom Dekor Limited
Sd/-
Dr. Sunil Gupta
Managing Director (DIN 00012572)

THEMIS MEDICARE LIMITED										
CIN NO : L24110G1969PLC001590										
Regd. Off. Plot No. 69A, GIDC Indl. Estate, Vapi - 396195, Dist Valsad, Gujarat. (T) 0260-2431447 / 0260-2430219.										
Corporate Office : 11/12, Udyog Nagar, S. V. Road, Goregaon (West), Mumbai-400 104.										
Email ID : themis@themismedicare.com . Website Address : www.themismedicare.com .										
EXTRACT OF THE UNAUDITED STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER & THREE MONTHS ENDED JUNE 30, 2021 (₹ in Lakhs)										
Sl. No.	Particulars	STANDALONE			CONSOLIDATED			Quarter Ended	Year to date	Year to date
		30.06.2021	30.06.2020	31.03.2021	30.06.2021	30.06.2020	31.03.2021			
		(Unaudited)	(Unaudited)	(Audited)	(Unaudited)	(Unaudited)	(Audited)			
1	Total Income from Operations	11,250.35	4,848.54	6,177.35	23,066.98	11,250.35	4,848.54	6,177.33	23,066.98	
2	Net Profit / (Loss) for the period before Tax and Exceptional Items	3,580.50	752.47	802.05	3,224.83	4,026.95	973.39	925.72	4,135.07	
3	Net Profit / (Loss) for the period before Tax	3,580.50	752.47	802.05	3,224.83	4,026.95	973.39	925.72	4,135.07	
4	Net Profit / (Loss) for the period after Tax	2,673.36	564.36	681.59	2,662.05	3,119.81	775.28	805.26	3,570.29	
5	Total Comprehensive Income for the period	2,665.40	562.27	656.01	2,630.20	3,112.69	779.14	760.65	3,529.56	
6	Equity Share Capital	919.40	918.80	918.85	918.85	919.40	918.80	918.85	918.85	
7	Other equity (excluding Revaluation Reserve)	-	-	-	14,204.20	-	-	-	17,474.63	
8	Earnings Per Share									
1. Basic		29.08	6.14	7.42	28.97	33.93	8.44	8.76	38.86	
2. Diluted		29.03	6.14	7.42	28.96	33.88	8.44	8.76	38.84	

Notes:- The above is an extract of the detailed format of Quarterly Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Results are available on the Stock Exchange website viz. www.bseindia.com & www.nseindia.com and on the Company's website: www.themismedicare.com

For Themis Medicare Ltd
Sd/-
Dr. Sachin D. Patel
Managing Director & CEO
DIN:00033353

Place: Mumbai
Date: August 13, 2021

JINDAL WORLDWIDE LIMITED						
Regd. & Corp. Off: "Jindal House", Opp. Dmart, I.O.C. Petrol Pump Lane, Shivranjani Shyamal 132 F Ring Road, Satellite, Ahmedabad-380015 • Ph: 079-71001500 CIN: L17110G1986PLC008942 • E-mail id: csjindal@jindalworldwide.com • Website: www.jindalworldwide.com						
STATEMENT OF STANDALONE & CONSOLIDATED UN-AUDITED FINANCIAL RESULTS (AS PER SCHEDULE III OF COMPANIES ACT, 2013 AND IND-AS) For the Quarter ended 30th June, 2021 (Pursuant to Regulation 47(1)(b) of SEBI (LODR) Regulations, 2015) (₹ in Lakhs except EPS)						
Sr. No.	Particulars	Quarter Ended			Year Ended	
		3 months ended on 30th June, 2021	3 months ended on 31st March, 2021	3 months ended on 30th June, 2020	Previous Financial Year ended 31st March, 2021	
		(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)	
STANDALONE						
1	Total income from operations (net)	51921.37	64713.65	4732.60	170969.63	
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	2341.71	2673.17	(1747.47)	6200.28	
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	2341.71	2673.17	(1747.47)	6200.28	
4	Net Profit / (Loss) for the period after tax (after exceptional and/or Extraordinary Items)	1762.65	1767.53	(1320.82)	4409.83	
5	Total Comprehensive Income for the period after share of profit after associates and minority interest (Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax))	1762.65	1767.53	(1320.82)	4409.83	
6	Equity Share Capital	2005.20	2005.20	2005.20	2005.20	
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet as at Financial Year ended 31st March, 2021.	N.A.	N.A.	N.A.	39977.20	
8	Earnings per share (of Rs. 1/- each) (for continuing and discontinued operations) : 1. Basic :	0.88	0.88	(0.66)	2.20	
	2. Diluted :	0.88	0.88	(0.66)	2.20	
CONSOLIDATED						
1	Total income from operations (net)	52442.54	64185.07	5453.22	169961.52	
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	2517.26	2539.56	(1651.11)	6241.09	
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	2517.26	2539.56	(1651.11)	6241.09	
4	Net Profit / (Loss) for the period after tax (after exceptional and/or Extraordinary Items)	1889.32	1629.16	(1225.95)	4420.48	
5	Total Comprehensive Income for the period after share of profit after associates and minority interest (Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax))	1889.54	1629.03	(1489.83)	4420.82	
6	Equity Share Capital	2005.20	2005.20	2005.20	2005.20	
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet as at Financial Year ended 31st March, 2021.	N.A.	N.A.	N.A.	40038.94	
8	Earnings per share (of Rs. 1/- each) (for continuing and discontinued operations) : 1. Basic :	0.94	0.81	(0.74)	2.20	
	2. Diluted :	0.94	0.81	(0.74)	2.20	
Notes:						
1. The above Un-Audited Standalone & Consolidated Financial Results of the Company for the quarter ended 30th June, 2021 have been reviewed and recommended by the Audit Committee and are approved by the Board of Directors at their respective meeting held on 13th August, 2021.						
2. The Company has adopted, Indian Accounting Standards prescribed under Section 133 of the Companies Act, 2013 (Ind-AS) from 1st April, 2017 and accordingly these financial results and all the periods presented have been prepared in accordance with the recognition and measurement principles laid down in Ind-AS 34 "Interim Financial Reporting" read with relevant rules issued thereunder and the other accounting principles generally accepted in India and discloses the information required to be disclosed in terms of Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015 (as amended)						
3. The Statutory Auditors of the Company have carried out a Limited Review of the above Standalone & Consolidated Financial Results of the Company for the quarter ended 30th June, 2021 in terms of Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015 and have issued an unmodified Limited Review Report.						
4. The figures for the corresponding previous periods have been regrouped/rearranged wherever necessary, to make them comparable.						
5. The above is an extract of the detailed format of Un-Audited Standalone & Consolidated Financial Results for the quarter ended 30th June, 2021 filed with the Stock Exchanges (BSE & NSE) under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The detailed statement of Financial Results along with Standalone & Consolidated Indefinite Information is available on the website of BSE Limited (www.bseindia.com), National Stock Exchange of India Limited (www.nseindia.com) and also on the website of the Company (www.jindalworldwide.com).						
Date : 13 th August, 2021 Place : Ahmedabad						
For and On Behalf of the Board For JINDAL WORLDWIDE LIMITED Sd/- (MR. AMIT AGRAWAL) Managing Director - DIN : 00169061						
• REQUEST TO THE SHAREHOLDERS FOR UPDATION OF THEIR E-MAIL IDs: Pursuant to the circulars issued by the MCA and SEBI stating the requirement of conducting AGM upto 31st December, 2021 through Video Conferencing or other audio visual means due to ongoing COVID-19 Pandemic and in order to effectively communicate the necessary information related to AGM and such other matters of the Company to the Shareholders, the Company hereby requests to the all the shareholders to kindly update their respective E-Mail IDs and other related details with the Company Secretary or Registrar and Transfer Agent (RTA) of the Company in the manner prescribed in the Form as placed on the website of the Company.						

Notes:- 1. The above Un-Audited Standalone & Consolidated Financial Results of the Company for the quarter ended 30th June, 2021 have been reviewed and recommended by the Audit Committee and are approved by the Board of Directors at their respective meeting held on 13th August, 2021.

2. The Company has adopted Indian Accounting Standards prescribed under Section 133 of the Companies Act, 2013 (Ind-AS) from 1st April, 2017 and accordingly these financial results and all the periods presented have been prepared in accordance with the recognition and measurement principles laid down in Ind-AS 34 "Interim Financial Reporting" read with relevant rules issued thereunder and the other accounting principles generally accepted in India and discloses the information required to be disclosed in terms of Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015 (as amended).

3. The Statutory Auditors of the Company have carried out a Limited Review of the above Standalone & Consolidated Financial Results of the Company for the quarter ended 30th June, 2021 in terms of Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015 and have issued an unmodified Limited Review Report.

4. The figures for the corresponding previous periods have been regrouped/rearranged wherever necessary to make them comparable.

5. The above is an extract of the detailed format of Un-Audited Standalone & Consolidated Financial Results for the quarter ended 30th June, 2021 filed with the Stock Exchanges (BSE & NSE) under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The detailed statement of Financial Results along with Standalone & Consolidated Independent Limited Review Report is available on the website of BSE Limited (www.bseindia.com), National Stock Exchange of India Limited (www.nseindia.com) and also on the website of the Company (www.jindalworldwide.com).

For and On Behalf of the Board
For JINDAL WORLDWIDE LIMITED
Sd/- (MR. AMIT AGRAWAL)
Managing Director - DIN : 00169061

Date : 13th August, 2021
Place : Ahmedabad

• REQUEST TO THE SHAREHOLDERS FOR UPDATION OF THEIR E-MAIL IDS:
Pursuant to the circulars issued by the MCA and SEBI stating the requirement of conducting AGM upto 31st December, 2021 through Video Conferencing or other audio visual means due to ongoing COVID-19 Pandemic and in order to effectively communicate the necessary information related to AGM and other related matters of the Company to the Shareholders, the Company hereby requests to the all the shareholders to kindly update their respective E-Mail IDs and other related details with the Company Secretary or Registrar and Transfer Agent (RTA) of the Company in the manner prescribed in the Form as placed on the website of the Company.

SBI
Platform Engineering-II, Global IT Centre, Sector 11,
CBD Belapur, Navi Mumbai - 400 614

NOTICE INVITING TENDERS
State Bank of India has floated an open RFP NO. SBI/GITC/Platform Engineering-II/2021-2022/788 Dated 12th August 2021 for Procurement of Bulk SMS Services (Transactional, Informational and Promotional Categories) in general text for State Bank Group. For details, please see "Procurement News" at Bank's website <https://bank.sbi>

Place: Navi Mumbai
Date: 14.08.2021

Deputy General Manager
(Platform Engineering-II)

NATIONAL ENTREPRENEURSHIP RESOURCE & CO-ORDINATION HUB (NATIONAL E-HUB) PRADHAN MANTRI YUVA YOJANA
(Ministry of Skill Development and Entrepreneurship, Government of India)
NIESBUD, A-23, Sector-62, Noida, U.P.

VACANCIES
National E-Hub, invites applications for the Post of **Support Team Member (STM)** Finance in National E-Hub at Noida under the Scheme purely on contractual basis up to March 2022.

Sr. Name of the No.	Post	No.	Remuneration (Per Month)
1.	STM-Finance	01	Rs. 50,000/- per month (Maximum) commensurate with the experience and last drawn salary.

Edu. Qualification - Post Graduate in relevant fields
Min. Exp- 05 Years Maximum Age-35 years
The relevant details are available www.niesbud.nic.in Applications can be mailed to ashish.panyav@nic.in latest by 5.00 P.M. on 27.08.2021.

National Project Director

VEER NARMAD SOUTH GUJARAT UNIVERSITY
UDHNA - MAGDALLA ROAD, SURAT.
(Re-Accredited by NAAC with 'A' Grade)

WALK-IN-INTERVIEW
Walk in interview is scheduled as per following details on purely contractual basis:

Sr. No.	Name of Post	Date & Reporting Time	Place
1	Research Advisor - Facilitator - 01	17-08-2021 9.00 am	Senate Hall, Administrative Building, VNSGU Campus, Surat.
2	Statistical Analyst - 01		

All eligible candidate are informed attend the interview alongwith all original documents and attested photo copies of the documents. No TADA will be paid for attending the interview. For more details visit website www.vnsgu.ac.in

No. : GEN / East / 11856 / 2021.
Dt. : 10.08.2021

Ic. REGISTRAR

एसजीवन लिमिटेड SJVN Limited
(A Joint Venture of Govt. of India & Govt. of H.P.)
CIN No. L40101HP1986GCO05499

CAREER OPPORTUNITIES IN A GROWING ORGANISATION
Corrigendum of Advt. No. 94/2021

Refer advertisement no. 94/2021 published on 22.07.2021 in Indian Express and Dainik Bhaskar, on 27.07.2021 in Hindustan Times (Shine) and on 31.07.2021 in Employment News regarding recruitment of Field Engineers in SJVN on Fixed Tenure Basis through GATE. The selection process of the aforesaid advt. may be read as normalized GATE score obtained (out of 1000) instead of 100 in the corresponding paper of GATE 2021/2020/2019 (score with which applied), Group Discussion & Personal Interview. The last date of submitting online applications has been extended till 27/08/2021. All the other terms & conditions of the advertisement remain unaltered. For details, please visit our website www.sjvn.nic.in

SHARED VISION: 5000MM by 2023, 12000MM by 2030 and 25000 MM by 2040

SHREE GANESH REMEDIES LIMITED
CIN No. : L24230G1995PLC025661

Registered Office : Plot no. 6011, G.I.D.C., Ankleshwar - 393002, Gujarat, India.
Phone : 02646 227777.
Web : www.ganeshremedies.com | Email: investor@ganeshremedies.com

26th ANNUAL GENERAL MEETING
Notice is hereby given that the 26th Annual General Meeting ("AGM") of the Company will be held on Saturday, 18th September, 2021 at 11:30 a.m. through video conference ("VC") / Other Audio-Visual Means ("OAVM") to transact the business as set out in the Notice of AGM, which is being circulated to the members in due course of time.

In view of the continuing covid-19 Pandemic, the Ministry of Corporate Affairs vide its Circular No. 14/2020 dated April 8, 2020, Circular No. 17/2020 dated April 13, 2020 and Circular No. 20/2020 dated May 5, 2020, Circular No. 02/2021 dated January 13, 2021 and Securities and Exchange Board of India ("SEBI") vide its Circulars No. SEBI/HO/CFD/CMD/1/CIRP/2020/079 dated May 12, 2020 and SEBI/HO/CFD/CMD/2/CIRP/2021/11 dated January 15, 2021 ("Circulars"), have permitted the holding of AGM through VCOAVM, without the physical presence of the members at the common venue. In compliance with these circulars and the relevant provisions of the Companies Act, 2013 and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the AGM of the members of the company will be held through VCOAVM.

In accordance with the aforesaid Circulars, Notice of AGM along with the Annual Report 2020-21 is being sent only through electronic mode to those members whose email addresses are registered with Company/Depositories. Members may note that the notice of AGM and Annual Report will be available on the Company's website www.ganeshremedies.com, website of the stock exchange i.e. BSE Limited at www.bseindia.com and the AGM notice is also available on the website of CDSL (agency for providing the Remote e-voting facility) i.e. www.evotingindia.com members can attend and participate in the AGM through the VCOAVM facility only. The instructions for joining the AGM are provided in the notice of the AGM. Members attending the AGM through VCOAVM shall be counted for the purpose of reckoning the quorum as per section 103 of the Companies Act, 2013.

The company is providing the remote e-voting facility ("Remote e-voting") to all its members to cast their votes on all resolutions as set out in the Notice of AGM. Additionally, the Company is providing facility of voting through e-voting system during the AGM ("e-voting"). The manner of voting by the members holding shares in the dematerialised mode, physical mode and for members who have not registered their email address has been provided in the notice of AGM.

In case member(s) have not registered their email addresses with the Company/Depository, please follow the below instructions to register email addresses for obtaining Annual Report.

a. members can get their e-mail id registered by contacting their respective Depository Participant or by email to investors@ganeshremedies.com

The 26th AGM notice will be sent to the shareholders holding shares as on cut-off for the dispatch in accordance with the applicable laws on their registered e-mail addresses in due course.

Manner of requesting mandate for receiving dividend:
Members are requested to register/update their complete bank details: with their Depository Participants with whom they maintain their demat accounts, if shares are held in dematerialised mode by submitting forms and documents as may be required by Depository Participant(s). In case of any queries pertaining to evolving, members may refer to frequently asked questions ("FAQ") and the evolving manual available at www.evotingindia.com under help section or write an email to helpdesk.evoting@cdslindia.com or call 022-23098542/43. All grievances connected with the facility for voting by electronic means may be addressed to Mr. Rakesh Dalvi, Manager, Central Depository Services (India) Limited, A Wing, 28th Floor, Marathon Futurex, Marolli Mill Compounds, N. M. Joshi Marg, Lower Panel (East), Mumbai - 400013 or send an email to helpdesk.evoting@cdslindia.com or call 022-23098542/43.

For Shree Ganesh Remedies Limited
Sd/-
Chandulal Manubhai Kothia
Managing Director
DIN: 00652806

Place : Ankleshwar
Date : 13th August, 2021

Gross Premium ₹ 14,290 CRORE

Net Worth ₹ 50,674 CRORE

Solvency Ratio 1.74

REVIEWED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE 2021

Sr. No.	Particulars	Quarter ended	
		30.06.2021	30.06.2020
1	Premium Income (Gross)	14,289.92	15,881.55
2	Net Profit/(Loss) After tax	(771.73)	(557.47)
3	Paid up Equity share capital	877.20	877.20
4	Net Worth (including Fair Value change account)	50,673.76	39,071.36
5	Total Assets	142,454.14	129,291.31
6	Solvency Ratio	1.74	1.52

Notes:
a) Premium income is Gross written premium, gross of reinsurance and net of applicable taxes.
b) The above is an extract of the detailed format of quarterly and year to date Financial results filed with the stock exchanges under Regulation 33 and Regulation 52 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulations 2015. The full format of the quarterly and year to date Financial results are available on the websites of Stock exchanges (www.bseindia.com and www.nseindia.com) and the Corporation (www.gicofindia.com)

For and on behalf of the Board Directors
Sd/-
Devesh Srivastava
Chairman and Managing Director
DIN Number: 08646006

Place: Mumbai
Date: 13th August, 2021

General Insurance Corporation of India
"Suraksha", 170, Jamshedji Tata Road, Churchgate, Mumbai - 400 020, India • Email: info@gicofindia.com • Tel.: + 91 22 22867000
CIN : L67220MH1972GOI016133 www.gicofindia.com IRDAI Registration No: 112

Ahmedabad



Shruti Infrastructure Development Corporation Limited
 Regd. Office : Plot No. X - 1, 2 & 3, Block-EP Sector V, Salt Lake City, Kolkata-700 091
 CIN : L65922WB1990PLC049541
 Phone No. : (033) 4020 2020 / 4015 4646, Fax No. : (033) 4020 2099
 E-mail : investor.relations@shruticorp.com, Website : www.shruticorp.com

EXTRACT OF UNAUDITED STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE, 2021

Sl. No.	Particulars	STANDALONE				CONSOLIDATED			
		Quarter ended		Year ended		Quarter ended		Year ended	
		30.06.2021	31.03.2021	30.06.2020	31.03.2021	30.06.2021	31.03.2021	30.06.2020	31.03.2021
		Unaudited	Audited	Unaudited	Audited	Unaudited	Audited	Unaudited	Audited
1	Total Income from operations	1,347.84	2,214.48	179.53	4,931.80	4,162.12	11,023.12	2,915.07	36,798.78
2	Net Profit / (Loss) for the period (before Tax and Exceptional Items)	(1,223.57)	(376.67)	(811.70)	(1,444.19)	(2,178.94)	753.64	(3,505.33)	(5,880.82)
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional Items)	(1,223.57)	(14,208.54)	(811.70)	(15,276.06)	(2,178.94)	321.74	(3,505.33)	(6,312.72)
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional Items)	(1,377.57)	(14,929.23)	(896.07)	(15,881.12)	(2,362.50)	(2,310.87)	(3,389.42)	(8,856.13)
5	Total Comprehensive Income for the period (Comprising Profit/Loss) for the period (after tax and Other Comprehensive Income (OCI) after tax)	(1,379.12)	(14,936.36)	(895.16)	(15,887.33)	(2,364.05)	(2,339.20)	(3,389.42)	(8,863.55)
6	Equity Share Capital (Face value of Rs. 10/- each)	2,220	2,220	2,220	2,220	2,220	2,220	2,220	2,220
7	Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of the previous year)	-	-	-	8,509.04	-	-	-	9,379.63
8	Earnings per Share (of Rs. 10/- each)	(6.21)	(67.25)	(3.14)	(71.54)	(10.64)	(10.41)	(15.27)	(39.89)
9	Diluted (Rs.)	(6.21)	(67.25)	(3.14)	(71.54)	(10.64)	(10.41)	(15.27)	(39.89)

Note: 1. The above audited financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on 13th August, 2021. 2. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange website i.e. BSE website (www.bseindia.com), Calcutta Stock Exchange Limited (www.cse-india.com) and Company's website (www.shruticorp.com).

For and on behalf of the Board of Directors
Shruti Infrastructure Development Corporation Limited
 Sd/-
 Managing Director

Place : Kolkata
 Date : 13th August, 2021



CIL NOVA PETROCHEMICALS LIMITED

Survey No. 396 (P), 395/4 (P), Moraiya Village, Sarkhej - Bavla Highway,
 Tal.: Sanand, Ahmedabad - 382210 CIN: L71111GJ2003PLC043354
 Contact No. +919825800060, 9825104042 Fax: +91 250556, 251612
 Email: investor.grievances.cilnova@chirpalgroup.com, website: www.cnpl.com



EXTRACT OF UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 30TH JUNE, 2021

(Rs. in Lakhs except Earnings per Share)

Sr. No.	Particulars	Quarter ended on 30th June, 2021	Year ended on 31st March, 2021	Quarter ended on 30th June, 2020	Year ended on 31st March, 2021
		Un-audited	Audited	Un-audited	Audited
1.	Total income from operations (net)	5855.74	8355.54	179.01	15581.26
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	317.53	634.01	(199.90)	645.12
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	317.53	634.01	(199.90)	645.12
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	264.52	523.74	(199.90)	533.12
5.	Total Comprehensive Income for the period (Comprising Profit/Loss) for the period after tax and other Comprehensive Income (OCI) after tax	0.00	4.40	2.32	4.40
6.	Paid-Up Equity Share Capital (Face value Rs. 10/- Per Share)	2710.00	2710.00	2710.00	2710.00
7.	Basic and Diluted Earnings Per Share (before and after extra-ordinary items) (of Rs. 10/- each)	0.98	1.93	(0.74)	1.97

1. The above Un-audited Financial Results were reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on 30th June, 2021.

2. Figures for the previous year have been regrouped, recast and rearranged, wherever necessary.

3. The above is an extract of the detailed format of Unaudited financial result of the company for the quarter and year ended on 30th June, 2021, filed with stock exchanges under regulation 33 of SEBI (LODR) Regulations, 2015. The full format of Un-audited Financial Results of the company for the quarter ended 30th June, 2021 is available on the company's website at www.cnpl.com and on the website of Stock Exchange www.bseindia.com.

For, CIL Nova Petrochemicals Limited

Sd/-

Jyotiprasad Chirpal

Chairman (DIN: 00155695)

Date : 30th June, 2021

Place : Ahmedabad



JINDAL WORLDWIDE LIMITED

Regd. & Corp. Off: "Jindal House", Opp. Mart, I.O.C. Petrol Pump Lane, Shivrangnani Shyamal
 132 F Ring Road, Satellite, Ahmedabad-380015 • Ph: 079-71001500
 CIN: L71110GJ1986PLC080942 • E-mail Id: cs.jindal@jindalworldwide.com • Website: www.jindalworldwide.com

STATEMENT OF STANDALONE & CONSOLIDATED UN-AUDITED FINANCIAL RESULTS (AS PER SCHEDULE III OF COMPANIES ACT, 2013 AND IND-AS)

For the Quarter ended 30th June, 2021

(Pursuant to Regulation 47(1)(b) of SEBI (LODR) Regulations, 2015) (Rs. in Lakhs except EPS)

Sr. No.	Particulars	Quarter Ended			
		3 months ended of C.Y.	Preceding 3 months ended of C.Y.	Corr. 3 months ended in P.Y.	Previous Financial Year ended
		30th June, 2021	31st March, 2021	30th June, 2020	31st March, 2021
		(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)
STANDALONE					
1	Total Income from operations (net)	51921.37	64713.65	4732.60	170969.63
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	2341.71	2673.17	(1747.47)	6200.28
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	2341.71	2673.17	(1747.47)	6200.28
4	Net Profit / (Loss) for the period after tax (after exceptional and/or Extraordinary Items)	1762.65	1767.53	(1320.82)	4408.83
5	Total Comprehensive income for the period after share of profit after associates and minority interest [Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	1762.65	1767.53	(1320.82)	4408.83
6	Equity Share Capital	2005.20	2005.20	2005.20	2005.20
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet as at Financial Year ended 31st March, 2021.	N.A.	N.A.	N.A.	39977.20
8	Earnings per share (of Rs. 1/- each) (for continuing and discontinued operations) : 1. Basic :	0.88	0.88	(0.66)	2.20
	2. Diluted :	0.88	0.88	(0.66)	2.20
CONSOLIDATED					
1	Total Income from operations (net)	52442.54	64185.07	5453.22	169961.52
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	2517.26	2539.56	(1651.11)	6241.09
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	2517.26	2539.56	(1651.11)	6241.09
4	Net Profit / (Loss) for the period after tax (after exceptional and/or Extraordinary Items)	1889.32	1629.16	(1225.95)	4420.48
5	Total Comprehensive income for the period after share of profit after associates and minority interest [Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	1889.54	1629.03	(1489.83)	4420.82
6	Equity Share Capital	2005.20	2005.20	2005.20	2005.20
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet as at Financial Year ended 31st March, 2021.	N.A.	N.A.	N.A.	40038.94
8	Earnings per share (of Rs. 1/- each) (for continuing and discontinued operations) : 1. Basic :	0.94	0.81	(0.74)	2.20
	2. Diluted :	0.94	0.81	(0.74)	2.20

Note: 1. The above Un-Audited Standalone & Consolidated Financial Results of the Company for the quarter ended 30th June, 2021 have been reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at their respective meeting held on 13th August, 2021.

2. The Company has adopted, Indian Accounting Standards prescribed under Section 133 of the Companies Act, 2013 (Ind-AS) from 1st April, 2017 and accordingly these financial results and all the periods presented have been prepared in accordance with the recognition and measurement principles laid down in Ind-AS 34 "Interim Financial Reporting" read with relevant rules issued thereunder and the other accounting principles generally accepted in India and discloses the information required to be disclosed in terms of Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015 (as amended).

3. The Statutory Auditors of the Company have carried out a Limited Review of the above Standalone & Consolidated Financial Results of the Company for the quarter ended 30th June, 2021 in terms of Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015 and have issued an unmodified Limited Review Report.

4. The figures for the corresponding previous periods have been regrouped/rearranged, wherever necessary, to make them comparable.

5. The above is an extract of the detailed format of Un-Audited Standalone & Consolidated Financial Results for the quarter ended 30th June, 2021 filed with the Stock Exchanges (BSE & NSE) under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The detailed statement of Financial Results, along with Standalone & Consolidated Independent Limited Review Report is available on the website of BSE Limited (www.bseindia.com), National Stock Exchange of India Limited (www.nseindia.com) and also on the website of the Company (www.jindalworldwide.com).

For and On Behalf of the Board

For JINDAL WORLDWIDE LIMITED

Sd/- (MR. AMIT AGRAWAL)

Managing Director - DIN : 00169061

Date : 13th August, 2021

Place : Ahmedabad

REQUEST TO THE SHAREHOLDERS FOR UPDATING OF THEIR E-MAIL IDS:

Pursuant to the circulars issued by the MCA and SEBI stating the requirement of conducting AGM upto 31st December, 2021 through Video Conferencing or other audio visual means due to ongoing COVID-19 Pandemic and in order to effectively communicate the necessary information related to AGM and such other matters of the Company to the Shareholders, the Company hereby requests to the all the shareholders to kindly update their respective E-Mail IDs and other related details with the Company Secretary or Registrar and Transfer Agent (RTA) of the Company in the manner prescribed in the Form as placed on the website of the Company.

અમદાવાદ, શનિવાર, તા. ૧૪ ઓગસ્ટ, ૨૦૨૧

ફાયનાન્સિયલ એક્સપ્રેસ



VADILAL INDUSTRIES LIMITED

Regd. Office: "Vadilal House", Shrimati Society, Nr. Navrangpura Crossing, Navrangpura, Ahmedabad- 380 006,
 Ph.: 079-26407201-09, Fax: 079-30153102, Web: www.vadilalgroup.com,
 CIN: L91110GJ1982PLC005169, Email: shares@vadilalgroup.com

(ISO 22000:2005
 Certified by BVQI
 (BRC) (British Retail
 Consortium)
 Food Global Standard 2005)

EXTRACT OF STANDALONE & CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30th JUNE, 2021

(Rs. in Lacs except per share data)

Particulars	Standalone			Consolidated		
	Quarter ended		Year ended	Quarter ended		Year ended
	June 30, 2021	June 30, 2020	March 31, 2021	June 30, 2021	June 30, 2020	March 31, 2021
	(Unaudited)	(Unaudited)	(Audited)	(Unaudited)	(Unaudited)	(Audited)
Total Income from operations	13196.48	5225.02	36856.19	16710.24	7516.39	48032.64
Net Profit for the period before tax, Exceptional Items/ Extraordinary Items	295.50	(2043.52)	(3170.71)	1780.39	(1478.85)	768.48
Net Profit for the period before tax	295.50	(2043.52)	(3170.71)	1780.39	(1478.85)	768.48
Net Profit for the period after tax	227.22	(1533.60)	(2409.82)	1270.49	(1140.10)	462.76
Total Comprehensive Income for the Period	225.72	(1540.26)	(2407.37)	1316.11	(1147.19)	401.86
Equity Share Capital	718.78	718.78	718.78	718.78	718.78	718.78
Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of previous year)			12735.63			16864.31
Earnings Per Share (of Rs. 10 each)						
Basic :	3.16	(21.34)	(33.53)	17.67	(15.86)	6.44
Diluted:	3.16	(21.34)	(33.53)	17.67	(15.86)	6.44

Note :

1. The above is an extract of the detailed format of Standalone and Consolidated Unaudited Financial Results of the Company for the quarter ended on 30-06-2021 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Financial Results for the quarter ended on 30-06-2021 are available on Website of BSE, NSE as well as Company's website viz. www.vadilalgroup.com

2. The above Financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its Board Meeting held on 13th August, 2021.

FOR VADILAL INDUSTRIES LIMITED

RAJESH R. GANDHI

MANAGING DIRECTOR

Date : 13th August 2021

Place : Ahmedabad

SUVIDHAA INFOSERVE LIMITED

(CIN: L72900GJ2007PLC109642)

Registered Office: Unit No 02, 28th Floor, GIFT-II Building, Block No. 56, Road-5C, Zone-5, Gift City Gandhinagar 382355
 Corporate Office: 14, Olympus Industrial Estate, Off Mahakali Caves Road, Andheri (East), Mumbai 400093
 Tel.: + 91 9223252525 E-mail: cs@suvidhaa.com Website: www.suvidhaa.com

EXTRACT OF STATEMENT OF STANDALONE AND CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30TH JUNE, 2021

(Figures in million, except per share data and if otherwise stated)

Sr. No.	Particulars	Standalone			Consolidated		
		Quarter ended on 30/06/2021	Year ended on 31/03/2021	Quarter ended on 30/06/2020	Quarter ended on 30/06/2021	Year ended on 31/03/2021	Quarter ended on 30/06/2020
		(Unaudited)	(Audited)	(Unaudited)	(Unaudited)	(Audited)	(Unaudited)
1	Total Income	141.8	1140.5	421.1	141.8	1167.1	421.1
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	(13.7)	(68.3)	(6.8)	(15.3)	(50.1)	(12.7)
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	(13.2)	(63.3)	(6.8)	(14.8)	(45.1)	(12.7)
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	(13.2)	(58.5)	(6.8)	(14.8)	(40.3)	(12.7)
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	-	(57.9)	(6.8)	(14.8)	(39.6)	(12.7)
6	Paid-up equity share capital (Face Value of the share Rs. 1/- each)	203.3	203.3	105.7	203.3	203.3	105.7
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	1204.0	-	-	601.7	-
8	Earnings Per Share (Face value of Rs. 1/- each) (for continuing and discontinued operations) :						
	1. Basic :	(0.07)	(0.29)	(0.03)	(0.07)	(0.20)	(0.06)
	2. Diluted :	(0.07)	(0.29)	(0.03)	(0.07)	(0.20)	(0.06)

Notes:

a) The above is an extract of the detailed format of Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the websites of the Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com and on the website of the Company at www.suvidhaa.com

b) The above Financial Results are reviewed and recommended by the Audit Committee and taken on record by the Board of Directors at their meeting held on 13th August, 2021.

c) The exceptional item for the quarter ended 30th June, 2021 and twelve months ended 31st March, 2021 is on account of settlement of insurance claim.

For, Suvidhaa Infoserve Limited

Sd/-

Naresh Sharma

Managing Director

(DIN: 09071085)

Date: 13th August, 2021

Place : Mumbai



गार्डेन रीच शिपबिल्डर्स एण्ड इंजीनियर्स लिमिटेड

Garden Reach Shipbuilders & Engineers Limited

Regd & Corp Office: GRSE Bhavan, 61, Garden Reach Road, Kolkata - 700 024

Tel : (033) 2469-8545; Fax : (033) 2469-8150

Website : www.grse.in, E-mail : investor.grievances@grse.co.in

(CIN: L35111WB1934GOI007891)

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30th JUNE, 2021

Sl. No

<div>મેડિકો ઇન્ટરકોન્ડીનેન્ટલ લીમીટેડ</div> <div>(અગાઉ ઇન્ટરકોન્ડિનેન્ટલ લીડિંગ એન્ડ ડ્રગવાણા કંપની લીમીટેડ તરીકે જાણીતી)</div>
<div> <div><div></div><div></div></div></div> <div>CIN : L24100GJ1984PLC011413</div>
રજીસ્ટર્ડ ઓફિસ: ૧-પાલો માથા, આદિત રામચંદ્રાઈડ, ૬માં ફ્લેટ હાઉસ વાલ, ૧૦૦ ફુટ હાઉ, સેરેલાહટ, અમદાવાદ, ગુજરાત-૩૮૦૦૧૫ ફોન : ૦૭૯ ૨૬૪૭૨૨૩૨
ઇમેલ: < mail@jindatextiles.com > વેબસાઇટ : < www.jindatextiles.com >
૩૦ મી વાર્ષિક સાધારણ સભાની નોટીસ, ક્ષીમોટ ઇ-વોટીંગ અને યુગ બંધનની માહિતી
આખી નોટીસ આપવામાં આવે છે કે : -
૧. ષીમોટ ઇન્ટરકોન્ડીનેન્ટલ લીમીટેડ (અગાઉ ઇન્ટરકોન્ડીનેન્ટલ લીડિંગ અને દ્રગવાણા કંપની લીમીટેડ તરીકે જાણીતી) ૩૦મી ઇપ્રિલથી સાધારણ સભાનુયુક્ત છે. ૨૦૧૫ અને ૨૦૧૬ ના રોજ બપોરે ૧૨ વાગ્યે લિપ્ડો કોન્ફરન્સ (વીસી) / અથ અપીસ વિડિયોચલ માધ્યમો (ઓએવીએમ) દ્વારા યોજાયે છે. સાધારણ સભા પર ૧.૬ ફેબ્રુઆરી, તારીખ ૦૮ એપ્રિલ, ૨૦૨૦, બેન્કઓબીઆર પરિષદ નં. ૧૬/૨૦૨૦, તારીખ ૧૩ એપ્રિલ, ૨૦૨૦નું બેન્કઓબીઆર કાયદાકીય પરિષદ નં. ૨૦/૨૦૨૦, તારીખ ૦૫ મે, ૨૦૨૦ નીચે વંચાતી કંપની કાયદા ૨૦૧૩ ની લાગુ જોવાયેલીના અનુવાદના અંતર્ગત ૨૬ એપ્રિલ, ૨૦૨૦ તારીખની સભાની નોટીસનું જણાવેલ કાગી પર પ્રાપ્ત થઈ શકે છે.
૨. બેન્કઓબીઆર અને નાણાકીય વર્ષ ૨૦૨૧ ના વાર્ષિક અહેવાલની ઉમેરવોટિંગ નણીય તમામ સભ્યો જેમના ઉમેરવોટમાંથી ઇપ્રિલથીએપ્રિલ વાર્ષિકવિવરણ) પછી રજીસ્ટર્ડ ઇમેઇલ દ્વારા મોકલવામાં આવે છે. આનારહેતે કંપનીની વેબસાઇટ < www.jindatextiles.com >ના પર પણ ઉપલબ્ધ છે. ઉમેરવોટિંગ રીતે બેન્કઓબી નોટીસની સાથાની ૦૮ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ પૂર્ણ કરવામાં આવશે.
૩. કંપની(વ્યવસ્થાપન અને પ્રશાસન)નિયમો, ૨૦૧૮, રચનાપ્રત્યુદાર પહેલે સુધારાનો મુજબના નિયમ ૨૦ સાથે વંચતી બેન્કની કલમ ૨૦૮ અને તેની (લિસ્ટિંગ ઓબ્લીગેશન્સ અને ડિસ્ક્લોઝર રીકવયરમેન્ટ્સ) નિયમો, ૨૦૧૫ ની જોવાયેલાઓ મુજબ અને નિયંત્રણ, ઈપી લેન્ડ્સ ડિપોઝિટરી સર્વિસિંગ (પીએસડીસી) ની ઉમેરવોટિંગ લોટીંગ પ્રણાલી દ્વારા ૩૦મી બેન્કઓબી નોટીસના જણાવેલ તમામ દરવાજે પર સભ્યોને ઉમેરવોટિંગ રીતે તેમના મત આપવાની સવલત આપવા માટે બેન્કઓબી દરમિયાન રીમોટ ઇ-વોટીંગની સવલત પુરી થઈ છે. બેન્કઓબી રીમોટ ઇ-વોટીંગ અથવા ઇ-વોટીંગ દ્વારા ઉમેરવોટિંગ પદ્ધતિઓ માત્ર આપવાની કાયદાકીય નહીં કરવાની ૩૨-એન્ડ ૩૬ ૨૩ મી સપ્ટેમ્બર, ૨૦૨૧ છે.
૪. તમામ સભ્યોને સજ્ઞ કરવામાં આવે છે કે:
બી. બેન્કઓબી નોટીસમાં જણાવેલ કાગી ઉમેરવોટિંગ માધ્યમોથી મતાદાન કરવા પાર પ્રાપ્તમાં આવશે.
બી. સભ્યો ઇ-વોટીંગ ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ (સવારે ૯:૦૦ વાગ્યેથી) શરૂ થશે.
સી. રીમોટ ઇ-વોટીંગ ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ (સાંજ ૫:૦૦ કલાક) પુર્ણ થશે.
ડી. ઉમેરવોટિંગ પદ્ધતિ દ્વારા અથવા બેન્કઓબી માત્ર આપવા માટેની કાયદાકીય નહીં કરવાની ૩૨-એન્ડ તારીખ ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ છે.
ઇ. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાક પછી ઉમેરવોટિંગ માધ્યમો દ્વારા ઇ-વોટીંગ માત્ર શરૂઆત નહીં.
એ. કોરપ્સ વાલન બેન્કઓબી નોટીસની પાછાની પછી કંપનીના ઇમેઇલ ઇડે અથવા ઇમેઇલ આઇડી અને અન્ય ઇમેઇલ ઇડે એન્ડ ૩૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ રોકેલે થયે છે તો તે વાર્ષિક સાધારણ સભામાં મત આપી શકે છે અને < helpdesk.evoting@cdsindia.com > પર વિનંતી માંગવાને લોગીન આઇડી અને પાસવર્ડ પેન્કવી લઈ છે. ઇ-વોટીંગની રીત માત્ર પ્રક્રિયા માટે સભ્યો ઇમેઇલ આઇડીની નોટીસના નિમ નં. ૨૭ માં જણાવેલ મુજબનાનો અનુસરી શકે છે.
ઘ. સભ્યોને નીચે લેખી કે ૧) રીમોટ ઇ-વોટીંગ માટે ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ સાંજે ૫:૦૦ કલાક પછી ષીમોટિન્કસ દ્વારા મેઇલ કરવામાં આવશે અને સભ્યોએ એક સભ્ય દ્વારા પર માત્ર બધા પછી, ત્યારબાદ તેમાં ફેરફાર કરવાની જવાબાની મળશે નહીં. ૨) ઇ-વોટીંગની સવલત બેન્કઓબીના ઉપલબ્ધ રહેશે. ૩) બેન્કઓબી પહેલા જે સભ્યોએ રીમોટ ઇ-વોટીંગથી તેમના મતો આપ્યા છે તેમને પછુ બેન્કઓબી દ્વારા આપી શકે છે, પરંતુ તેમને માત્ર કીબી અથવા હકદાર ગણાશે નહીં. અને જે અધિભાગના માત્ર ૩૨-એન્ડ ૩૬ના રોજ સભ્યોના નિર્ણયનિર્ધાર અને ડિપોઝિટરીના કાર સંચાલિત કાગળથી નિર્ધારિત નોંધણીપત્ર બંધ નોંધાયેલ છે તેમને રીમોટ ઇ-વોટીંગ અથવા ઇ-વોટીંગની સવલત અથવા હકદાર ગણાશે.
બેન્ક. બેન્કઓબી નોટીસ કંપનીની વેબસાઇટ < www.jindatextiles.com > અને ષીમોટિન્કસની વેબસાઇટ < www.evotingindia.com > પર પણ ઉપલબ્ધ છે.
ઘઠ. ઇ-વોટીંગ સાથે સંબંધિત કોઇપણ પ્રશ્નપર સહાયતા/સહાયતા/કસ્ટમર સર્વિસ લેવા વિનંતી છે થી રાફેલ હલવી, મનોજ, સી.બીએચએ, એલિંગ, ૨૫મો માથા, મેમોરિ પ્રાઇવેટ, અમદાવાદ, ગુજરાત, અંબેડકાર રોડ, પાલો, લોન્કર પાર્ક પુલ્, મુંબઈ-૪૦૦૦૮૩, અથવા < helpdesk.evoting@cdsindia.com > પર ઉમેરવોટિંગ સભ્યોમાં અથવા ૦૮૨-૨૬૪૭૨૨૩૨/૦૮૨-૨૬૪૭૨૨૩૨ ઉપર રોકેલે થશે અને.
૫. કંપનીના સભ્યોમાં નોંધણીપત્ર અને રજી સ્ટાન્કસ મુજબ ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૧ થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધી (બંને દિવસો સહિત) બંધ રહેશે.

મેડિકો ઇન્ટરકોન્ડીનેન્ટલ લીમીટેડ વલી સહિ-સમીર શાહ

મેડિકો ઇન્ટરકોન્ડીનેન્ટલ લીમીટેડ વલી સહિ-સમીર શાહ
ચેરમેન
સહ-ચેરમેન
તારીખ : ૬ સપ્ટેમ્બર, ૨૦૨૧

પીનીએમ પોલીટેક્સ લિમિટેડ
સીઆઇએન: L17110GJ1919PLC00495
રજી. ઓફિસ : રેશન સામે, પી. પેટલા - ૩૮૮૪૦, ૩૮૮૪૦, ગુજરાત.
ફોન : (૦૨૬૯૦) ૨૨૪૦૦૧, ફેક્સ : (૦૨૬૯૦) ૨૨૪૦૦૯.
Website : www.pbmptextex.com, Email ID : pbm@pbmptextex.com

પીનીએમ પોલીટેક્સ લિમિટેડની ૧૦૨ મી વાર્ષિક સાધારણ સભા યોજવા, ઇ-વોટીંગની પ્રાણકારી તેમજ બુક્ કલોઝર વિષયક માહિતીની સુચના

આથી નોટીસ આપવામાં આવે છે કે :

- પીનીએમ પોલીટેક્સ લિમિટેડ, (કંપની) ના રોચારકોની ૧૦૨મી (એકેસ બી) વાર્ષિક સાધારણ સભા (એજીએમ) **ગુજરાત, સપ્ટેમ્બર ૨૦, ૨૦૨૧ ના રોજ સવાળા ૧:૦૦ કલાકે** (વિશ્વો કોન્ફરન્સીંગ /અન્ય કસ્ટમર માધ્યમો (ઓએવીએમ) દ્વારા યોજાયે. આ સભા, કોર્પોરેટ બાબતના મેનાવણ **(એક્સચેન્જ)** દ્વારા બધાને પાસવાર્ડ આપવા સાધારણ પરિણ નં.૧૪/૨૦૨૦, તા.૮ મી એપ્રિલ, ૨૦૨૦, નં.૧૭/૨૦૨૦ તા.૧૩મી એપ્રિલ, ૨૦૨૦, નં.૨૦/૨૦૨૦ તા.૫ મી મે, ૨૦૨૦ અને નં.૦૪/૨૦૨૦ તા.૧૩મી જાન્યુઆરી, ૨૦૨૧ અને અન્ય લાગુ પડતા પરિષદો અને સીસ્ટીયુટીસ ઓન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (એ સર્વિસીસીઈ) દ્વારા બહાર પડવામાં આવેલ પરિષદ નં. SEBI/HO/CFD/CMD/ICIR/P/2020/79 તા.૧૪મી મે, ૨૦૨૦ અને પરિષદ નં. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 તા.૧૫મી જાન્યુઆરી, ૨૦૨૧ (એ લેવે વાલીથી જે સર્વિસીસીઈ નું “પરફેક્ચ” તરીકે સંદર્ભિત) થયે, જે રીત થઈ અગાઉએ સહ માટે કોઈ એક રચનોને દરકારથી હટાવી વધારે વીસી/ઓએવીએમ માં અસમર્થતા વાર્ષિક સાધારણ સભા યોજવાની મંજૂરી આપવામાં આવી છે, તેના હેઠળ યોજાવામાં આવે છે. આથી, કંપનીના ૧૦૨મી વાર્ષિક સાધારણ સભા, તા.૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ ની કંપનીના ૧૦૨મી વાર્ષિક સાધારણ સભા તા.૧૩મી ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ યોજાવાની સુચનામાં જણાવેલાબાબતે માટે, વીસી/ઓએવીએમ દ્વારા યોજાવામાં આવે છે, જે દરકારથી વીસી/ઓએવીએમ દ્વારા આ સભામાં ભાગ લેશે તેમની નોંધણી ઓફિડ દ્વારા, ૨૦૧૩ થી ૧૦૨ કલાકોના હેતુર રચનાના કરવામાં આવશે.
- સંબંધિત પરિષદોનું પાલન કરતા, ૧૦૨મી વાર્ષિક સાધારણ સભાની સુચના અને વર્ષ ૨૦૨૦/૨૦૨૧ ના વાર્ષિક અહેવાલની ઈલેક્ટ્રોનિક્સ નકલો, અને તમામ સદસ્યો જેમના ઈ-મેઈલસ સરનામાં કંપની/ડીપોઝિટરી પાટીસીપન્ટસ સાથે મોકલવામાં આવે છે. તેમને મોકલવામાં આ છે. આ દરવાજેઓ કંપનીની વેબસાઇટ www.pbmptextex.com, રોકેઓ એક્સચેન્જની વેબસાઇટ બેન્કઓ જેમ કે બીએસઈ લિમિટેડ (બીએસઈ) ની વેબસાઇટ www.bseindia.com તથા એજીએમ અને વીસી ની પ્રક્રિયા દરમ્યાન રીમોટ ઇ-વોટીંગ /વોટીંગ માટે લિન્કસ કરવામાં આવેલ જેબની, એનએસસીલી વેબસાઇટ www.evoting.nsdl.com પર ઉપલબ્ધ છે. આ સુચના પાસવાર્ડમાં કમ્પાનીની ઈમેઈલ દ્વારા ૦૧/૦૯/૨૦૨૧ ના રોજ પુરી કરી દેવામાં આવી છે.
- કંપનીએ, ૨૦૧૩ ના કલમ ૯૧(૧) અને એસઇપીઆઈ (લિસ્ટિંગ ઓબ્લીગેશન્સ અને ડિસ્ક્લોઝર ફિયાવરમેન્ટ્સ) રેગ્યુલેશન, ૨૦૧૫ ના નિયમ ૨૧ પર અનુસાર, આ સાથે સુચના આપવામાં આવે છે કે કંપનીનું રજિસ્ટર અને શેર ટ્રાન્સફર બુક્સ **ગુજરાત, સપ્ટેમ્બર, ૧૦, ૨૦૨૧ થી ગુજરાત, સપ્ટેમ્બર, ૨૦, ૨૦૨૧ (બંને દિવસો સહિત)**, ૧૦૨ મી સપ્ટેમ્બર માટે બંધ રહેશે.
- કંપનીએ એક ૨૦૧૩ની કલમ ૧૦૮ ને લીધેલો (મેનેજમેન્ટ એન્ડ એક્ઝીક્યુટિવોના) અહેવાલ, ૨૦૧૫ ના સુધારેલા નિયમ-૨૦ અને એસઇપીઆઈ (લિસ્ટિંગ ઓબ્લીગેશન્સ અને ડિસ્ક્લોઝર રીકવયરમેન્ટ્સ) રેગ્યુલેશન-૨૦૧૫ના રેગ્યુલેશન ૪૪ અને તેના સમાવર્તે થયેલા સુધારા સાથેના સહવંચાલ હેઠળ કંપની ના રોચારકો માટે નીચે જણાવેલી પ્રાણકારીના ઉપલબ્ધ છે.

- કેડ ઓફ ડેટ **ગુજરાત, ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ** તેમની સ્વચ્છતા છે ડીપોઝિટરીઆઈડસ સ્વચ્છતામાં શેર ધરાવતા સભ્યો તેમના મત એનએસસીએલ ની ઈલેક્ટ્રોનિક્સ વોટીંગ પ્રણાલી માસ્ટરે ૧૦૨મી સપ્ટેમ્બર તા.૧૪-૦૮-૨૦૨૧ ની સૂચનામાં આપેલ વિશિષ્ટીત વ્યવસ્થા પર અગાઉના કરવામાં આવશે.
- આથી તમામ સદસ્યોને જણાવવામાં આવે છે કે:

- ૧૦૨મી એજીએમ તા.૧૪-૦૮-૨૦૨૧ ની સૂચનામાં વિશિષ્ટીત વ્યવસ્થાઓ વ્યવહાર રીમોટ ઇ-વોટીંગ અને ૧૦૨મી એજીએમ માટે ઇ-વોટીંગ પ્રણાલી માસ્ટરે કરવામાં આવશે;
- રીમોટ ઇ-વોટીંગનો પ્રારંભ **સોમવાર, સપ્ટેમ્બર ૨૦, ૨૦૨૧ ના રોજ (સવાળા ૯:૦૦ કલાકે ઓએસસીઈ) થશે;**
- રીમોટ ઇ-વોટીંગ **બુધવાર, સપ્ટેમ્બર, ૨૯, ૨૦૨૧ (સાંજના ૫:૦૦ કલાકે ઓએસસીઈ) થશે;**
- રીમોટ ઇ-વોટીંગ એ / અથવા વાર્ષિક સાધારણ સભા ઇ-વોટીંગ સિસ્ટમમાં મતાદાન કરવા માટેની સવલત નહીં કરવા માટેની કટ ઓફ ડેટ **ગુજરાત, સપ્ટેમ્બર, ૧૬, ૨૦૨૧** રહેશે;
- એવી કોઈપણ વ્યક્તિ, કે જે એજીએમ ની નોટીસ પાઠવ્યા પછી કંપનીના ઈક્સકીવી શેર ઝેનણ છે અને કંપનીનો સમાવેશ બને છે અને કટ ઓફ ડેટ એટલે કે **ગુજરાત, સપ્ટેમ્બર, ૧૬, ૨૦૨૧ ના રોજ** ઈક્સકીવી રીતે, તે ૧૦૨મી વાર્ષિક સાધારણ સભાની તા. ૨૦-૨૦૨૧ ના સૂચનામાં આપેલ નોંધ મુજબ લોગીન આઈડી અને પાસવર્ડ મેળવી /બનાવી શકે છે.
- દરકારથી નોંધ લે:
- એનએસસીએલ દ્વારા રીમોટ ઇ-વોટીંગ વ્યવસ્થા **બુધવાર, સપ્ટેમ્બર ૨૯, ૨૦૨૧ ના રોજ** સાંજના ૫:૦૦ કલાકે (ઓએસસીઈ) બંધ કરવામાં આવશે અને એક્સદાર કાગડ પર મત આપીને સદસ્ય દ્વારા કરવામાં આવે પછી, સદસ્યોએ કોઈ ફેરફાર કરી નહીં કરે.
- એક્સચેન્જ દરમ્યાન પાલ ઇ-વોટીંગ કરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે અને જે સમાવર્તેની વેબસાઇટ બેન્કઓબી (પરફેક્ચ હેઠળ) અને જેમણે રીમોટ ઇ-વોટીંગની સુવિધા હેઠળ કરાવે પર મતાદાન શરૂ નહીં, અને જેઓ અન્ય ઈમેલ રીતે મતાદાન માટે ગેરલાઇલ નહીં, તેઓ એજીએમમાં ઇ-વોટીંગથી મતાદાન કરવા માં સામ્ય ગણાશે;
- એજીએમ પહેલા જે સમાવર્તેએ રીમોટ ઇ-વોટીંગ મતાદાન કરી લીધું છે તે એજીએમમાં ફારી આવી શકશે, પરંતુ ફરીથી મતાદાન કરી શકે નહીં.
- કટ ઓફ ડેટ એટલે કે **ગુજરાત, સપ્ટેમ્બર ૧૬, ૨૦૨૧ ના રોજ** જે વ્યક્તિનું નામ કંપનીના રજીસ્ટર ઓફ મેમ્બરોમાં અથવા ડીપોઝિટરી દ્વારા રાખવામાં આવતા રજીસ્ટર ઓફ નોનફિસલ ઓર્ગેનામાં નોંધાયેલું છે, માત્ર એવી વ્યક્તિઓ અને જે રીમોટ ઇ-વોટીંગ સુવિધાઓ એ / અથવા એજીએમમાં ઇ-વોટીંગનો ઉપયોગ કરવાનો અધિકાર રહેશે.
- જે સમાવર્તેની ડીપોઝિટરીઆઈડસ કે જે ઓફિસ રેગ્યુલેશન્સ હેઠળ છે અને એવા સભ્યોએ જેમણે તેમના ઇ-મેઈલ સરનામાંની નોંધ કરાવી નહીં તેમના માટે રીમોટ ઇ-વોટીંગ કરવાની પદ્ધતિથી એજીએમની સુચનામાં જાણ કરવામાં આવી છે. આ વિગતો મેળવવા માટે સમાવર્તેને કંપનીની વેબસાઇટ www.pbmptextex.com પર વિનંતી છે.
- એવા સમાવર્તે કે જેઓ ડીમટીટીયલાઈડસ સ્વચ્છતામાં શેર ધરાવે છે અને જેમણે તેમના ડીપોઝિટરી પાટીસીપન્ટસ પાસે તેમના ઈ-વોટીંગમાં પાસવાર્ડ (બેન્ક પાસવાર્ડ) વિગતોની નોંધ કરાવી પછી, સરનામું સુધાર્યું નહીં, તેમણે, તેમનું સંમેલન હેઠળ જે જાણવે છે એવા તેમના સંબંધિત ડિપોઝિટરી પાટીસીપન્ટસ પાસે તેમના ઇ-મેઈલ સરનામું /ઈમેલ પાતાની વિગતો નોંધવાની ટપા/ સુધારો કરાવી લેવા વિનંતી છે અને જે સમાવર્તેની ઈમેલ સ્વચ્છતામાં શેર ધરાવે છે અને કંપનીમાં તેમનું ઇ-મેઈલ સરનામું નોંધાયેલું છે તે સુધારો કરાવેલ નહીં, તેમને pbmcs@patodiagroup.com ને, તેમણે ફોનીસી નંબર ટાંકીને, અને પાતાની પાતાની સ્વચ્છતાપત્ર નકલ ફોનીસે તેમનું ઇ-મેઈલ સરનામું નોંધાવે લેવા /સુધારો કરાવેલ તેવા જણાવવામાં આવે છે, જેથી તેઓ કંપની પાસેથી ઈલેક્ટ્રોનિક્સ પદ્ધતિથી રીમોટ ૨૦૨૦-૨૦૨૧ ના વાર્ષિક અહેવાલ નકલો, ૧૦૨મી એજીએમ યોજાવાની નોટીસ, રીમોટ ઇ-વોટીંગ કરવાની અને એજીએમ દરમ્યાન ઇ-વોટીંગ કરવાની સુચનાઓ અને વીસી દ્વારા એજીએમમાં ભાગ લેવાની સવલતો મેળવી શકે છે.
- તેમણે, સમાવર્તે નીચે જણાવેલી લિંક પર પોતાનું ઇ-મેઈલ સરનામું, મોબાઈલ નંબર, પાતા અને ઇમેઇલના વિગતો મોકલી શકે છે.

https://www.linkintime.co.in/EmailReg/Email_Register.html

ફાઇનાલ એક્ટ ૨૦૨૦ કરવા ના અનુબંધ, એ એપ્રિલ, ૨૦૨૧ થી લીડીન્કસ એન્ડ રોચારકોના હાથમાં કરવામાં આવે છે થી ડિવિડન્ડસ રૂાન ૩૫,૫,૦૦૦/- થી સ્વૂ થશે તો,કંપનીએ તેના રોચારકોને સુધારવામાં આપેલા ડિવિડન્ડ પર નિયંત્રીત દરે ૨૬ના ડિવિડન્ડ એટ રાત્રી (ડીડીએસ) કાપવામાં આવશે. વિવિધ પરિણામ અને તેના નિર્ધારીત દરો માટે, રોચારકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ફાઇનાલ એક્ટ, ૨૦૨૦ અને તેના સુધારાનો સર્વેલો છે.
વ્યક્તિગત રોચારક નિવાસી તમા સાથે અને રોચે રોચારકો જે આયકર વિભાગમાં વેગે સુધવા માટે ત્યારબાદ નહીં, તેવા રોચારકોએ વાર્ષિક ધોવાણ કરો નં.૧૫૫/૧એમએ (જે મોટું કંપનીની વેબસાઇટ www.pbmptextex.com પરથી ડાઉનલોડ કરી શકો છો) જેથી કરીને કપાત ન કરવાનો કપાટ મેળવી શકાય અને તે ઈ-મેઈલ દ્વારા Vadodara@linkintime.co.in / alpesh.gandhi@linkintime.co.in પર ૧૬સપ્ટેમ્બર, ૨૦૨૧ અથવા તેના રજાવા મોકલી દેવાનો રહેશે. રોચારકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમનું પાન ધોમણેલુ ન હોય તો, ૨૦૨૪ કલ કાપવામાં આવશે.

- જે સભ્યોને એજીએમ પહેલા અથવા એજીએમ દરમિયાન મદદ/સહાય ની ૧૩૨ હોય, તેઓ એનએસસીએલ નો ટોલ ફ્રી નંબર : ૧૮૦૦ ૧૧૦૨ ૯૯૦૦ અને ૧૮૦૦ ૨૨૨ ૩૩૦ પર સંપર્ક કરી શકે છે અથવા evoting@nsdl.co.in પર એનએસસીએલ ના અધિકારી કીમતી મોકલેલ વિનંતી મોકલી શકે છે.

બોર્ડ ઓફ ડાયરેક્ટરોના આદેશથી, પીનીએમ પોલીટેક્સ લિમિટેડ વલી, સહી
(નોંધપાત્ર સહી)
એજીએમ સહીકર
(ડીઆઇએન : 00014247)
તારીખ : ૦૬.૦૯.૨૦૨૧
સ્થળ : પેટલાદ

સન ફીનલીઝ (ગુજરાત) લિમિટેડ
સી. યાદા, એન્ડ, એક્સપર્ટગુજરાત.ઇન્ડીએક્સ.૦૨૬૩
રજીસ્ટર્ડ ઓફિસ: ૩, રંધિપુ આંબેડકર, નવાબી હાઉસિંગ વાલ, મેમનગર, અમદાવાદ. ૩૮૦૦૧૨
ટેલીફોન નં.(૦૭૯) ૨૪૯૬૨૩૧૩,ઈ-મેઇલ આઈડી: sfgl1988@yahoo.com, વેબસાઇટ: www.sfgl.in.net
૩૩મી વાર્ષિક સામાન્ય સભા, ઈ-વોટીંગ માહિતી તથા બુક્ બંધ થવાની તારીખ ની નોટીસ

આથી નોટીસ આપવામાં આવે છે કે કંપનીની ૩૩મી વાર્ષિક સાધારણ સભા બુધવાર તારીખ ૨૯, સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યે લિપ્ડો કોન્ફરન્સ (વીસી) અથવા ઓડિયો વિડિયુચલ (ઓએવીએમ) દ્વારા યોજવામાં આવશે જેમાં બેન્કઓબીમાં નોટીસ માં દર્શાવેલા મુજબનુ કાર્ય હાથ ધરાશે.

ફાઇનાલ એક્ટ ૧૯-૧૦ રોચાણાને પાયામાં રાખીને સરકારના કોર્પોરેટ અફેર્સ ડિપાર્ટમેન્ટના તેમના પરિષદ નં. ૧૪/૨૦૨૦ તારીખ ૮ મી એપ્રિલ, ૨૦૨૦ પરિષદ નં. ૧૭/૨૦૨૦ તારીખ ૧૩ મી એપ્રિલ, ૨૦૨૦ અને પરિષદ નં. ૨૦/૨૦૨૦ તારીખ ૫મી મે, ૨૦૨૦ તથા સેક્યુરિટીસ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા લિમિટેડ (બેન્કીંગ અધિનિયમ અને ડિસ્ક્લોઝર રીકવયરમેન્ટ) રેગ્યુલેશન, ૨૦૧૫ ના પાલનમાં, આથી સરચોલી બેન્કઓબી વીસી/એવીએમ દ્વારા રાખવામાં આવશે.

આથી વ્યુધમાં જણાવવામાં આંધ છે કે કંપની તારીખ ૨૦૧૩ (કાયદો) ની કલમ – ૯૧ તથા સીક્યુરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાના કાયદા ૨૦૧૩ (લિસ્ટિંગ ઓબ્લીગેશન્સ અને ડિસ્ક્લોઝર રીકવયરમેન્ટ) કાયદો-૨૦૧૫ માં જણાવેલ પ્રોવિઝનનું પાલન કરવા સરકાર અને હકાલતિન અન્યથે કંપનીના નોંધાયેલ સમાવર્તે અને શેર ટ્રાન્સફર બુક્સ, ગુડેવર, તાર.૩ મી સપ્ટેમ્બર, ૨૦૨૧ થી બુધવાર , તાર.૨ મી સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી (બંને દિવસ સાથે) AGM ના કામ કમ્પાઈન કરેલો છે.

ઉપરોક્ત પરિષદ અનુસાર, વાર્ષિક એજીએમ ૨૦૨૦-૨૧ થી બેન્કઓબી ની નોટીસ કરત તેજ સભ્યોને ઉમેરવોટિંગ માટે દારૂ મોકલવામાં આવી રહી છે, જેના ઇ-મેઈલ સરચોલા કંપની ડિપોઝિટરીના નોંધાયેલ છે, સભ્યો નીચે લે બેન્કઓબી અને વાર્ષિકવિવરણ ૨૦૨૦-૨૧ નોટીસ કંપનીની વેબસાઇટ <www.jindatextiles.com>ના પર ઉપલબ્ધ છે. રીમોટ ઇમેઇલ એટલે કે મેટ્રોપોલિટન રોકે ડેમોએસી ની વેબસાઇટ <www.evotingindia.com> પર ઉપલબ્ધ છે, તથા ઈ-વોટીંગની સુવિધા પૂર્ણ પડનાર સુધી ડીડીએક્સની વેબસાઇટ <www.evotingindia.com> પર ઉપલબ્ધ છે. સભ્યો ફક્ત વીસી/ઓએવીએમ સુવિધા દ્વારા જ બેન્કઓબી માં જાણી આવી અને ભાગ લેવા શકે છે. બેન્કઓબી માં જોવા માટે ની સુચનાઓ બેન્કઓબી ની નોટીસ માં આપવામાં આવી છે. વીસી/ઓએવીએમ દ્વારા બેઠક માં ભાગ લેનાર સભ્યોની ગણતરી કંપની ની દ્વારા ૨૦૧૧ ની કલમ ૧૦૩ મુજબ કરેમ ની ગણતરી ના હેતુ માટે કરવામાં આવશે. પરંતુ ફરીથી AGM માં મત આપવા માં જણાવેલ તમામ કલમ પર પોતાના મત આપવા માટે અને રીમોટ ઇ-વોટીંગ સુવિધા પ્રદાન કરી રહી છે, ત્યાં માં કંપની બેન્કઓબી દરમિયાન ઇ-વોટિંગ તિસ્તમ દ્વારા મતાદાન કરવાની સુવિધા પ્રદાન કરી રહી છે. રિમોટ ઇ-વોટીંગ/ઇ-વોટીંગ માટેની વિગતવાર સુચના બેન્કઓબી ની નોટીસમાં આપવામાં આવી છે. એવા સભ્યો(ઓ) કે જેમને કંપની/ડિપોઝિટરી સાથે પોતાના ઇમેઇલ એડ્રેસ સુધાર્યું કર્યું નહીં, તેમને વાર્ષિક અહેવાલ મેળવવા માટે અને ઇ-વોટીંગ માટે લોગીન લેવાવો માટે તેમના ઇમેઇલ એડ્રેસ ને નોંધવાવા માટે ક્યા ફોની નીચે આપેલ સંપર્કસંખ્યા અનુસરવા વિનંતી છે. ડીમો માધ્યમ થી શેર ધરાવતા સભ્યો તેમની સંબંધિત ડિપોઝિટરી પાટીસીપન્ટનો સંપર્ક કરીને અથવા <sfgl1988@gmail.com> પર ઇમેઇલ દ્વારા નોંધણી કરાવી શકે છે.

રીમોટ ઇ-વોટીંગ નો સમય રવિવાર તા. ૨૬ મી સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ સવાળા

JINDAL WORLDWIDE LIMITED
CIN: L1711GJ3003PLC043354
Regd. & Corp. Office: "Jindal Tower", 3rd Floor, 101, Ring Road, Near PNB Bank, Shivrajpur
Road, 152 Ring Road, Satellite, Ahmedabad-380015 • Phone: 079-17010010
E-mail: investor@jindalworldwide.com, www.jindalworldwide.com

NOTICE OF CANDIDATURE TO MEMBERS OF THE COMPANIES ACT, 2013
Pursuant to the provisions of Section 100 of the Companies Act, 2013 read with the Rule 13 of the Companies (Appointment and Qualification of Directors) Rules, 2014, notice to members be and a hereby given that the Company had received the candidature for re-appointment of Mr. Arjit Agrawal (DIN: 00160861) as a Managing Director of the Company for the further period of 5 years. The agenda item relating to the candidature of Mr. Arjit Agrawal for re-appointment is included in the agenda of the AGM to be held on Thursday, 30th September, 2021 under the heading "Other Audio Visual Means (VOAVM)" which forms part of the Annual Report 2020-21 of the Company. The list of candidature as received by the Company is available on the website of the Company.
For and On Behalf of the Board of Directors
Date : 6th September, 2021
Place : Ahmedabad
Sd/-
Kiran Gargan - Company Secretary

CONTAINER CORPORATION OF INDIA LTD.
(एनएसई लिस्टेड कंपनी)
(A NAVAMTA UNDERSTANDING OF GOVT OF INDIA)
Regd. Office & Investors Relation Centre: CONCOR Bhawan, C-3,
Sector-29, Connaught Place, New Delhi-110048
CIN: L35011DL1886200301915 E-mail: investorrelations@concorindia.com
Tel. No. 4122 2000070 website: www.concorindia.com

**NOTICE OF THIRTY THIRD ANNUAL GENERAL MEETING
REMOTE E-VOTING INFORMATION AND BOOK CLOSURE**

- 1) Notice is hereby given that the thirty third (33rd) Annual General Meeting (AGM) of the Company shall be held on Wednesday, 29.09.2021 at 03.00 p.m. IST to transact the business set forth in the Notice of the said meeting through Video Conference /Other Audio Visual Means (VOAVM) and to consider and apply the provisions of the Companies Act, 2013 read with General Circular No. 14/2020 dated 8th April, 2020, General Circular No. 17/2020 dated 13th April, 2020, General Circular No. 20/2020 dated 5th May, 2020 and General Circular No. 02/2021 dated 13th January, 2020 issued by Ministry of Corporate Affairs and other applicable circulars issued by the Securities and Exchange Board of India (SEBI) without physical presence of members at venue.
- 2) In compliance of the relevant circulars, the notice of 33rd AGM alongwith explanatory statement and the Annual Report for the year ended 31.03.2021 to members as on 27.08.2021 has been dispatched in electronic mode to the members, whose e-mail IDs are registered with the Company or Depository Participant(s). The Notice of AGM and Annual Report will be available on the Company's website www.concorindia.co.in and on the website of Stock Exchanges (www.nseindia.com and www.bseindia.com).
- 3) Shareholders will have an opportunity to join and participate in 33rd AGM through VCI/VOAVM facility only and cast their vote on the items of business set forth in the Notice of the AGM through remote e-voting prior to the AGM and through electronic voting system during the AGM. The detailed instructions for participation in the AGM, remote e-voting for shareholders holding shares in dematerialized mode, physical mode and for those shareholders whose e-mail IDs are not registered, have been provided in the notice of AGM.
- 4) Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is providing its members the facility to cast their votes electronically on all the resolutions set out in the Notice of AGM from a remote location ("Remote e-voting") through National Securities Depository Limited (NSDL). The business of AGM may therefore be transacted through e-Voting services of NSDL and the members holding shares either in physical form or dematerialized form may cast their vote electronically. All the members are informed that:
 - i. The business set forth in the Notice of the 33rd AGM may be transacted through voting by electronic means.
 - ii. The remote e-voting shall commence on Saturday, 25.09.2021 at 09.00 AM;
 - iii. The remote e-voting shall end on Tuesday, 28.09.2021 at 05.00 PM;
 - iv. The cut-off date for determining the eligibility for remote e-voting or at the AGM is Wednesday, 22.09.2021. Any person, who acquires shares of the Company and becomes a member of the Company after dispatch of the Notice and holding shares as on the cut-off date i.e. 22.09.2021 may obtain login ID and password by sending a request at evoting@nsdl.co.in or concor@bseinfancia.com. However, if a person is already registered with NSDL for remote e-voting, then existing user ID and password can be used for casting vote;
 - v. Members eligible to vote may note that:
 - (a) The remote e-voting module shall be disabled by NSDL beyond 05.00 PM on 28.09.2021 and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently;
 - (b) The facility for voting through electronic voting system will be made available at the AGM;
 - (c) The members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their votes again; and
 - (d) A person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the Company as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting or voting at the AGM.
- 5) Shareholders holding shares in physical mode and who have not updated their e-mail IDs, mobile numbers or bank details (for receiving electronic payments of dividend, as & when declared by the Company) are requested to update the same by sending an e-mail at concor@bseinfancia.com under help section or may contact Mr. Sori Singh (Assistant Manager), NSDL, 4th Floor, A Wing, Trade World, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Panel, Mumbai - 400013, E-mail: evoting@nsdl.co.in or Tel: 1800 102 9900/1800 22 4430.
- 6) Pursuant to Section 91 of the Companies Act, 2013 read with applicable Rules thereunder and Regulation 42 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members and Share Transfer Books of the Company will remain closed from 23.09.2021 to 29.09.2021 (both days inclusive), to determine the shareholders entitled to final dividend of Rs. 2.00 per equity share of the face value of Rs.5/- each for the year ended 31.03.2021, if declared at the AGM. This final dividend will be paid on or before 28.10.2021 to those Members whose names appear in the Register of Members of the Company.
- 7) Pursuant to Finance Act, 2020, dividend income will be taxable in the hands of shareholders w.e.f. April 1, 2020. Accordingly, the Company will be required to deduct tax at source (TDS) at the time of making payment of dividend, at the rates prescribed in the Income Tax Act, 1961. To enable compliance with the TDS requirements, shareholders are requested to submit Form 15G/15H (Old exemption) / lower deduction documents and update their residential status, PAN, category as per the Income Tax Act, 1961 etc. with their Depository Participant(s) or with the Company/ R&TA at the e-mail IDs mentioned above. If valid PAN of the shareholder is not available, TDS is required to be deducted at the rate of 20% as per applicable provisions.

For Container Corporation of India Ltd.
Sd/-
(Harish Chandra)
ED (Finance) & Company Secretary

CIL NOVA PETROCHEMICALS LIMITED
Survey No. 396 (P), 395/4 (P), Moraiya Village, Sarkhij - Bavla Highway,
Tal.: Sanand, Ahmedabad-38220
CIN: L1711GJ3003PLC043354
Contact No. +91982580060, 982510442 Fax: +91 250556, 251612
Email: investor@cipec.com cipec@chirpalgroup.com, Website: www.cipec.com

Information Regarding (A) 17th Annual General Meeting and (B) Book Closure

- The 17th Annual General Meeting ("AGM") of the Company will be held through video conferencing ("VC") /Other Audio-Visual Means ("VOAVM") on Tuesday, 28th day of September, 2021 at 2:00 p.m. IST, in compliance with all the applicable provisions of the Companies Act, 2013 and the Rules made thereunder and SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015 read with General Circular No. 14/2020 dated 08th April, 2020, General Circular No. 17/2020 dated 13th April, 2020 and General Circular No. 20/2020 dated 5th May, 2020 and other applicable circulars issued by the Ministry of Corporate Affairs (MCA), Government of India and SEBI (collectively referred as "relevant circulars") to transact the business set out in the Notice calling the AGM. Members participating through the VC/VOAVM facility will be reckoned for the purpose of quorum under Section 103 of the Companies Act, 2013.
- In compliance with the relevant circulars, the Notice of the AGM and the Annual Report for the Financial Year 2020-21 will be sent to all the members in electronic mode whose e-mail addresses are registered with the Company/Depository Participant(s). The aforesaid document will also be available on the Company's website at www.cipec.com and on the website of the Stock Exchange i.e. BSE Limited at www.bseindia.com and on the website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com
- **Manner of registering/updating e-mail addresses**
 - a) Members holding shares in physical mode, who have not registered/updated their email addresses with the Company are requested to update/register the same by emailing to Company's Registrar & Share Transfer Agent i.e. Link Intime India Pvt. Ltd. at ahmedabad@linkintime.co.in or at company's mail address i.e. harsh.hirpara@chirpalgroup.com
 - b) Members holding shares in dematerialized mode, who have not registered/updated their email addresses with the Depository Participants are requested to register/update their e-mail addresses with the Depository Participants with whom they maintain their demat accounts.
- **Manner of casting vote(s) through e-voting:**
The Company is providing remote e-voting facility ("remote e-voting") to all its members to cast their votes on all resolutions as set out in the Notice of AGM. Additionally, the Company is providing the facility of voting through e-voting system during the AGM ("e-voting"). Detailed procedure for remote e-voting-e-voting is provided in the Notice of AGM.
- **Book Closure Date & Cut-off Date:**
 - a) The Register of Members and Share Transfer Books of the Company will remain closed from Wednesday, 22nd September, 2021 to Tuesday, 28th September, 2021 (both days inclusive) for the purpose of AGM, recommended by the Board of Directors for the financial year ended on 31st March, 2021.
 - b) The cut off date for determining the eligibility to vote by remote e-voting/e-voting at the AGM is Tuesday, 21st September, 2021.
- Members are requested to carefully read the Notes set out in the Notice of the AGM and in particular instructions for joining the AGM, manner of casting vote through remote e-voting and e-voting during the AGM.

For, CIL Nova Petrochemicals Limited

Sd/-
Harsh R. Hirpara
Company Secretary

Date: 6th September, 2021
Place: Ahmedabad

WILFUL DEFAULTERS NOTICE
Stressed Asset Management Branch, 1st Floor, Kamdhenu Complex, Paripatya Cross Road, Ambawadi Ahmedabad-380015
Phone: 079-26308751 E-mail: sam@bankofbaroda.com

Name of Party	Debit	Credit	Net
M/s Torque Automotive Pvt Ltd			
2nd Floor, Mudul Tower, Bt Times of 9, Paripatya Society, Subhanpura, Indira, Ashram Road, Ahmedabad-380009			
Mr. Kuren Manishbahai Amin - Director, 9, Paripatya Society, Subhanpura, Vadodra-390021			
Mr. Ishkhit Manish Amin-Director, 9, Paripatya Society, Subhanpura, Vadodra-390021			

Dear Sir,
Re: Declaration of M/s. Torque Automotive Pvt Ltd and its Directors as Wilful Defaulters
We refer to our show cause notice No. BOB-ZOSARAH-AHM-2021 dated 19.10.2020 for declaring M/s. Torque Automotive Pvt Ltd and its Directors Mr. Kuren Manishbahai Amin and Mr. Ishkhit Manish Amin as wilful defaulters on the following grounds:
1) The Directors and guarantors have defaulted in meeting its payment/ repayment obligations to the lender even though have the capacity/net worth to honour the said obligations.
2) The borrower has made payments to the parties which are related/potentially related parties of TAPL (Torque Automotive Pvt Ltd). On scrutiny of bank statement of account No 057110311230 for the period 01.04.17 to 10.09.19 indicates that the borrower has made large payments to the parties amounting to Rs.20.94 Cr.

(Rs. in Crs)			
Name of Party	Debit	Credit	Net
Sanjana Fashions	0.20		0.20
Soleneo Tradefint Pvt Ltd	16.10		16.10
Torque Autohaus Pvt Ltd	2.95		2.95
Torque Commercial Pvt Ltd	0.06		0.06
Torque Holding LLP	2.03	0.4	1.63
Total	21.34	0.4	20.94

- (3) As per the statement dated 31.03.19 the value of stocks & debtors available with firm was Rs.46.85 Cr and Rs.8.26 Cr respectively. But the turnover from 01.04.19 to till 09.10.2020 on the account is Rs.1.05 Cr only. Business activity of the company was closed.
- (4) The purchase agreement No.TAPL/101/2012 dated 08.10.12 between Torque Automotive Pvt Ltd and supplier Arrow plus FZE (APFZE) is accommodation nature. The borrower has siphoned off funds out of India, to the tune of USD.2500000 by opening BG/SBLC in favour of supplier who has availed finance against those BG/SBLC amounting to Rs.16.00 Cr.
- (5) Company had fraudulently issued two Bank Guarantees amounting to Rs.20.00 Cr by using Branch seal and letter head. Details of BGs issued are as under:

S. No.	BG No.	Amount (Rs. in Crs)	Date of issue	Date of extension
1	0571131FGFN0029	5.00	04.11.16	16.11.18
2	0571131FGFN0109	15.00	08.12.17	28.11.18

(6) On comparison of audited financials of FY 2013-14, FY 2014-15 and FY 2015-16 there was difference of valuation of stock

Particulars	As on date	Am (Rs. in Cr)
Closing Inventory of Vehicle	31.03.2014	39.90
Opening Inventory in the comparable balance sheet for FY 2014-15	01.04.2014	34.90
Difference		5.00 Cr.

Company incurred a loss in the FY 2014-15 of 4.20Cr; if the impact of change in audited financials is reinstated.

Particulars	As on date	Am (Rs. in Cr)
Reported profit as per Profit & Loss Account	31.03.2015	0.80
Difference in change in inventory	31.03.2015	5.00
Loss for the year FY 2014-15		4.20

This change in inventory valuation due to such mismatch also affected the Drawing Power and Security coverage of the bank by this it is inferred that the company has misrepresented financial statements and availed higher Drawing Power (7). The company has defaulted in meeting its payment/ repayment obligations to the lender even when it has the capacity to honour the said obligations and has siphoned off the funds so that the funds have not been utilized for the specific purpose for which the loan was availed, or for the funds available with the company in the form of other assets.

The decision of the COE was conveyed vide our letter No.BOB-ZOSARAH-AHM-2021-114 dated 08.02.21 with an opportunity for submission of further representation, if any, for consideration by the Review Committee on Wilful Defaulters. In terms of RBI guidelines and to comply principles of natural justice.

In response to the COE, Mr. Ishkhit Manish Amin and Mr. Kuren Manishbahai Amin submitted representation vide their letter dated 10.03.21 and placed before the Review Committee.

In the aforesaid circumstances, after perusal of documents on record and representation received, Bank's Review Committee on Wilful Defaulters in its meeting held on 19.07.2021 confirmed the decision of the Committee of Executives on Wilful Defaulters (COE).

Thus after following the due procedure, it has been decided to declare M/s Torque Automotive Pvt Ltd and its Directors Mr. Kuren Manishbahai Amin and Mr. Ishkhit Manish Amin as Wilful Defaulters. Bank reserves the Right to publish the name and photograph of Wilful Defaulter in News Paper and will initiate the necessary recovery action as per extant guidelines issued by Reserve Bank of India.

This communication is issued as per the directions of the Review Committee on Wilful Defaulters.

Date: 07/09/2021
(Vijay Jain)
Chief Manager

INDIAN RAILWAY CATERING AND TOURISM CORPORATION LTD.
(A Government of India Enterprise - Mini Ratna Category-I)
CIN: L74900DL199020017074
Registered & Corporate Office: 1st Floor, B-148, Statesman Hotel, Bankbarah Road,
New Delhi-110001 Tel: 011-2331263-4 Fax: 011-2331259 Website: www.irctc.com e-mail: investors@irctc.com

NOTICE OF THE 22nd ANNUAL GENERAL MEETING, E-VOTING INFORMATION AND BOOK CLOSURE

Notice is hereby given that:-

1. The Twenty-Second (22nd) Annual General Meeting ("AGM") of the Members of Indian Railway Catering and Tourism Corporation Limited ("IRCTC") will be held on **Wednesday, September 29, 2021 at 12:30 pm (IST) through Video Conferencing ("VC") /Other Audio-Visual Means ("VOAVM")** to transact the business as set out in the Notice convening the 22nd AGM, compliance with the provisions of the Companies Act, 2013 read with General Circular No. 14/2020 dated 08th April, 2020, General Circular No. 17/2020 dated 13th April, 2020 and General Circular No. 20/2020 dated 5th May, 2020 issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars") and SEBI Circular dated 17/2021 read with SEBI Circular dated January 15, 2021 and May 12, 2020, and in compliance with the provisions of the Act and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI (LODR) Regulations"), prescribing the procedures and manner of conducting the Annual General Meeting through VOAVM. The members can attend and participate in the AGM only through VOAVM as no provision has been made to attend the AGM in person.
 2. As permitted under the Rule 11 of the Companies (Accounts) Rules, 2014, the electronic copies of the Notice convening 22nd AGM together with the Annual Report for the financial year 2020-21 has been sent to all the members of the Company through electronic mode on **September 6, 2021** whose email IDs are registered with the RTA/Depositories in accordance with MCA/SEBI circulars as mentioned above. The same is also hosted on the website of the Company (www.irctc.com) Stock Exchanges i.e. BSE Limited (www.bseindia.com) National Stock Exchange of India Limited (www.nseindia.com) and National Securities Depository Limited (www.evoting.nsdl.com). Members may please note that in view of Covid 19 pandemic, no hard copies of the AGM documents have been sent.
 3. Detailed instructions to the Members for registration of their email addresses, manner of participating in the 22nd AGM through VOAVM including manner of e-voting is set out in the Notice of the AGM. The documents referred to in the Notice of the AGM are available electronically for inspection without any fee by the members from the date of circulation of this notice up to the date of AGM. Members seeking to inspect such documents may send an email to investors@irctc.com.
 4. In compliance with section 108 of the Companies Act, 2013 read with the Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended, time to time and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and as per the MCA circulars, the members are provided with the facility to cast their vote on all resolutions set forth in the notice of the AGM using electronic voting system (remote e-voting and e-voting). The Company has engaged the services of NSDL as the agency to provide e-voting facility. The voting rights of the members shall be in proportion to the equity shares held by them in the paid up equity shares of the Company as on **Wednesday, September 22, 2021**.
- Members are informed that:**
- a) The business as set out in the Notice of 22nd AGM will be transacted through e-voting system at the AGM.
 - b) The remote e-voting shall commence on **Monday, September 27, 2021 at 9.00 AM (IST) and ends on Tuesday, September 28, 2021 at 5.00 PM (IST).**
 - c) Remote e-voting shall not be allowed beyond **5.00 PM (IST) of September 28, 2021.**
 - d) Any person whose name appears in the register of Members/beneficial owners as on the cut-off date i.e. **Wednesday, September 22, 2021** only shall be entitled to avail the facility of remote e-voting as well as e-voting system at the 22nd AGM.
 - e) Any person who becomes member of the company after dispatch of the notice of meeting and holding shares as on the cut-off date **Wednesday, September 22, 2021** may obtain the user ID and password by sending a request at evoting@nsdl.co.in.
 - f) The remote e-voting module will be disabled after the date and time as aforesaid. Once the vote on a resolution is cast by the member, he/she shall not be allowed to change it subsequently.
 - g) In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Members who need assistance before or during the AGM and e-voting user manual for Members available on the website www.evoting.nsdl.com under the Downloads Manager. You may also contact NSDL on toll free number 1800-1029-890 and 1800 22 44 30 or Ms. Sarita Moti, Assistant Manager, NSDL, at designated e-mail ID: evoting@nsdl.co.in, who will address the grievances related to electronic voting.
 - h) Members holding shares in physical form who have not registered their email addresses are requested to register the same by sending an email request mentioning their name, folio number, complete address, email address to be registered along with scanned self-attested copy of the PAN to linkintime@nsdl.com, RTA, at raj@linkintime.com.
 - i) Pursuant to SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and Section 91 of the Companies Act, 2013 and the applicable Rules there under, as amended, the Register of Members and Share Transfer Books for equity shares of the Company will remain closed from **Thursday, September 23, 2021 to Wednesday, September 29, 2021 (both days inclusive)**, for taking record of the Members of the Company for the purpose of 22nd AGM for the financial year ended March 31, 2021.
 - j) The Company has fixed **Wednesday, September 22, 2021 as the "Record Date"** for determining entitlement of members for final dividend for the financial year ended March 31, 2021, if approved at the AGM.
 - k) The facility for voting shall also be made available during the 22nd AGM and Members who have not already cast their vote by remote e-voting shall be able to vote during e-voting system during the 22nd AGM. The members who have cast their vote by remote e-voting prior to the AGM shall not be allowed to cast their vote again.
 - l) The Board of Directors of the company has recommended a final dividend of Rs. 5.00/- per share. The final dividend if approved, by the members in the ensuing AGM will be paid within 30 days to the eligible members. Members may note that Income Tax Act, 1961, as amended by the Finance Act, 2020, mandates that dividend paid or distributed to or in the hands of shareholders. The company shall therefore be required to deduct tax at source (TDS) at the time of making payment of dividend. In order to enable the company to determine the applicable TDS rates, members are requested to submit the relevant documents on or before **Wednesday, September 22, 2021** to our RTA. A Communication in this regard is posted under the "Investor Corner" of the company's website www.irctc.com.
 - m) Ms. Balka Sharma, Practising Company Secretary has been appointed as "Scrutinizer" for remote e-voting process and e-voting at the meeting.
 - n) Corporate members intending to attend the meeting through their Authorised Representatives are requested to send a duly certified copy of the Board Resolution / Power of Attorney through e-mail to ca@balkasharma.com with a copy marked to evoting@nsdl.co.in, authorizing their representatives to attend and vote at the meeting.
- By order of the Board of Directors of IRCTC Ltd.
Sd/-
(Suman Kalra)
Place: New Delhi
Date: September 06, 2021
Company Secretary and Compliance Officer

MAHALAXMI RUBTECH LIMITED
(Corporate Identification Number: L25190G1991PLC016373)
Reg. Office: 47, New Chokpet, Old. Rajpur Gate, Ahmedabad - 380 002
Corp. Office: VSL Avenue, Opp. Ketai Petrol Pump, Polytechnic Road, Ambawadi, Ahmedabad - 15.
Tel: 079 - 4000000 / Fax: 079 - 4000030 / E-Mail: ca@mahalaxmigrp.net / Website: www.mrtglobal.com

NOTICE OF 30th ANNUAL GENERAL MEETING, E-VOTING & BOOK CLOSURE INFORMATION

Notice is hereby given that the Thirtieth (30th) Annual General Meeting (hereinafter called AGM) of the Company will be held on Thursday, the 30th Day of September, 2021 at 11.30 a.m. through Two-Way Video Conferencing ("VC") /Other Audio Visual Means ("VOAVM") facility to transact the business as set out in the Notice of 30th AGM dated August 13, 2021.

Pursuant to General Circular No. 14/2020 dated April 08, 2020, General Circular No. 17/2020 dated April 13, 2020, General Circular No. 20/2020 dated May 05, 2020 and General Circular No. 02/2021 dated January 13, 2021 issued by Ministry of Corporate Affairs (MCA) and Circular No. SEBI/HO/CFD/CMD/IR/2020/79 dated May 12, 2020 and Circular No. SEBI/HO/CFD/CMD/IR/2021/11 dated January 15, 2021 read with the Securities and Exchange Board of India ("SEBI") (hereinafter collectively referred to as "Circulars") (hereinafter collectively referred to as "Circulars"), the Company is permitted to hold the AGM through VCI/VOAVM, without the physical presence of the Members at a common venue.

In compliance with the Circulars, the Notice of the 30th AGM along with the Annual Report for Financial Year 2020-21 has been sent only through electronic mode to those Members whose e-mail addresses are registered with the Company/ National Securities Depository Limited and Central Depository Services (India) Limited ("the Depositories"). The Notice of AGM is also available on the website of the BSE Limited at www.bseindia.com, on the Company's website at www.mrtglobal.com and on the website of Link Intime India Private Limited at www.linkintime.co.in. The Company has engaged Link Intime India Private Limited ("LIPL") for providing facility for voting through remote e-voting, for participation in the AGM through VOAVM and e-voting during the AGM.

In compliance with provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and Secretarial Standard - 2 on General Meetings issued by The Institute of Company Secretaries of India:

- a) The Company is providing remote e-voting facility to its Members to cast their vote by electronic means on the Resolutions set out in the Notice of the 30th AGM dated August 13, 2021.
- b) Day, Date and time of commencement of remote e-voting : Monday, September 27, 2021 at 09.00 a.m.
- c) Day, Date and time of end of remote e-voting : Wednesday, September 29, 2021 at 05.00 p.m.
- d) Cut-off Date : September 23, 2021
- e) Any person who acquires shares of the Company and becomes a Member of the Company after the dispatch of AGM Notice, holds shares as on the Cut-off Date i.e. September 23, 2021 should follow the instructions for e-voting as mentioned in the AGM Notice.

f) The Members who will be attending the AGM through VCI/VOAVM and who have not cast their vote through remote e-voting shall be able to exercise their voting rights through e-voting system at the AGM

g) The Members are requested to note that:

- i. Remote e-voting module shall be disabled by LIPL for voting after 5.00 pm, on Wednesday, September 29, 2021;
- ii. The Members who have already cast their vote through remote e-voting may attend the AGM but shall NOT be entitled to cast their vote again;

iii. Members holding shares in physical or in dematerialized form as on September 23, 2021, shall be entitled to vote. Members will have an opportunity to cast their vote remotely or during the AGM on the businesses as set forth in the Notice of the AGM through the electronic voting system. The manner of voting remotely or during the AGM for Members holding shares in dematerialized mode, physical mode and who have not registered their email addresses has been provided in the Notice convening the AGM.

Members holding shares in physical mode who have not registered their e-mail addresses with the Company/Link Intime India Private Limited/Depositories, they may do so by sending a duly signed request letter to Link Intime India Private Limited by providing Folio No. and Name of the Shareholder at (Unit): Mahalaxmi Rubtech Limited, C/O, 506 S Old Anarnah Business Centre - I (ABC - I), Beside Ganga Business Centre, Nr. St. Xavier's College Corner Off C Road, Navrangpura, Ahmedabad - 380009 (Gujarat), Tel: 079-2645179, e-mail: ahmedabad@linkintime.co.in. Members holding shares in demat mode are requested to contact the Depository Participant ("DP") and register the e-mail address in the demat account as per the process followed and advised by the DP.

For details relating to Remote e-voting and E-Voting at AGM, please refer to the Notice of the AGM. In case of any queries relating to voting by electronic means, please refer to the Frequently Asked Questions (FAQs) and e-voting manual available at <https://www.linkintime.co.in>. In case of any grievances connected with facility for voting by electronic means, please connect Mr. Rajiv Ranjan, Asst. Vice President, Link Intime India Private Limited, C-101, 1st Floor, 24th Park, L.B. Marg, Vikhroli (West), Mumbai City, Maharashtra-400083, India. Email: raj@linkintime.co.in Tel: 022-49186000.

The Company has appointed Buntal & Associates, as the Scrutinizer for overseeing/ conducting the voting process in a fair and transparent manner.

Pursuant to Section 91 of the Companies Act, 2013, read with Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 42 of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015 that the Register of Members and Share Transfer Books of the Company will remain closed from September 24, 2021 to September 30, 2021 (both days inclusive) for the purpose of 30th AGM/Annual General Meeting of the Company for the year ended March 31, 2021.

The result of the e-voting held at AGM shall be declared within forty-eight hours of conclusion of the AGM. The Results declared, along with the Scrutinizer's Report, shall be displayed at the

सैनिक स्कूल अम्बिकापुर (छत्तीसगढ़)
(सैनिक स्कूल सोसायटी रक्षा मंत्रालय, भारत सरकार द्वारा संचालित)

निविदा सूचना

सैनिक स्कूल अम्बिकापुर, मेण्डाकला, जिला- सरयुना (छत्तीसगढ़) में निम्नलिखित सामग्री को आपूर्ति/सेवाओं के लिए पंजीकृत फर्मों या अधिकृत विक्रेताओं से निविदाएं निर्धारित प्रारूप पर आमंत्रित की जाती है:-

क्र.	निविदा	निविदा फार्म की किमत (अप्रतिदेय)	धरोहर राशि (EMD)	अनुमानित वार्षिक खरीदी
Annual Tender				
1	अनाज (Cereal) की आपूर्ति लाख	Rs. 100.00	Rs. 80,000.00	Rs. 20 लाख
2	किराने (Grocery Item) के सामान की आपूर्ति	Rs. 100.00	Rs. 80,000.00	Rs. 20 लाख
3	धुलाई व इस्त्री (Washing & Ironing) कार्य की सेवाओं	Rs. 100.00	Rs. 80,000.00	Rs. 20 लाख
4	ब्रेड व अन्य बेकरी (Bread & Bakery items) सामानों की आपूर्ति	Rs. 100.00	Rs. 9,000.00	Rs. 03 लाख
5	मुद्रण कार्य (Printing Work)	Rs. 100.00	Rs. 15,000.00	Rs. 05 लाख
6	पशु आहार (Horse Feed) की आपूर्ति	Rs. 100.00	Rs. 9,000.00	Rs. 03 लाख
7	कार्यालय सामग्री (Office Stationary) की आपूर्ति	Rs. 100.00	Rs. 6,000.00	Rs. 02 लाख
8	टेलीफोन एवं इंटरनेट (Telephone & Internet) की सेवाओं	Rs. 100.00	Rs. 9,000.00	Rs. 03 लाख
9	नाई (Barber) कार्य की सेवाओं	Rs. 100.00	Rs. 6,000.00	Rs. 02 लाख
Rate Contract				
10	यूनिफॉर्म, क्लॉथिंग एवं यूनिफॉर्म एक्सेसरीज (Uniform, Clothing & Accessories) की आपूर्ति	Rs. 100.00	Rs. 50,000.00	Rs. 13 लाख

GeM availability ID: GEM/GARPTS/11102021/CONL4X1HV7E

निविदा प्रपत्र का मूल्य रुपये 100/- है। जमा की गई निविदा प्रपत्र की किमत वापस नहीं होगी। निविदा फार्म अहस्तांतरणीय होंगे। निविदा प्रपत्र दिनांक **14 Oct 2021 से 06 Nov 2021** के मध्य सभी कार्यालयीन दिवसों पर सैनिक स्कूल अम्बिकापुर, मेण्डाकला, जिला- सरयुना (छत्तीसगढ़), पिन कोड- 497001 से निविदा प्रपत्र शुल्क जमा करके प्राप्त किया जा सकता है। निविदा प्रपत्र केन्द्रीय सार्वजनिक खरीद पोर्टल (CPP Portal) <https://eprocure.gov.in/cpubish/app> एवं सैनिक स्कूल अम्बिकापुर की वेबसाइट www.sainikschoolaamkpur.org.in से भी डाउनलोड किया जा सकता है। पूर्ण रूप से भरे हुए निर्धारित निविदा फार्म को सिलबन्ध लिफाफे में अंतिम तिथि 05 Nov 2021 को सुबह 11.00 बजे या उससे पहले हाथों-हाथ या डाक के माध्यम से सैनिक स्कूल अम्बिकापुर में जमा किया जा सकता है। निविदा पट्टी सैनिक स्कूल अम्बिकापुर, मेण्डाकला में दिनांक 06 Nov 2021 को सुबह 11.30 बजे खोली जाएगी।

सैनिक स्कूल अम्बिकापुर की वेबसाइट या केन्द्रीय सार्वजनिक खरीद पोर्टल (CPP Portal) से डाउनलोड किए गये निविदा फार्म के साथ निविदा प्रपत्र शुल्क रुपये 100/- (अप्रतिदेय) का डिमांड ड्राफ्ट जो "प्राचार्य सैनिक स्कूल अम्बिकापुर" के नाम से देव हो को संलग्न करना अनिवार्य है। अन्यथा निविदा प्रपत्र स्वीकार नहीं किया जाएगा एवं निरस्त माना जाएगा। डाक विभाग द्वारा किसी भी प्रकार की देरी के लिए सैनिक स्कूल अम्बिकापुर प्रशासन जिम्मेदार नहीं होगा। प्राचार्य, सैनिक स्कूल अम्बिकापुर के पास किसी भी निविदा को किसी भी स्तर पर स्थगित / रद्द करने का अधिकार सुरक्षित है।

1034

प्राचार्य, सैनिक स्कूल अम्बिकापुर

MUMBAI RAILWAY VIKAS CORPORATION LIMITED
(A PSU OF GOVT. OF INDIA, MINISTRY OF RAILWAYS)

SPECIFIC PROCUREMENT NOTICE (SPN)
National Open Competitive Tender (NoCT)
(Two-Envelope e-Procurement Bidding Process)
Loan No: L0228A RFB No:MRVC/W/124

Mumbai Railway Vikas Corporation Ltd. (MRVC), having its corporate office at 2nd Floor Churchgate Station Building, Mumbai - 400 020, invites sealed Bids from eligible Bidders for under mentioned work of the Project "**Quadrupling of the Virar-Dahanu Road section of Western Railway under MUDP-III**".
Sr.No.1. Name of the Work & RFB No.: Removal/Shifting/Replacement of Signal & Telecom gears, Underground Signal & Telecom Cable/Optical Fiber Cable (OFC) in connection with Quadrupling of VIRAR-DAHANU ROAD section in Mumbai Division of Western Railway under MUDP-III. **RFB No: MRVC/W/124.**
Completion Period: 36 Months. **Bid Security Amount:** ₹7,32,000/-. **Bid Document Cost including GST:** ₹11,800/-. **Important dates:** 1. **Bid Invitation:** 11.10.2021. 2. **Pre Bid Meeting:** No pre Bid meeting. 3. **Last date of submission of bid:** 15.11.2021 at 15.00 hrs. 4. **Bid opening:** 15.11.2021 at 15.30 hrs. Details of bids and bidding documents are available on <https://eprocure.gov.in>. Bids must be submitted online at <https://eprocure.gov.in> on or before 15.00 hrs. of 15th November 2021. Corrigendum, if any, will be hosted on the web site only. Details are also available on web site of MRVC i.e. www.mrvvc.indianrailways.gov.in. Refer detailed Specific Procurement Notice available on above websites for further details. **Chief Signal & Telecom Engineer, Mumbai Railway Vikas Corporation Ltd.** Address :- 2nd Floor, Churchgate Railway Station Building, M.K. Road, Mumbai - 400 020. **Phone/Fax :- (+91)-022-22005357/22096972 E-mail :- cstc@mrvc.gov.in Web site:- www.mrvvc.indianrailways.gov.in https://eprocure.gov.in **SNP 02****

PUBLIC NOTICE

Under the Instructions provided by my client I by way of this public notice inviting all kind of objection whatsoever within period of 7 days from the publication of this notice supported by evidence with respect to the immovable property bearing Flat No. 46 on Fourth Floor having area measuring 68, 98 Sq. Mtrs in the scheme known as "SHANTI TOWERS" of Ruturaj Market Owners Association lying, being and situated on the N.A. land bearing Final Plot No. 606 of Sub-Plot No. 1 to 7 paiki Sub-Plot No.2 and 6 of T.P. Scheme No. 21 being at Village: PALDI, Taluka-Sabarmati, withing District Ahmedabad and Registration Sub District of Ahmedabad-4 (Paldi) belonging to Pratik Vijaybhai Doshi. It is further informed that, if any persons, party of institution, having interest, right, lien charges etc, of whatsoever nature in the said property. Any Failure therefore has objection on giving the title opinion on the above property shall be issued and any objection whatsoever shall not be entertained after 7 days.

Place - Ahmedabad Advocate Shiv Bhatt
Date - 13-10-2021 E-19/3 Capital Commercial Centre
Besides Sanyas Ashram
B/h UCO Bhavan, Ellisbridge, Ahmedabad-380006

JINDAL WORLDWIDE LIMITED
CIN: L17110GJ1986PLC008942
Regd. & Corp. Office: "Jindal House", Opp. Dmart, I.O.C Petrol Pump Lane, Shivranjani Shyamal 132 Ft Ring Road, Satellite, Ahmedabad - 380015 • E-Mail Id: csjindal@jindaltextiles.com
Website: www.jindaltextiles.com • Phone: 079-71001500

NOTICE OF CANDIDATURE TO MEMBERS u/s 160 OF THE COMPANIES ACT, 2013
Pursuant to the provisions of Section 160 of the Companies Act, 2013 read with the Rule 13 of the Companies (Appointment and Qualification of Directors) Rules, 2014, notice to members be and is hereby given that the Company had received notice of candidature in writing from the shareholder/member of the Company proposing the candidature for appointment of Mr. Jasdev Kaur Rait (DIN: 09354682) as a Non-Executive Independent Director of the Company for the period of 5 Years. The agenda item relating to appointment of the said Director and her detailed particulars is appended in the Notice of Postal Ballot dated Tuesday, 12th October, 2021. The notice of candidature as received by the Company is available on the website of the Company.

For and On Behalf of the Board of Directors Jindal Worldwide Limited
Sd/-
(Dr. Yamunadutt Agarwal)
DIN:00243192
Chairman / Director

Place : Ahmedabad
Date : 13-10-2021

Classifieds

PERSONAL

CHANGE IN NAME
I Jaydin Singh legally son of No.13992824W Rank Ex-Naik Name Rathod Vijubha Popabha presently Residing at Vill.-Madhuvan Post- Zanjmer Tehsil-Talaja Distt-Bhavnagar, Gujarat. Pincode-364135 have changed my name Jaydin Singh to Rathod Jaydinsinh Vijaysinh pertains to one and the same person as per certificate No. IN-GJ361197422767907 dt.11-10-2021 before Jaypalsinh R Jadeja Notary Bhavnagar, Gujarat

Change Of Name
I have changed my name from **Ojalkumar Jagdishbhai Parmar to Ankit Jagdishbhai Vyas.**
166, Harsiddh Nivas, Hebatpur, Nr. Thaltej, Ahmedabad 380059

Change Of Name
Change name from Govindram Gurumukhdas Khaneja AKA Sindhi to Govindlal Gurumukhdas Khaneja
2/A White House Himmatnagar Sabarkantha

Change of Name
I have Changed My Name From **Nayankumar Ashvinbhai Panchal To New Name Nayan Ashvinbhai Mistry**
ADDRESS
Santoshinagar, Nr. Shiv Fabrication, Dholka Road, Sarkhje, Ahmedabad-380055.

" IMPORTANT "
Whilst care is taken prior to acceptance of advertising copy it is not possible to verify its contents. The Indian Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals advertising in its newspapers or Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in any manner whatsoever.

indianexpress.com

I arrive at a conclusion not an assumption.
Inform your opinion with detailed analysis.

The Indian Express.
For the Indian Intelligent.

The Indian EXPRESS
JOURNALISM OF COURAGE

Residential Coaching Academy (RCA)
A.M.U., Aligarh

Invites Online Applications for Free Coaching for Judicial Services - 2021-22 (for Minorities, SC, ST and Women Candidates)

- Boarding and Lodging for limited number of selected candidates.
- Central Waqf Council will help to meet footing and lodging expenses for limited number of selected Muslim candidates.

Last date for submission of form : 20th October 2021
Entrance Test (Objective) : 28th October 2021
Application Fee : Rs. 500/-
For details visit: <https://amu.ac.in/academies/residential-coaching-academy>
Mobile : +91-7906631262 / 7895702533 (during office hours)
Director

APPENDIX IV A
(See proviso to Rule 8(6))
Sale Notice for sale of immovable property(ies)

E-Auction Sale Notice for sale of immovable asset(s) under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8(6) read with Rule 9(1) of the Security Interest (Enforcement) Rules, 2002

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable property(ies) mortgaged/charged to **Assets Care & Reconstruction Enterprise Ltd. [CIN: U65993DL2002PLC115769] ("Secured Creditor")**, the physical possession of which has been taken by the Authorised Officer of the Secured Creditor, will be sold on "as is where is", "as is what is", "whatever there is" and "without any recourse" basis on **30.10.2021 from 02.00 P.M. to 04.00 P.M.** (with unlimited automated extensions of 5 minutes each in terms of the Tender Document), for recovery of **Rs. 1,11,90,442/- (Rupees One Crore Eleven Lakh Ninety Thousand Four Hundred Forty Two only)** pending towards Loan Account No. **S0110XVI-1** [earlier being Loan Account No. **HLHAHE00271826 ("old Loan Account")**], by way of outstanding principal, arrears (including accrued late charges) and interest till **11.10.2021** with applicable future interest in terms of the Loan Agreement and other related loan document(s) w.e.f. **12.10.2021** along with legal expenses and other charges due to the Secured Creditor from **MR. SHRENIK KIRTILAL SHETH, MRS. JYOTIBEN SHRENIK SHETH @ JYOTIBEN SHETH and DHYANDEV ENTERPRISE PVT. LTD.** The old Loan Account along with its underlying security(ies), including the immovable property(ies), had been assigned to and in favour of the Secured Creditor, acting in its capacity as **Trustee of ACRE-102-Trust**, vide Assignment Agreement dated 26.04.2021.

The Reserve Price of the immovable Property will be **Rs. 1,90,00,000/- (Rupees One Crore Ninety Lakh only)** and the Earnest Money Deposit ("EMD") will be **Rs.19,00,000/- (Rupees Nineteen Lakh only)** i.e. equivalent to 10% of the Reserve Price. The EMD shall be paid by DD/ RTGS/ NEFT or through any other proper banking channels to the credit and in favour of **ACRE-102-TRUST, Account No. 0901102000038988 with IDBI Bank Limited (IFSC: IBKL0000901), having its branch at IFCI TOWER, 61, NEHRU PLACE P.B. NO. 4499 NEW DELHI - 110 019**, before submitting the tender in order to participate in the online public auction. The successful bidder shall pay 25% amount of the sale price (less 10% of the Reserve Price paid before submitting the tender) immediately i.e. either on the same day or not later than the next working day and the remaining balance of the Sale Price shall be paid within 15 days from the date of confirmation of sale.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY(IES)
ALL THE RIGHT, TITLE AND INTEREST OF PROPERTY BEARING BUNGALOW/ TENAMENT NO.5/A ADMEASURING 311-12-50 SQ.YARDS. AND CONSTRUCTION THEREON 103 SQ.YARDS. AS A MEMBER OF "UPLAV CO –OPERATIVE HOUSING SOCIETY LTD". SITUATED AT LAND BEARING FINAL PLOT NO. 229 TO 232, 236 TO 240 OF T.P.SCHEME NO. 22 OF MOUJE PALDI, TALUKA, AHMEDABAD- CITY- WEST, IN THE DISTRICT OF AHMEDABAD AND REGISTRATION SUB DISTRICT OF AHMEDABAD-4 (PALDI).

PROPERTY IS BOUNDED AS UNDER:
EAST : SUBPLOT BUNGALOW NO.5-B
WEST : SUBPLOT/BUNGALOW NO.1-B
NORTH : 40FEET ROAD
SOUTH : SUBPLOT/BUNGALOW NO.4-A

For detailed terms and conditions of the sale, please refer to the link provided on the website of the Secured Creditor i.e. www.acreindia.in and www.auctionfocus.in
Date : 11.10.2021
Place : AHMEDABAD

Sd/
Authorised Officer
ASSET CARE & RECONSTRUCTION ENTERPRISE LTD.
TRUSTEE OF ACRE-102-TRUST

APPENDIX IV A
(See proviso to Rule 8(6))
Sale Notice for sale of immovable property(ies)

E-Auction Sale Notice for sale of immovable asset(s) under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8(6) and Rule 9(1) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable property(ies) mortgaged/charged to **Assets Care & Reconstruction Enterprise Ltd. [CIN: U65993DL2002PLC115769] ("Secured Creditor")**, the physical possession of which has been taken by the Authorised Officer of the Secured Creditor, will be sold on "as is where is", "as is what is", "whatever there is" and "without any recourse" basis on **30.10.2021 from 02.00 P.M. to 04.00 P.M.** (with unlimited automated extensions of 5 minutes each in terms of the Tender Document), for recovery of **Rs. 1,23,01,055/- (Rupees One Crore Twenty Three Lakh One Thousand Fifty Five only)** pending towards Loan Account No. **B001XII** [earlier being Loan Account No. **HLAPSUR00364189 ("old Loan Account")**] by way of outstanding principal, arrears (including accrued late charges) and interest till **11.10.2021** with applicable future interest in terms of the Loan Agreement and other related loan document(s) w.e.f. **12.10.2021** along with legal expenses and other charges due to the Secured Creditor from **RESHMABEN H. JARIWALA @ RESHMABEN HEMISH JARIWALA (PROPRIETOR, BABA STEEL FABRICATORS), MISHAL HEMISH JARIWALA AND HEMISHBHAI R. JARIWALA @ HEMISH RASIKLAL JARIWALA** The old Loan Account along with its underlying security(ies), including the immovable property(ies), had been assigned to and in favour of the Secured Creditor, acting in its capacity as **Trustee of ACRE-102-Trust**, vide Assignment Agreement dated 26.04.2021.

The Reserve Price of the immovable Property will be **Rs. 80,00,000/- (Rupees Eighty Lakh only)** and the Earnest Money Deposit ("EMD") will be **Rs. 8,00,000/- (Rupees Eight Lakh only)** i.e. equivalent to 10% of the Reserve Price. The EMD shall be paid by DD/ RTGS/ NEFT or through any other proper banking channels to the credit and in favour of **ACRE-102-TRUST, Account No. 0901102000038988 with IDBI Bank Limited (IFSC: IBKL0000901)**, having its branch at IFCI TOWER, 61, NEHRU PLACE P.B. NO. 4499 NEW DELHI - 110 019, before submitting the tender in order to participate in the online public auction. The successful bidder shall pay 25% amount of the sale price (less 10% of the Reserve Price paid before submitting the tender) immediately i.e. either on the same day or not later than the next working day and the remaining balance of the Sale Price shall be paid within 15 days from the date of confirmation of sale.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY(IES)
PROPERTY NO.-1
THE PREMISES BEARING OFFICE NO. 401 AND 402 HAVING SUPER BUILTUP AREA ADMEASURING 1608 SQ. FEETS. AND 418 SQ. FEETS. TALLING TO 2026 SQ. FEETS AND WHOSE SERIAL BUILT UP AREA 19.42 SQ. MTS. AND 19.42 SQ. MTS. TOTALING TO 94.14 SQ. MTS. ON FOURTH FLOOR OF COMMERCIAL BUILDING CONSTRUCTED AND KNOWN AS NISHAL SHOPPING CENTRE AND UNDIVIDED SHARE OF ALL THE PROPERTY HOLDERS INCLUDING GROUND FLOOR AND INCLUDING ALL THE COMMON RIGHTS IN THE LAND BEARING REVENUE SURVEY NO 479 AND 482, REGISTERED VIDE BLOCK NO 447/B ADMEASURING 2529 SQ. MTS. AND HAVING T.P. SCHEME NO 16 (PAL) OF O. P. NO. 17/2 AND FP NO.32 ADMEASURING 1821 SQ MTS OF NON AGRICULTURAL LAND SITUATED AT MOUJE GAM PALADAJAN (SURAT CITY) DISTRICT SURAT-395009, GUJARAT AND WHICH IS BOUNDED AS FOLLOWS:
NORTH : 24 MTS. T.P. ROAD SOUTH : LAND OF F.P. NO. 121.
EAST : LAND OF F.P. NO. 31. WEST :12 MTS. T.P. ROAD.

PROPERTY NO.-2
THE PREMISES BEARING OFFICE NO. 403 AND 404 HAVING SUPER BUILTUP AREA ADMEASURING 418 SQ. FEETS. AND 425 SQ. FEETS. TALLING TO 843 SQ. FEETS AND WHOSE SERIAL BUILT UP AREA 19.42 SQ. MTS. AND 19.75 SQ. MTS. TOTALING TO 39.17 SQ. MTS. ON FOURTH FLOOR OF COMMERCIAL BUILDING CONSTRUCTED AND KNOWN AS NISHAL SHOPPING CENTRE AND UNDIVIDED SHARE OF ALL THE PROPERTY HOLDERS INCLUDING GROUND FLOOR AND INCLUDING ALL THE COMMON RIGHTS IN THE LAND BEARING REVENUE SURVEY NO 479 AND 482, REGISTERED VIDE BLOCK NO 447/B ADMEASURING 2529 SQ. MTS. AND HAVING T.P. SCHEME NO 16 (PAL) OF O. P. NO. 17/2 AND FP NO.32 ADMEASURING 1821 SQ MTS OF NON AGRICULTURAL LAND SITUATED AT MOUJE GAM PAL ADAJAN (SURAT CITY) DISTRICT SURAT-395009, GUJARAT AND WHICH IS BOUNDED AS FOLLOWS:
NORTH : 24 MTS. T.P. ROAD SOUTH : LAND OF F.P. NO. 121.
EAST : LAND OF F.P. NO. 31. WEST :12 MTS. T.P. ROAD.

PROPERTY NO.-2
THE PREMISES BEARING OFFICE NO. 403 AND 404 HAVING SUPER BUILTUP AREA ADMEASURING 418 SQ. FEETS. AND 425 SQ. FEETS. TALLING TO 843 SQ. FEETS AND WHOSE SERIAL BUILT UP AREA 19.42 SQ. MTS. AND 19.75 SQ. MTS. TOTALING TO 39.17 SQ. MTS. ON FOURTH FLOOR OF COMMERCIAL BUILDING CONSTRUCTED AND KNOWN AS NISHAL SHOPPING CENTRE AND UNDIVIDED SHARE OF ALL THE PROPERTY HOLDERS INCLUDING GROUND FLOOR AND INCLUDING ALL THE COMMON RIGHTS IN THE LAND BEARING REVENUE SURVEY NO 479 AND 482, REGISTERED VIDE BLOCK NO 447/B ADMEASURING 2529 SQ. MTS. AND HAVING T.P. SCHEME NO 16 (PAL) OF O. P. NO. 17/2 AND FP NO.32 ADMEASURING 1821 SQ MTS OF NON AGRICULTURAL LAND SITUATED AT MOUJE GAM PAL ADAJAN (SURAT CITY) DISTRICT SURAT-395009, GUJARAT AND WHICH IS BOUNDED AS FOLLOWS:
NORTH : 24 MTS. T.P. ROAD SOUTH : LAND OF F.P. NO. 121.
EAST : LAND OF F.P. NO. 31. WEST :12 MTS. T.P. ROAD.

For detailed terms and conditions of the sale, please refer to the link provided on the website of the Secured Creditor i.e. www.acreindia.in and www.auctionfocus.in.
Date : 11.10.2021
Place : SURAT

Sd/
Authorised Officer
ASSET CARE & RECONSTRUCTION ENTERPRISE LTD.
TRUSTEE OF ACRE-102-TRUST

Shirpur Warvade Municipal Council, Shirpur, Dist.Dhule
Public Work Department

E-TENDER NOTICE

जावक क्रमांक 2643 सन

दिनांक: 13/10/2021

E-Tender notice are invited by undersigned in the percentage form from eligible registered under Government of Maharashtra PWD contractors through online e-Tendering process for tenders for Pradhanmantri Aawas Yojana AHP project at S.No.60/1A, 1B, 2A, 2B & 60/3 Of Shirpur Warvade Municipal Council, Shirpur, Dist.Dhule Detailed documents as above are available at <https://mahatenders.gov.in> from 14/10/2021 from 10.00 am.

(Shri. Tushar Nerkar)
Chief officer

(Sau.Jayashriben Amarishbhai Patel)
President

JINDAL WORLDWIDE LIMITED
CIN: L17110GJ1986PLC008942
Regd. & Corp. Office: "Jindal House", Opp. Dmart, I.O.C Petrol Pump Lane, Shivranjani Shyamal 132 Ft Ring Road, Satellite, Ahmedabad - 380015 • E-Mail Id: csjindal@jindaltextiles.com
Website: www.jindaltextiles.com • Phone: 079-71001500

NOTICE OF POSTAL BALLOT
Pursuant to Section 108, 110 and other applicable provisions, if any, of the Companies Act, 2013, (the "Act"), read with Rule 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014, (the "Rules") and Ministry of Corporate Affairs (MCA) General Circular No. 14/2020 dated 8th April, 2020, General Circular No. 17/2020 dated 13th April, 2020 read with General Circular No. 22/2020 dated 15th June, 2020, General Circular No. 33/2020 dated 28th September, 2020 and General Circular No. 39/2020 dated 31st December, 2020 and General Circular No.10/2021 dated 23rd June, 2021 (hereinafter known as MCA Circulars) and Regulation 44 of the SEBI (LODR) Regulations, 2015 (including any statutory modification or re-enactment thereof for the time being in force) and further to the approval of the Board of Directors in its meeting held on 12th October, 2021 to convene a Postal Ballot process, Notice is hereby given that the Special Businesses as set out in the Notice of Postal Ballot dated 12th October, 2021 for seeking approval of shareholders of the Company are proposed to be passed as Special Resolutions by the Shareholders of the Company by means of Postal Ballot through voting by electronic means only (i.e. remote e-voting only). The members are further hereby informed that:

1. DISPATCH
In compliance with the aforementioned MCA circulars, Electronic copies of the Notice of Postal Ballot dated 12th October, 2021 have been sent to all the members whose E-Mail IDs are registered with the Company or the Registrar and Share Transfer Agent (the "RTA"), i.e., M/s. Cameo Corporate Services Limited as per the Register of Members dated Friday, 08th October, 2021 for seeking approval on agenda items as tabled underneath by means of Remote e-voting.
A printable copy of the Postal Ballot Notice shall also be made available on the website of the Company "www.jindaltextiles.com" and on the website of BSE Limited "www.bseindia.com" and National Stock Exchange of India Limited "www.nseindia.com" and on the website of CDSL at www.evotingindia.com as per the provisions of the Companies Act, 2013.
The dispatch via E-Mail was completed on Wednesday, 13th October, 2021 in accordance with applicable laws.

Members may please hereby note that the physical copy of Postal Ballot Notice along with Postal Ballot Forms and pre-paid business envelope shall not be sent to the shareholders for this Postal Ballot as the same has been dispensed vide MCA Circulars and that all communication of shareholders for assent/ dissent will only take place through the remote e-voting system. Further, for the purpose of updation of the correct and valid details more specifically the E-mail id, members who have not registered their email id or KYC details or members who want to update the same are requested to fill in the all the details as required in the said "KYC Updating Form" which forms an integral part of this Notice of Postal Ballot and send the signed "KYC Updating Form" to the RTA of the Company and a copy of same at the Registered Office of the Company.

Item No.	Particulars of Agenda	Type of Business / Resolution / Proposed Manner of Approval
1.	To consider and approve for giving authorization to Board of Directors under Section 180(1)(c) of the Companies Act, 2013 upto an aggregate revised limit of Rs. 1,600 Crores, by means of Postal Ballot Process	
2.	To consider and approve for giving authorization to Board of Directors under Section 180(1)(a) of the Companies Act, 2013 upto an aggregate revised limit of Rs. 1,600 Crores, by means of Postal Ballot Process.	
3.	To consider and approve for giving authorization to Board of Directors to advance any loan, give any Guarantee or to provide any security to all such person specified under Section 185 of the Companies Act, 2013 upto an aggregate limit of Rs. 1,500 Crores, by means of Postal Ballot Process.	Special Business / Special Resolution / Postal Ballot Process
4.	To consider and approve for giving authorization to Board of Directors under Section 186 of the Companies Act, 2013 upto an aggregate revised limit of Rs. 1,500 Crores, by means of Postal Ballot Process.	
5.	To consider and approve the appointment of Ms. Jasdev Kaur Rait (DIN-09354682) as a Non-Executive Independent Director of the Company, by means of Postal Ballot process.	

2. E-VOTING: (Pursuant to Section 108 of the Companies Act, 2013, read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended by the Companies (Management and Administration) Amendment Rules, 2015, and pursuant to Regulation 44 of SEBI (LODR) Regulations, 2015).

Members holding shares either in Physical form or in Dematerialized form, as on the cut-off date of Friday, 08th October, 2021, may cast their vote through electronic voting system (E-Voting) on the Special Businesses as set out in the Notice of Postal Ballot, as per the e-voting instructions stated in the Notice of Postal Ballot. The Company has availed E-Voting Services from Central Depository Service (India) Limited (CDSL) as per the details tabled below:

Date of Commencement of Remote E-Voting Period	Thursday, 14 th October, 2021 (9:00 A.M.)
Date of End of Remote E-Voting Period	Friday, 12 th November, 2021 (5:00 P.M.)
Cut-off date for determining the eligibility of members to vote through electronic means	Friday, 08 th October, 2021
Scrutinizer to the E-Voting Process	M/S. SPANJ & ASSOCIATES, Practicing Company Secretaries, Ahmedabad • E-mail: csdoshia@gmail.com
Contact Details for redressal of grievances connected with Remote E-Voting:	
Login type-Individual Shareholders holding securities in Demat mode with CDSL	Members facing any technical issue in login can contact CDSL helpdesk by sending a request at helpdesk.evoting@cdsindia.com or contact at 022- 23058738 and 022- 23058542-43.
Login type-Individual Shareholders holding securities in Demat mode with NSDL	Members facing any technical issue in login can contact NSDL helpdesk by sending a request at evoting@nsdl.co.in or call at toll free no.: 1800 1020 990 and 1800 22 44 30.
For Other Login types	CENTRAL DEPOSITORY SERVICES (INDIA) LIMITED, Mr. Rakesh Dalvi, Sr. Manager, (CDSL) Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futrex, Mafatlal Mill Compounds, N.M.Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013. Phone: (022-23058738) or (022-23058543) or (022-23058542) E-mail Id: helpdesk.evoting@cdsindia.com


3. GENERAL INFORMATION: The members are requested to note that: i. Once the vote on a resolution is cast, the shareholders shall not be allowed to change it subsequently or cast vote again. The remote e-voting module shall be disabled at 5.00 p.m. on 12th November, 2021 and e-voting shall not be allowed beyond the same. ii. Those Shareholders whose E-Mail IDs are not registered with the depositories for obtaining login credentials for e-voting for the resolutions proposed in this Notice are requested to submit the following through their registered E-Mail IDs to the respective E-Mail IDs of the Company/RTA:

- For Physical Shares-** Name of Shareholder, Folio No., scanned copy of the Share Certificate (front and back), self-attested scanned copy of PAN Card & ADHAR Card
- For Dematerialized Shares-** Name of Shareholder, Demat Account Details (CDSL-16 digit beneficiary ID or NSDL-16 digit DP ID & Client ID), Client Master Report, Consolidated Demat Account Statement, Self-Attested scanned copy of PAN Card & ADHAR Card.

On receipt of the requests as above, the Company/RTA shall coordinate with CDSL and provide the login credentials accordingly. iii. Resolutions passed by the Members through postal ballot is deemed to have been passed as if they have been passed at the General Meeting of the Members of the Company and the last date of E-Voting Period i.e. Friday, 12th November, 2021 (5:00 p.m. IST) shall be construed as the date on which the resolutions would be deemed to have been passed, if approved by Shareholders of the Company. iv. In case of any other queries members may write an E-Mail to "csjindal@jindaltextiles.com" or may contact through the contact details as mentioned in the Notice of Postal Ballot.

For and On Behalf of the Board of Directors Jindal Worldwide Limited
Sd/-
(Dr. Yamunadutt Agarwal)
Chairman / Director
DIN:00243192
Place : Ahmedabad
Date : 13th October, 2021

Ahmedabad

केनरा बैंक  **Gandhidham Branch**

POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, the undersigned being the Authorized Officer of Canara Bank, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a **Demand Notice dated 28.05.2021** calling upon the **Borrower Mr. Ashok Shivdayal Sharma (Borrower) and Mrs. Alka Devi Sharma (Co-Borrower) and (Guarantor)** to repay the amount mentioned in the notice being **Rs. 20,09,120.15 (Rs. Twenty Lakhs Nine Thousand One Hundred Twenty and Paise Fifteen Only) plus further interest from 01.03.2020 in Housing Finance** within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general, that the undersigned has taken **Symbolic Possession** described herein below in exercise of power conferred on him/her under Section 13(4) of the said Act, read with Rule 8 & 9 of the Said Rules on this **25th day of October of the year 2021**.


The borrower's attention is invited to provisions of section 13 (8) of the Act, in respect of time available, to redeem the secured assets.

The Borrower in particular, and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Canara Bank, Gandhidham Branch for an amount of **Rs. 20,09,120.15 (Rs. Twenty Lakhs Nine Thousand One Hundred Twenty and Paise Fifteen Only) plus further interest from 01.03.2020 in Housing Finance**.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

EMT of Residential Plot No. 269, Revenue Survey No. 474, Varsamed, Anjar, Kutchh-370110. **Bounded by:** North: Plot No. 270, South: Plot No. 268, East: 12.20 Mtrs. Wide Road, West: 1.52 Mtrs. Lane and then Plot No. 262.

Date: 25.10.2021 | Place: Gandhidham | Authorised Officer, Canara Bank

केनरा बैंक  **Anjar Branch**

POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, the undersigned being the Authorized Officer of Canara Bank, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a **Demand Notice dated 27.05.2021** calling upon the **Borrower Mrs. Bhakti Amresh Mahto (Borrower) and Mr. Amresh G. Mahto (Co-Borrower)** to repay the amount mentioned in the notice being **Rs. 12,37,512.86 (Rs. Twelve Lakhs Thirty Seven Thousand Five Hundred Twelve and Paise Eighty Six Only) + further interest from 01.03.2020 in Housing Loan-Pradhan Mantri Awas Yojna** within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general, that the undersigned has taken **Symbolic Possession** described herein below in exercise of power conferred on him/her under Section 13(4) of the said Act, read with Rule 8 & 9 of the Said Rules on this **26th day of October of the year 2021**.


The borrower's attention is invited to provisions of section 13 (8) of the Act, in respect of time available, to redeem the secured assets.

The Borrower in particular, and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Canara Bank, Anjar Branch for an amount of **Rs. 12,37,512.86 (Rs. Twelve Lakhs Thirty Seven Thousand Five Hundred Twelve and Paise Eighty Six Only) + further interest from 01.03.2020 in Housing Loan-Pradhan Mantri Awas Yojna**.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

EMT of Residential House situated at Plot No. 155, 156, Ambaji Nagar-8, Survey No. 529, Varsamed, Anjar, Kutchh. **Bounded by:** North: Common Plot No. 2, South: Plot No. 157, East: 6.10 Mtrs. Road, West: 1.50 Mtrs. Lane.

Date: 26.10.2021 | Place: Gandhidham | Authorised Officer, Canara Bank

केनरा बैंक  **Gandhidham Branch**

POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, the undersigned being the Authorized Officer of Canara Bank, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a **Demand Notice dated 31.05.2021** calling upon the **Borrower Mrs. Ahir Santiben Hajabhai (Borrower) and Mr. Ahir Hajabhai (Co-Borrower)** to repay the amount mentioned in the notice being **Rs. 17,38,866.65 (Rs. Seventeen Lakhs Thirty Eight Thousand Eight Hundred Sixty Six and Paise Sixty Five Only) plus further interest from 01.03.2020 in Housing Loan-Pradhan Mantri Awas Yojna** within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general, that the undersigned has taken **Symbolic Possession** described herein below in exercise of power conferred on him/her under Section 13(4) of the said Act, read with Rule 8 & 9 of the Said Rules on this **26th day of October of the year 2021**.


The borrower's attention is invited to provisions of section 13 (8) of the Act, in respect of time available, to redeem the secured assets.

The Borrower in particular, and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Canara Bank, Gandhidham Branch for an amount of **Rs. 17,38,866.65 (Rs. Seventeen Lakhs Thirty Eight Thousand Eight Hundred Sixty Six and Paise Sixty Five Only) plus further interest from 01.03.2020 in Housing Loan- Pradhan Mantri Awas Yojna**.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

EMT of Residential Plot No. 115, Revenue Survey No. 529, Ambaji Nagar-8, Varsamed, Anjar. **Bounded by:** North: Plot No. 114, South: Plot No. 116, East: 1.50 Mtrs. Lane, West: 12.00 Mtrs. Lane.

Date: 26.10.2021 | Place: Gandhidham | Authorised Officer, Canara Bank

केनरा बैंक  **Anjar Branch**

POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, the undersigned being the Authorized Officer of Canara Bank, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a **Demand Notice dated 27.05.2021** calling upon the **Borrower Mrs. Arti Bhardwaj (Borrower) and Mr. Deepak Bhardwaj (Co-Borrower)** to repay the amount mentioned in the notice being **Rs. 12,77,361.00 (Rs. Twelve Lakhs Seventy Seven Thousand Three Hundred Sixty One Only) + further interest from 01.03.2020 in Housing Loan-Pradhan Mantri Awas Yojna** within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general, that the undersigned has taken **Symbolic Possession** described herein below in exercise of power conferred on him/her under Section 13(4) of the said Act, read with Rule 8 & 9 of the Said Rules on this **26th day of October of the year 2021**.


The borrower's attention is invited to provisions of section 13 (8) of the Act, in respect of time available, to redeem the secured assets.

The Borrower in particular, and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Canara Bank, Anjar Branch for an amount of **Rs. 12,77,361.00 (Rs. Twelve Lakhs Seventy Seven Thousand Three Hundred Sixty One Only) + further interest from 01.03.2020 in Housing Loan-Pradhan Mantri Awas Yojna**.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

EMT of Residential House at Plot No. 171, Ambaji Nagar-6, Survey No. 463, Varsamed, Anjar, Kutchh. **Bounded by:** North: Plot No. 170, South: Plot No. 172, East: 9.14 Mtrs. Road, West: Plot No. 140.

Date: 26.10.2021 | Place: Gandhidham | Authorised Officer, Canara Bank

केनरा बैंक  **Anjar Branch**

POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, the undersigned being the Authorized Officer of Canara Bank, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a **Demand Notice dated 27.05.2021** calling upon the **Borrower Mrs. Vidya Charan (Borrower) and Mr. Bhanwar Singh Charan (Co-Borrower)** to repay the amount mentioned in the notice being **Rs. 9,92,086.00 (Rs. Nine Lakhs Ninety Two Thousand Eighty Six Only) + further interest from 01.03.2020 in Housing Loan-Pradhan Mantri Awas Yojna** within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general, that the undersigned has taken **Symbolic Possession** described herein below in exercise of power conferred on him/her under Section 13(4) of the said Act, read with Rule 8 & 9 of the Said Rules on this **26th day of October of the year 2021**.


The borrower's attention is invited to provisions of section 13 (8) of the Act, in respect of time available, to redeem the secured assets.

The Borrower in particular, and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Canara Bank, Anjar Branch for an amount of **Rs. 9,92,086.00 (Rs. Nine Lakhs Ninety Two Thousand Eighty Six Only) + further interest from 01.03.2020 in Housing Loan-Pradhan Mantri Awas Yojna**.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

EMT of Residential House at Plot No. 334, Survey No. 395/1, 395/1-Paiki-1, 395/1-Paiki-2, Ambaji Residency, Varsamed, Anjar-370110. **Bounded by:** North: Plot No. 335, South: Plot No. 333, East: 1.52 Mtrs. Lane, West: 9.14 Mtrs. Road.

Date: 26.10.2021 | Place: Gandhidham | Authorised Officer, Canara Bank

केनरा बैंक  **Gandhidham Branch**

POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, the undersigned being the Authorized Officer of Canara Bank, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a **Demand Notice dated 27.05.2021** calling upon the **Borrower Mrs. Sunita Balraj Sharma (Borrower) and Mr. Balraj Sharma (Co-Borrower)** and (Guarantor) to repay the amount mentioned in the notice being **Rs. 13,99,786.00 (Rs. Thirteen Lakhs Ninety Nine Thousand Seven Hundred Eighty Six Only) plus further interest from 01.03.2020 in Housing Finance** within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general, that the undersigned has taken **Symbolic Possession** described herein below in exercise of power conferred on him/her under Section 13(4) of the said Act, read with Rule 8 & 9 of the Said Rules on this **25th day of October of the year 2021**.


The borrower's attention is invited to provisions of section 13 (8) of the Act, in respect of time available, to redeem the secured assets.

The Borrower in particular, and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Canara Bank, Gandhidham Branch for an amount of **Rs. 13,99,786.00 (Rs. Thirteen Lakhs Ninety Nine Thousand Seven Hundred Eighty Six Only) plus further interest from 01.03.2020 in Housing Finance**.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

EMT of Residential Plot No. 52, Revenue Survey No. 469/5, Baghashree Township-7, Varsamed, Anjar. **Bounded by:** North: 9.14 Mtrs. Road, South: Revenue Survey No. 469 Paiki, East: Plot No. 53, West: Plot No. 51.

Date: 25.10.2021 | Place: Gandhidham | Authorised Officer, Canara Bank

केनरा बैंक  **Gandhidham Branch**

POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, the undersigned being the Authorized Officer of Canara Bank, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a **Demand Notice dated 31.05.2021** calling upon the **Borrower Mrs. Sujata Kashinath Dahne (Borrower) and Mr. Akhileendra Pratap Singh (Co-Borrower)** to repay the amount mentioned in the notice being **Rs. 3,81,831.79 (Rs. Three Lakhs Eighty One Thousand Eight Hundred Thirty One and Paise Seventy Nine Only) + further interest from 01.03.2020 in Housing Loan-Pradhan Mantri Awas Yojna** within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general, that the undersigned has taken **Symbolic Possession** described herein below in exercise of power conferred on him/her under Section 13(4) of the said Act, read with Rule 8 & 9 of the Said Rules on this **26th day of October of the year 2021**.

The borrower's attention is invited to provisions of section 13 (8) of the Act, in respect of time available, to redeem the secured assets.

The Borrower in particular, and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Canara Bank, Gandhidham Branch for an amount of **Rs. 3,81,831.79 (Rs. Three Lakhs Eighty One Thousand Eight Hundred Thirty One and Paise Seventy Nine Only) + further interest from 01.03.2020 in Housing Loan-Pradhan Mantri Awas Yojna**.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

EMT of Residential Plot No. 26/A, Revenue Survey No. 890/19, Ambaji Nagar-2, Varsamed, Anjar. **Bounded by:** North: Plot No. 26/B, South: Plot No. 25/B, East: Plot No. 19/A, West: 7.50 Mtrs. Road.

Date: 25.10.2021 | Place: Gandhidham | Authorised Officer, Canara Bank

केनरा बैंक  **Gandhidham Branch**

POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, the undersigned being the Authorized Officer of Canara Bank, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a **Demand Notice dated 28.05.2021** calling upon the **Borrower Mr. Satya Prakash D. Pandey (Borrower) and Mr. Deviprasad Pandey (Co-Borrower) and (Guarantor)** to repay the amount mentioned in the notice being **Rs. 21,52,987.89 (Rs. Twenty One Lakhs Fifty Two Thousand Nine Hundred Eighty Seven and Paise Eighty Nine Only) plus further interest from 01.03.2020 in Housing Finance** within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general, that the undersigned has taken **Symbolic Possession** described herein below in exercise of power conferred on him/her under Section 13(4) of the said Act, read with Rule 8 & 9 of the Said Rules on this **25th day of October of the year 2021**.

The borrower's attention is invited to provisions of section 13 (8) of the Act, in respect of time available, to redeem the secured assets.

The Borrower in particular, and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Canara Bank, Gandhidham Branch for an amount of **Rs. 21,52,987.89 (Rs. Twenty One Lakhs Fifty Two Thousand Nine Hundred Eighty Seven and Paise Eighty Nine Only) plus further interest from 01.03.2020 in Housing Finance**.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

EMT of Residential Plot No. 134, Revenue Survey No. 474, Varsamed, Anjar, Kutchh-370110 **Bounded by:** North: Plot No. 133, South: Plot No. 135, East: 1.52 Mtrs. Lane and then Plot No. 192, West: 9.14 Mtrs. Internal Road.

Date: 25.10.2021 | Place: Gandhidham | Authorised Officer, Canara Bank

JINDAL WORLDWIDE LIMITED						
CIN: L17110GJ1986PLC008942						
Regd. & Corp. Office: "Jindal House", Opp. Dmart, I.O.C Petrol Pump Lane, Shivranjani Shyamal 132 Ft Ring Road, Satellite, Ahmedabad - 380015 • E-Mail Id: csjindal@jindalteltextiles.com Website: www.jindalteltextiles.com • Phone: 079-71001500						
STATEMENT OF STANDALONE & CONSOLIDATED UN-AUDITED FINANCIAL RESULTS (AS PER SCHEDULE III OF COMPANIES ACT, 2013 AND IND-AS)						
* For the Quarter & Half Year Ended 30th September, 2021 *						
{Pursuant to Regulation 47(1)(b) of SEBI (LODR) Regulations, 2015}						
(Amount in Lakhs except EPS)						
Sr. No.	Particulars	Quarter Ended 3 Months ended of C.Y. 30.09.2021 (Un-Audited)	Quarter Ended Preceding 3 months ended in P.Y. 30th June, 2021 (Un-Audited)	Quarter Ended 3 months ended in P.Y. 30th Sept., 2020 (Un-Audited)	Half Year Ended 6 months ended of C.Y. 30th Sept., 2021 (Un-Audited)	Year Ended 6 months ended of P.Y. 31st March, 2021 (Audited)
STANDALONE						
1.	Total income from operations (net)	61504.63	51921.37	38693.87	113426.00	43426.47
2.	Net Profit/(Loss) for the period (before Tax , Exceptional and/or Extraordinary items)	3300.29	2341.71	2309.32	5642.00	561.85
3.	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items).	3300.29	2341.71	2309.32	5642.00	561.85
4.	Net Profit/(Loss) for the period after tax (after exceptional and/or Extraordinary items)	2470.76	1762.65	1741.80	4233.41	4409.83
5.	Total Comprehensive income for the period after share of profit after associates and minority interest [Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	2470.76	1762.65	1741.80	4233.41	4409.83
6.	Equity Share Capital	2005.20	2005.20	2005.20	2005.20	2005.20
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet as at Previous Financial Year ended 31st March 2021.	NA	NA	NA	NA	39977.20
8.	Earnings per share (of Rs.1/- each) (for continuing and discontinued operations) : 1. Basic	1.23	0.88	0.87	2.11	0.21
	2. Diluted	1.23	0.88	0.87	2.11	0.21
CONSOLIDATED						
1.	Total income from operations (net)	63050.69	52442.54	41368.26	115493.23	46821.48
2.	Net Profit/(Loss) for the period (before Tax , Exceptional and/or Extraordinary items)	3315.49	2517.26	2061.87	5832.75	410.76
3.	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items).	3315.49	2517.26	2061.87	5832.75	410.76
4.	Net Profit/(Loss) for the period after tax (after exceptional and/or Extraordinary items)	2500.44	1889.32	1495.84	4389.76	269.89
5.	Total Comprehensive income for the period after share of profit after associates and minority interest [Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	2500.57	1889.54	1760.15	4390.11	270.32
6.	Equity Share Capital	2005.20	2005.20	2005.20	2005.20	2005.20
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet as at Previous Financial Year ended 31st March 2021.	NA	NA	NA	NA	40038.94
8.	Earnings per share (of Rs.1/- each) (for continuing and discontinued operations) : 1. Basic	1.25	0.94	0.88	2.19	0.13
	2. Diluted	1.25	0.94	0.88	2.19	0.13

Notes :

- The above Un-Audited Standalone & Consolidated Financial Statements of the Company for the quarter & half year ended 30th September, 2021 have been reviewed and recommended by the Audit Committee and are approved by the Board of Directors at their respective meeting held on 29th October, 2021.
- The Company has adopted, Indian Accounting Standards prescribed under Section 133 of the Companies Act, 2013 ('Ind-AS') from 1st April, 2017 and accordingly these financial results and all the periods presented have been prepared in accordance with the recognition and measurement principles laid down in IND-AS 34 'Interim Financial Reporting' read with relevant rules issued thereunder and the other accounting principles generally accepted in India and discloses the information required to be disclosed in terms of Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015 (as amended).
- The Statutory Auditors of the Company have carried out a Limited Review of the above Standalone & Consolidated Financial Statements of the Company for the quarter & half year ended 30th September, 2021 in terms of Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015 and have issued an unmodified Limited Review Report.
- The figures for the corresponding previous periods have been regrouped/rearranged wherever necessary, to make them comparable.
- The above is an extract of the detailed format of Un-Audited Standalone & Consolidated Financial Results for the quarter ended 30th September, 2021 filed with the Stock Exchanges (BSE & NSE) under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The detailed statement of Financial Results alongwith Standalone & Consolidated Independent Limited Review Report is available on the website of BSE Limited (www.bseindia.com), National Stock Exchange of India Limited (www.nseindia.com) and also on the website of the Company (www.jindalteltextiles.com).

**For and On Behalf of the Board
For JINDAL WORLDWIDE LIMITED
Sd/-
(MR. AMIT AGRAWAL)
Managing Director
DIN : 00169061**

Date : 30th October, 2021
Place : Ahmedabad


AYM SYNTAX LIMITED						
CIN : L99999DN1983PLC000045						
Regd Off : Survey No. 374/1/1, Saily Silvassa- 396230 (U. T. of Dadra & Nagar Haveli) Tel: + 91-22-61637000/61637001 Fax: +91-22-24937725 Email id: complianceofficer@aymgroup.com						
EXTRACT OF STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2021						
Sr. No.	PARTICULARS	Quarter Ended (Unaudited)		Half Year Ended (Unaudited)		Year Ended (Audited)
		30-09-2021	30-06-2021	30-09-2020	30-06-2020	31-03-2021
1	Total income from operations (net)	37,968	30,776	21,285	68,744	30,434
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	2,088	1,420	146	3,508	(2,370)
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	2,088	1,420	146	3,508	(2,370)
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	1,323	924	92	2,247	(1,547)
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	1,340	916	127	2,256	(1,515)
6	Paid up equity capital (Face value of Rs. 10/- each)	5,015	5,004	5,004	5,015	5,004
7	Reserves (excluding Revaluation Reserve)	-	-	-	-	-30,762
8	Earnings Per Share (before extraordinary items) (of Rs 10/- each)	2.64	1.85	0.25	4.49	(3.03)
	Basic :	2.61	1.83	0.25	4.44	(3.04)
	Diluted:	-	-	-	-	-

Notes: The above is the extract of the detailed format of Quarter ended Financial results filed with the Stock exchanges under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2015. The full format of the Quarter ended Financial results are available on the BSE website (www.bseindia.com), NSE website (www.nseindia.com) and on the Company's website (www.aymsyntax.com).

- Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind AS Rules / AS Rules, whichever is applicable.

For and on behalf of the Board For AYM Syntax Limited
Sd/-
Abhishek Mandawewala
Managing Director & CEO
DIN:00737785

Place: Mumbai
Date : October 30, 2021



Fullerton

Grihashakti

franda hai tek Rastai hai

FULLERTON INDIA HOME FINANCE COMPANY LIMITED

Corporate Office: Floor 5 & 6, B-Wing, Supreme IT Park, Supreme City, Powai, Mumbai - 400076.

Regd. Office: Megh Towers, Floor 3, Old No. 307, New No. 165, Poonamallee High Road, Madhavayal, Chennai - 600095.

POSSESSION NOTICE [APPENDIX (IV) RULE 8(1)]

Whereas the undersigned being the Authorized Officer of Fullerton India Home Finance Company Limited a Housing Finance Company (duly registered with National Housing Bank (Fully Owned by RBI)) (hereinafter referred to as "FIHFCU") having its registered office at Megh Towers, Floor 3, Old No. 307, New No. 165, Poonamallee High Road, Madhavayal, Chennai, Tamilnadu-600095 under Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002), and in exercise of the powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued Demand Notice dated mentioned below under Section 13(2) of the said Act calling upon you being the borrowers (names and addresses mentioned below) to repay the amount mentioned in the said notice and interest thereon within 60 days from the date of receipt of the said notice. The borrowers mentioned herein below having failed to repay the amount, notice is hereby given to the borrowers mentioned herein below and to the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on me under sub-section (4) of Section 13 of the Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002. The borrowers mentioned here in above in particular and the public in general are hereby cautioned not to deal with said property and any dealings with the property will be subject to the charge of Fullerton India Home Finance Company Limited for an amount as mentioned herein under and interest thereon. The borrower's attention is invited to provisions of sub-section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Sr. No.	Name of the Borrower(s) / Co-Borrower(s) & Loan Account No.	Description Of Secured Asset	Demand Notice Date & Amount	Date of Possession
1)	<p>Loan A/c No.: 603807210607102 & 603807510633815</p> <p>1) Ebhlibhai Chhaganbhai Rathod, S/o. Chhaganbhai U Rathod,</p> <p>2) Gajuben Abhlibhai Rathod, W/o. Abhlibhai Rathod</p> <p>Add. 1: Har Bhole Society, Patel Vadi Main Road, Gondal, Behind Mahadev Temple, Gondal, Gujarat - 360311. Add. 2: RS No. 117 3 P, Plot No. 9 B P Part A Harbhole, Society Patelwadi Main Road, Behind Mahadev Temple - 360311</p>	<p>All that piece and parcel of property bearing residential property of Sub-Plot No. 9/B Paiki Part-A land admeasuring 68.38 Sq.Mts. with building thereon of revenue Survey No. 117/3 Paiki of Gondal of District Rajkot. Boundaries: North- Road; East- West Land South- Other's property of Plot No. 12/B; West- Other's Property of Part-B of Plot No. 9/B.</p>	<p>Date: 09.08.2021</p> <p>Rs. 11,56,815.41/ (Rupees Eleven Lakhs Fifty Six Thousand Eight Hundred Fifteen and Paise Forty One Only)</p>	<p>25.10.2021</p> <p>(Symbolic Possession)</p>
2)	<p>Loan Account Number: 603807210572394</p> <p>1) Hitesh Rajubhai Jinjariya, S/o. Rajubhai Jinjariya</p> <p>2) Shital Jitendrabhai Mayani, D/o. Jitendrabhai Mayani</p> <p>Add. 1: Madhav Vatika Plot No. 73, Street No. 2 Manda Dunga Main Road, Behind Gokul Nagar, Bhavnagar Hay Way, Rajkot, Gujarat - 360003. Add. 2: Flat No. 302, 3rd Floor, Vaibhav Flats, Behind Ganteshwar Park, Near Crystal School, Jamnagar Rajkot Highway - 360006.</p>	<p>All that piece and parcels of property bearing immovable constructed residential property 55.13 Sq.Mts. Situated at Ganteshwar revenue Survey No. 23 P, Plot No. 14 P, Vaibhav Flat, 3rd Floor, Flat No. 302 at Rajkot. Boundaries: North- Flat No. 301; East- Common Margin then Others Property; South- Common Margin then Road; West- Common Passage.</p>	<p>Date: 09.08.2021</p> <p>Rs. 14,59,424.55/ (Rupees Fourteen Lakhs Fifty Nine Thousand Four Hundred Twenty Four and Paise Fifty Five Only)</p>	<p>25.10.2021</p> <p>(Symbolic Possession)</p>
3)	<p>Loan Account Number: 603807510298175</p> <p>1) Mansukhbhai Maganbhai Babariya, S/o. Maganbhai Babariya</p> <p>2) Chandulal M Babariya, S/o. Maganbhai Babariya</p> <p>3) Shilaben Mansukhbhai Babariya, W/o. Mansukhbhai Babariya</p> <p>4) Rajuben Chandubhai Babariya, W/o. Chandubhai Babariya</p> <p>Add. 1: Vidhyut Nagar, Opp. Circuit House, Morvi Morbi PPW, Opp. Circuit House, Morbi, Gujarat - 363642. Add. 2: Chamunda Krupa R S No. 163-1/P, Plot No. 31, Vidhyut Nagar Society, Opp. Circuit House, Near Mahendranagar Chowkid - 363642.</p>	<p>All that piece and parcels of property bearing house over land measured 11.66 Sq.Mt. of Plot No. 31 Situated at Mahendranagar, R. S. No. 163/1, Morbi. Boundaries: North- Lagu R.S. No. 162-2; East- Others House; So uth- Road; West- Plot No. 30.</p>	<p>Date: 09.08.2021</p> <p>Rs. 9,96,578.33/- (Rupees Nine Lakhs Ninety Six Thousand Five Hundred Seventy Eight and Paise Thirty Three Only)</p>	<p>27.10.2021</p> <p>(Symbolic Possession)</p>

Place: Rajkot

Date: 30.10.2021

Authorized Officer,

Fullerton India Home Finance Company Limited

SA/

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

અમિત શાહ સરદાર પટેલને પુષ્પાંજલી અર્પી એકતા પરેડમાં સહભાગી બનશે

ગાંધીનગર,તા.૩૦ ઉજવણીનો આરંભ કરાવ્યો છે. લોહપુરુષ સરદાર કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કેવડિયામાં આવતીકાલે ૩૧મી ઓક્ટોબરે આ વર્ષે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની એકતા પરેડ, બેન્ડ પ્લાટુનના શાનદાર ઉજવણી કરાશે. પર્ફર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની રાષ્ટ્રીય એકતાને વધુ સુદૃઢ કરવા અખંડ ભારતના શિલ્પીની પોલીસની મોટર સાયકલ રેલી જન્મજયંતીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસની પ્રદર્શન અને સાંક્રુતિક કાર્યક્રમોનું તમામ રાજ્યોની પોલીસની એકતા પરેડ:આંતરરાષ્ટ્રીય રમતોમાં મેડલ મેળવનાર ૨૩ પોલીસ અધિકારી ઉજવણીમાં ભાગ લેશે

ભવ્ય આયોજન કરાયું છે.



રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં કેવડિયા ખાતે

એકતા પરેડમાં ૬ પ્લાટૂન જોડાશે. જેમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસદળોના પ્રતિક સ્વરૂપે ૫૪ ફ્લેગ બેરર પીએસએફ, સીઆરપીએફ, આઈટીબીપી, સીઆરપીએફ અને ગુજરાત પોલીસની પ્લાટૂન ભાગ લેશે. વર્ષ ૨૦૧૮ પછી જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોમાં પદક મેળવ્યા છે એવા ૨૩ પોલીસ

અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ પરેડમાં ભાગ લેશે. બીએસએફ, સીઆરપીએફ અને ગુજરાત પોલીસના સંયુક્ત બેન્ડ પ્લાટૂનમાં ૭૬ સભ્યો ભાગ લેશે.

દેશના જુદા જુદા રાજ્યોમાંથી પોલીસની ચાર મોટર સાયકલ રેલી પણ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના સાનિધ્યમાં પહોંચી છે તેઓ પણ આ એકતા પરેડમાં સહભાગી થશે.



દિવાળીના તહેવારને લઈને લોકો દ્વારા વિવિધ લાઈટીંગની ખરીદી કરવામાં આવી રહી છે....

જુના વાડજની મહિલા સાથે ૨૭૦ ગ્રામ સોનાના દાગીના-લગડી લઈ કર્ણુ ચીટીંગ

અમદાવાદ,તા.૩૦ શહેરના જુના વાડજ ખાતે રહેતી મહિલાની રૂા.૧૨,૭૦,૦૦૦ના સોનાના દાગીના બનાવી આપવાનું કહી બે સગાભાઈ સહિત ત્રણ જણાંએ છેતરપીંડી કરી હતી તેમજ વસ્ત્રાલના યુવાનની ઈન્વેસ્ટ કરવાના બહાને રૂા.૧૫,૬૨,૭૫૨ની ગઈયાઓએ છેતરપીંડી કરી હતી.

બે સગાભાઈ સહિત ત્રિપુટી સામે ફરિયાદ; મણિનગરમાં શેડના રૂા.૩૧ લાખ લઈ કરી છેતરપીંડી

જણવા મળતી માહિતી મળી કુલ રૂા.૧૨,૭૦,૦૦૦નું અનુસાર શહેરના જુના વાડજ ખાતે રહેતી સ્તુતિબહેન શાહ નામની મહિલાએ ગત તા.૧૯ ઓગષ્ટના રોજ નવા વાડજના ગોકુલ મેવાવાલા ફલેટમાં રહેતા ભાઈ કમલેશ શર્મા અને નરેશભાઈ સોની (રહે. શિવમ્ બે પાર્ટમેન્ટ, નવા વાડજને ૨૦૧૬ના રોજ ગંગારામ પરનીરામ કેવલરામાણી (ઉ.વ.૬૭) અને બન્દી

ગંગારામ કેવલરામાણી, એલીસ બ્રિજ) એ ભેગા મળી લાલચંદ વાસવાણી (રહે. નિર્મલ સોસાયટી, મણીનગર) એ તેઓના મિત્ર પાસેથી તેઓની શેડની સ્કિમમાં શેડ નં-૧૫ના મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે મણિનગરના ગોપાલ ટાવર ખાતેની રેડીમેઈડ કપડાંની દુકાનમાં ગત તા.૧-૧૧-૨૦૧૬ના રોજ ગંગારામ કેવલરામાણી (ઉ.વ.૬૭) અને બન્દી

આણંદ નગરપાલિકાની ડમ્પિંગ સાઈટમાં

કચરાના નિકાલ માટે નવા સાધનોની ટેન્ડર પ્રક્રિયા ઝડપથી શરૂ કરવા હાઈકોર્ટનો હુકમ

અમદાવાદ, તા.૩૦ આણંદ નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ મહત્વનો હુકમ કર્યો છે. જેમાં વડોદરા સ્થિત રિજનલ મ્યુનિસિપલિટી કમિશનરને તાત્કાલિક આણંદ નગરપાલિકાને દૂષિત કચરાના નિકાલ માટે સાધનો ખરીદવા માટેની ટેકનિકલ એપ્રૂવલની કામગીરી વહેલી તકે કરવા તથા નગરપાલિકાના ટેન્ડર્સની પ્રક્રિયા શરૂ કરવા માટે આદેશ કર્યો છે.

આગામી તા.૩૧ ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે; ડમ્પિંગ સાઈટ અન્ય સ્થળે ખસેડવા અરજીમાં માંગ કરાઈ છે

આ અંગે કોર્ટે નોંધ્યું છે કે, રિન્યુએબલ અને નોન રિન્યુએબલ કચરાના નિકાલ માટે મશીનરીની આવશ્યકતા હોય છે. આણંદ નગરપાલિકાએ કોર્ટ સમક્ષ એ બાબતની પણ કબૂલાત કરી કે ભૂતકાળમાં ટ્રેમેલ મશીન લગાવીને ૯૦,૦૦૦ એમટી ધન કચરાનો નિકાલ કર્યો હતો. જે માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જો કે નાણાકીય ભંડોળના કારણે નગરપાલિકાને ન પરવડતા તે પ્રક્રિયા આગળ ચાલી શકી ન હતી. અરજદારના વકીલ રિન્યુએબલ અને નોન રિન્યુએબલ કચરાના નિકાલ માટે મશીનરીની આવશ્યકતા હોય છે. આણંદ નગરપાલિકાએ કોર્ટ સમક્ષ એ બાબતની પણ કબૂલાત કરી કે ભૂતકાળમાં ટ્રેમેલ મશીન લગાવીને ૯૦,૦૦૦ એમટી ધન કચરાનો નિકાલ કર્યો હતો. જે માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જો કે નાણાકીય ભંડોળના કારણે નગરપાલિકાને ન પરવડતા તે પ્રક્રિયા આગળ ચાલી શકી ન હતી.

કોર્ટે આગામી સુનાવણીમાં લેટેસ્ટ અપડેટ કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે કહ્યું છે, આ મામલે આગામી સુનાવણી ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે. વર્ષ ૨૦૧૬માં ગુજરાત હાઈકોર્ટમાં આણંદ નગરપાલિકા દ્વારા આણંદથી ડીડીને આવેલ લાંબા ગાળામાં ઉભી કરવામાં આવેલ ડમ્પીંગ સાઈટને લઈને ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજ કરવામાં આવી હતી. જેમાં આ ડમ્પિંગ સાઈટ અન્ય સ્થળે ખસેડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

રાજ્યમાં કોરોનાનાં કેસોમાં વધારો: નવા ૩૧ કેસ

અમદાવાદ, તા.૩૦ ગુજરાતમાં આજે કોરોનાનાં કેસોમાં વધારો નોંધાયો છે. નવા ૩૧ કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણથી સુરતમાં વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે. હાલમાં ૫ દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે. જ્યારે ૨૦૩ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં ૧૪ દર્દીઓને રજા આપવામાં આવી હતી.

સુરતમાં ૬, જામનગર-વડોદરામાં ૫-૫ અને અમદાવાદમાં ૨ કેસ નોંધાયા; સુરતમાં વધુ એક દર્દીનું મોત

જામનગર શહેર અને વડોદરા શહેરમાં ૫-૫ કેસ, વલસાડમાં ૪, સુરત પ્રાચ્ય અને શહેરમાં ૩-૩, અમદાવાદ શહેર, આણંદ, જુનાગઢ, કચ્છ અને રાજકોટ શહેરમાં ૨-૨ કેસ, જ્યારે નવસારીમાં ૧ કેસ નોંધાયો છે.

પેટ્રોલ પંપના માલિક પાસેથી તોલમાપ અધિકારી વાણવી લાંચ લેતા પકડાયા

અમદાવાદ, તા.૩૦ હિંમતનગરના સિનિયર નિરીક્ષક (કાનૂની માપવિજ્ઞાનતંત્ર) રૂા.૧૫ હજારની લાંચ લેતા એસીબીની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. જણવા મળતી માહિતી અનુસાર સાબરકાંઠાના જાગૃત નાગરિક પેટ્રોલ પંપ ધરાવે છે તેઓને દર વર્ષે તોલમાપ અધિકારી રૂબરૂ સ્ટેમ્પીંગ કરાવવું જરૂરી હોય છે તેઓએ હિંમતનગર મહેતાપુરાની કાનૂની માપ વિજ્ઞાન કચેરીના સિનિયર નિરીક્ષક હેમંતકુમાર વાણવીનો સંપર્ક કરતા તેઓએ તેમની પાસેથી સ્ટેમ્પિંગ કરી (ચકાસણી કરી સીલ મારવાની કામગીરી) કરવા માટે રૂા.૧૫ હજારની લાંચ માંગી હતી. પરંતુ નાગરિકે એટીકરશન બ્યુરોનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબી પીઆઈ વી.એન. ચૌધરીએ ફરિયાદીના પેટ્રોલ પંપ ઉપર છટકું ગોઠવી હેમંતકુમાર વાણવીને રૂા.૧૫ હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.

સ્ટોવેક ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ	
સ્ટો. ઓફીસ: એનઆઈટ્રીસી, લાંબા ચામ નજીક, પોસ્ટ મહેલ, અમદાવાદ-૩૮૨૪૦૫, ગુજરાત. ફોન: +૯૧ (૦) ૭૯ ૬૧૫૭૨૩૦૦, ફેક્સ: +૯૧ (૦) ૭૯ ૨૫૭૦૪૦૨૦, ઈમેલ: info@stovec.com, L45200GJ1973PLC0059790 ઈ-મેલ: secretarial@stovec.com, વેબસાઈટ: www.stovec.com	
નોટીસ	
આથી નોટીસ આપવામાં આવે છે કે કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મીટીંગ મંગળવારે, નવેમ્બર ૨૯, ૨૦૨૧ ના રોજ કંપનીની રજીસ્ટર્ડ ઓફીસ ખાતે વિડિયો કોન્ફરન્સ (વીસી) દ્વારા મીટીંગ મામનોની સાથે સાથે સપ્ટેમ્બર ૩૦, ૨૦૨૧ના રોજ પૂર્ણ થયેલ વિમાલિક અને નવ માલિક ગ્રાહીનાં કંપનીના અનન્યોટ્રીડ ફાઇનાન્સીયલ રીઝલ્ટ ને ધ્યાનમાં લેવા તથા મંજૂર કરવા બાબતે રાખે છે.	
રેગ્યુલેશન ૪૬(૨) અને ૪૭(૨) સેબી (લીસ્ટીંગ ઓબ્લીગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર ઈક્વિપમેન્ટ્સ) રેગ્યુલેશન ૨૦૧૫ અનુસાર આ બોર્ડ મીટીંગની નોટીસ કંપનીની વેબસાઈટ www.stovec.com પર અને સ્ટોક એક્સચેન્જની વેબસાઈટ www.bseindia.com પર ઉપલબ્ધ રહેશે.	
સ્ટોવેક ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ વતી, સંલગ્ન સીલ ગેંગર ધનવી સેક્રેટરી (મેનેજરશીપ નં: એઈસીસીએ ૭૮૩૫)	

GUJARAT RAFFIA INDUSTRIES LIMITED				
CIN : L17110GJ1984PLC007124				
Regd. Office : Plot No 455, Santej-Vadsar Road, Santej, Gandhinagar - 382721				
EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH SEPTEMBER, 2021 (Rs. in Lakhs)				
Sr. No	Particulars	Quarter ended 30/09/2021 Unaudited	Corresponding Quarter ended 30/09/2020 Unaudited	Previous Year ended 31/03/2021 Audited
1	Total income from Operations	1032.55	946.14	3879.35
2	Net Profit / (Loss) for the period (before tax, exceptional and/or Extraordinary item)	47.66	21.59	125.46
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items)	47.66	21.59	125.46
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and / or Extraordinary items)	40.16	18.09	118.98
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	40.16	18.09	118.98
6	Paid up Equity Share Capital	540.45	540.45	540.45
7	Reserve (excluding revaluation reserve)	---	---	1256.70
8	Securities Premium Account	---	---	---
9	Net Worth	1869.37	1721.67	1797.15
10	Paid up Debt Capital / Outstanding Debt	265.31	152.87	305.87
11	Outstanding Redeemable Preference Share	---	---	---
12	Debt Equity Ratio	0.49	0.28	0.57
13	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operation)	0.74	0.33	2.20
14	Capital Redemption Reserve	---	---	---
15	Debtenture Redemption Reserve	---	---	---
16	Debt Service Coverage Ratio	---	---	---
17	Interest Service Coverage Ration	---	---	---

Note: (1) The above is an extract of the detailed financial results for the Second Quarter ended 30th September, 2021 filed with the Stock Exchange pursuant to regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the same are available on the website of the Stock Exchange at www.bseindia.com and www.nseindia.com and also on the Company's web site at www.grillarp.com

For, Gujarat Raffia Industries Limited
sd/- Pradeep Bhutoria
Managing Director - DIN : 00284808

Place : Santej
Date : 30/10/2021

ન્યાયાલય જિલ્લા વિવાદ અધિકારી/અપર જિલ્લાધિકારી (વિ.વ.વ.રા.) જ્ઞાસી	
સંખ્યા- મેમો/વિ.વિ.અધિનિયમ-ધાતા-13(2021) તિનાંક- 23.10.2021	
1- પ્રથમી નિરીક્ષક થાના સીપરી બાજાર	
2- નિરીક્ષક, પુલ આઈ.પુ. જ્ઞાસી	
આ ન્યાયાલય ને નિર્માલિક પક્ષકારો ને વિરોધ વિવાદ અધિનિયમ-1954 કો ધાર-5 ને અનુસાર પરસ્પર વિવાદ રેવું તિનાંક 23.10.2021 કો રાખિયત હોતર આગિત વિવાદ કો નોટિસ પ્રસ્તુત કિયા હૈ-	
(વર પક્ષ) શ્રી શાહ સુનીલ કુમાર ધર્મેન્દ્ર ખાઈ પુર શ્રી શાહ ધર્મેન્દ્ર ખાઈ ભૂતલાલ નિ. મારુની સેવે લેન ડેરાસર કે સામને થાના માનસ જિલ્લા ગાંધીનગર ગુજરાત હાલ. નિ. વી-113 તિરુપતિ તુલસી બંલોસ માનસ જિલ્લા ગાંધીનગર તિન- 382845 વર (તલકશુદા)	
(વધુ પક્ષ) શિશુ પ્રજાપતિ પુત્રી શ્રી અલેક્ષા પ્રસાદ નિ. 17 અમરકાંઠા વિહાર કાલેસી શિવગુરો રોડ થાના સીપરી બાજાર જિલ્લા જ્ઞાસી વધુ (તલકશુદા)	
ઉક્ત નોટિસ કો છાયા પ્રતિ સંલગ્ન કર પ્રોપિય હૈ। વધુ પક્ષ ને સ્વયં કો તલકશુદા પૂર્વ આપકે થાના ક્ષેત્ર/જનપદ કો સ્થાઈ નિવાસી વલાયા હૈ। આપસે એક્ષા કો જાતી હૈ કિ આપ ઉક્ત ડેનો વિનુઓ કો જાંચ કર અપની આજ્ઞા એક માહ કે અન્દર હિસ ન્યાયાલય કો પ્રોપિય કરે સાથ હો પક્ષકાર કે પરિચાજનો કો મી હિસ આગિત વિવાદ કે સમ્મથ મેં હિસ આશય સે સુનિત કર દિયા ગયે, કિ યદિ ઉન્ને હિસ વિવાદ સે કોઈ આપિત હૈ તો વિધિક આયર્સ કે સાથ આપિત નોટિસ પ્રસ્તુત લેને કો વિધિ સે એક માહ કો અધિક કે અન્દર પ્રસ્તુત કર સક્તે હૈ। (રામ અશ્વયજી ચૌહાન), જિલ્લા વિવાદ અધિકારી/ અપર જિલ્લાધિકારી (વિ.વ.વ.રા.) જ્ઞાસી।	

K.Z. LEASING AND FINANCE LIMITED				
CIN : L65910GJ1986PLC00864				
Regd. Office : Deshna Chambers, B/h. Kadwa Patidar Wadi, Usmanpura, Ashram Road, Ahmedabad - 380014. Phone : (079) 27543200				
EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED ON 30TH SEPTEMBER, 2021 (Rs. in Lacs)				
Sr No.	Particulars	Quarter ended on 30/09/2021 (Unaudited)	Quarter ended on 30/09/2020 (Unaudited)	Half Year ended on 30/09/2021 (Unaudited)
1	Total Income from Operations	79.64	31.01	135.72
2	Net Profit / (Loss) for the period (before Tax, exceptional and / or extraordinary items)	48.19	1.44	48.02
3	Net Profit / (Loss) for the period before tax (after exceptional and / or extraordinary items)	48.19	1.44	48.02
4	Net Profit / (Loss) for the period after tax	48.19	1.44	48.02
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (loss) for the period (after tax) and other comprehensive Income (after tax)	148.92	119.57	215.25
6	Paid-up Equity Share Capital	304.12	304.12	304.12
7	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of Previous year)	---	---	---
8	Earnings per Share (of Rs.10/- each) (for continuing & discontinued operations) - Basic and Diluted	1.58	0.05	1.58
Notes: (1) The above is an extract of the detailed format of First quarter ended Unaudited Financial Results filed with the stock exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The Full format of the Unaudited Financial Results is available on the stock Exchange website - www.bseindia.com & on company's website - www.kzgroup.in (2) The above financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in the meeting held on 05/11/2020 (3) The company has adopted Indian Accounting Standard ("IND AS") notified by the Ministry of Corporate Affairs with effect from 1st April, 2019. Accordingly the Financial Result for the Quarter ended on 30th September, 2021 are in accordance with IND-AS and other accounting principles generally accepted in India. (4) Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules/AS Rules, whichever is applicable. Date : 30/10/2021 For, K.Z. Leasing and Finance Ltd. Place : Ahmedabad sd/- Pravin Kumar K. Patel (DIN - 00841628)				

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-વિરમગામ વચ્ચે નવી મેમુ સેવાનો પ્રારંભ

ટ્રેન સંખ્યા	આરંભ સ્ટેશન અને ગંતવ્ય	આરંભ તારીખ	સેવાનો દિવસ	ઉપડશે વાગે	આવશે (એજ દિવસે)
૦૬૪૫૯	અમદાવાદ-વિરમગામ	૦૧-૧૧-૨૦૨૧ (સોમવાર)	સાહદમાં ૬ દિવસ (સાલવારને બાદ કરતા)	૧૮.૩૦ વાગે	૨૦.૧૦ વાગે (એજ દિવસે)
૦૬૪૬૦	વિરમગામ-અમદાવાદ	૦૨-૧૧-૨૦૨૧ (મંગળવાર)	સાહદમાં ૬ દિવસ (રવિવારને બાદ કરતા)	૦૭.૫૦ વાગે	૦૮.૫૫ વાગે (એજ દિવસે)
રોકાણ: બ્રહે તરફ સાબરમતી, ચાંદલોડિયા, આંબલી રોડ, સાણંદ, છારોડી અને જખવાડા સ્ટેશન					
રોકાણના સમયની વિસ્તૃત માહિતી માટે વેબસાઈટ www.enquiry.indianrail.gov.in જુઓ					
● મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે મેમુમાં ભરવા, પ્રવાસ દરમિયાન અને સ્ટેશન ખાતે કોવિડ-૧૯ સંલગ્નિત તમામ નિયમો અને એસઓપીનું પાલન કરવું પડશે ● કૃપા કરી તમામ આરક્ષિત ટિકીટો માટે ઓળખપત્ર સાથે રાખો					
		 પશ્ચિમ રેલવે www.wr.indianrailways.gov.in અમને લાઇડ કરો facebook.com/WesternRly અમને અનુસરો twitter.com/WesternRly		 75 આઝાદીકા અમૃત મહોત્સવ	

Notes : 1. The above Un-Audited Standalone & Consolidated Financial Statements of the Company for the quarter & half year ended 30th September, 2021 have been reviewed and recommended by the Audit Committee and are approved by the Board of Directors at their respective meeting held on 29th October, 2021.

2. The Company has adopted, Indian Accounting Standards prescribed under Section 133 of the Companies Act, 2013 ("Ind-AS") from 1st April, 2017 and accordingly these financial results and all the periods presented have been prepared in accordance with the recognition and measurement principles laid down in Ind-AS 34 "Interim Financial Reporting" read with relevant rules issued thereunder and the other accounting principles generally accepted in India and discloses the information required to be disclosed in terms of Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015 (as amended).

3. The Statutory Auditors of the Company have carried out a Limited Review of the above Standalone & Consolidated Financial Statements of the Company for the quarter & half year ended 30th September, 2021 in terms of Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015 and have issued an unmodified Limited Review Report.

4. The figures for the corresponding previous periods have been regrouped/rearranged wherever necessary, to make them comparable.

5. The above is an extract of the detailed format of Un-Audited Standalone & Consolidated Financial Results for the quarter ended 30th September, 2021 filed with the Stock Exchanges (BSE & NSE) under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The detailed statement of Financial Results alongwith Standalone & Consolidated Independent Limited Review Report is available on the website of BSE Limited (www.bseindia.com), National Stock Exchange of India Limited (www.nseindia.com) and also on the website of the Company (www.jindaltaxiles.com).

For and On Behalf of the Board
For JINDAL WORLDWIDE LIMITED
sd/-
(MR. AMIT AGRAWAL)
Managing Director
DIN : 00169061

Date : 30th October, 2021
Place : Ahmedabad





OFFICE OF ADDITIONAL CHIEF ENGINEER
PHED, JAIPUR REGION-I, JAIPUR

Jyoti Nagar, Sahakar Marg, Jaipur-302005

Phone: 0141-2740170(o) e-mail: ace1.jpr.phed@rajasthan.gov.in.

No.: F /ACE/PHED/Ar.Sikar/NIT-192/JJM/2021-22/15528-549 Date: 08.02.2022

(e-NIT No. 192/2021-22)

On behalf of the Governor of Rajasthan NIT No. 192/2021-22 online tender is hereby invited from eligible bidders for "Work of Augmentation of RWSS to provide FHTC including one year Defect Liability period of SVS/MVS and 3 Year O&M for MVS under JJM in the jurisdiction of PHED Sub Division Dantaramgarh, District-Sikar on SPR basis" as per criteria mentioned in the detailed NIT/tender document available on websites:
<https://eproc.rajasthan.gov.in> &
<http://sppp.rajasthan.gov.in> Tenders are to be submitted online in electronic format on website <https://eproc.rajasthan.gov.in> as per prescribed schedule.

NIT No.	Particular	Estt. Cost (Rs. in Lacs)	UBN No.
190/2021-22	Sub Division Dantaramgarh	450.23	PHE2122WSOB13459

SAVE WATER-SAVE LIFE

Sd/-
(Arun Srivastava)
Addl. Chief Engineer
PHED, Jaipur Region-I, Jaipur

DIPR/C/1644/2022



National Health Mission

Karnataka State Health & Family Welfare Society

Arogya Soudha, Magadi Road, Bengaluru -560 023,

e-mail: ddehospital-hfws@karnataka.gov.in Ph. No.: 080-23295625

No. e-H/ECRP Phase II proposal/22/2021-22

Date: 11.02.2022

TENDER NOTIFICATION

Nation wide tender is invited under e-Tendering system from the manufacturers, as well as from the Authorized Dealers under KTPP Act 1999 and Rules 2000, for the procurement of ICT (Active component and passive components) equipment for the implementation of e-hospital programme under National Health Mission, Arogya Soudha, Magadi Road, Bengaluru. The tenderers who have registered under e-Procurement department may participate through e-tendering system.

Details regarding specification, EMD, Terms and Conditions and other information is available in the Tender Document, which can be downloaded and uploaded from the website <https://eproc.karnataka.gov.in> from the below mentioned date:

(1) Tender Notification No.: NRHM/2021-22/IND277 Phase 2 ECRP. Tender downloading date: 11.02.2022. Last date for uploading Tender: 03.03.2022 upto 5:30 PM.

Further information if any may be obtained from this office.

Sd/- Deputy Director (e-Health)

DIPR/DDU/BCPL/3347/2021-22

HAVE SYMPTOMS OF COVID-19? CALL APATHMITRA ON 14419

 Wear Mask  Follow Physical Distancing  Maintain Hand Hygiene



DELHI JAL BOARD: GOVT. OF NCT OF DELHI

OFFICE OF THE EXECUTIVE ENGINEER (CIVIL) PLANT SDW S/E

SRINIWASPURI: NEW DELHI: 110065



PRESS N.I.T. No. 58 (2021-22)

S. No.	Name of Works	Estimated Cost (Rs.)	Date of release of tender in E-procurement solution	Last date/time of receipt of tender through e-procurement solution
1	Diversion of flow existing rising main emanating from Ghonda-I SPS into inlet chamber Ghonda-II SPS. 2022_DJB_215604_1	3700459/-	11.02.2022	28.02.2022 up to 3.00 P.M.

* Further details in this regard can be seen at <https://govtprocurement.delhi.gov.in/nicgep/app>

ISSUED BY P.R.O. (WATER) Sd/-
Advt. No. J.S.V. 1119/2021-22 EX. ENGINEER (CIVIL) PLANT SDW S/E

"STOP CORONA; Wear Mask, Follow Physical Distancing, Maintain Hand Hygiene"



OFFICE OF THE EX. ENGINEER (CIVIL) PLANT WW C/o ACE(P)-2

DELHI JAL BOARD : GOVT. OF N.C.T. DELHI

CHANDRAWAL : WATER WORKS NO. II CIVIL LINES : DELHI-54

Office Telephone No. :- 23815504 E-mail:- eecplantww.djb@gmail.com



SHORT PRESS NIT No. 43/ (2021-22)

S. No	Name of Work	Estimated Cost	Earnest Money (Fresh)	Tender Processing Fee (Fresh)	Publication date of tender in e-procurement solution	Last date & time for receipt of tender from e-procurement solution
1.	Covering of 1200 mm dia RCC Well for stalling submersible pump opposite Akshardham Temple. (Tender ID No. 2022_DJB_216654_1)	2789448/-	55800/-	500/-	11.02.2022	18.02.2022

The more detail required above can be seen on website www.delhi.govtprocurement.com.

ISSUED BY P.R.O. (WATER) Sd/-
Advt. No. J.S.V. 1123/2021-22 EX. ENGINEER (C) PLANT, WW C/o ACE(P)-2

"STOP CORONA; WEAR MASK, FOLLOW PHYSICAL DISTANCING, MAINTAIN HAND HYGIENE"



Regional Office: Netaji Marg, Nr. Mithakhali Six Roads, Ellisbridge, Ahmedabad-6. Phone: +91-79-26421671-75

SYMBOLIC POSSESSION NOTICE

NOTICE is hereby given under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, the Authorized Officer issued demand notice to the borrower(s) on the date mentioned against the account stated hereinafter calling upon them to repay the amount within 60 days from the date of receipt of said notice. The borrower(s) having failed to repay the amount, notice is hereby given to the public in general and in particular the borrower(s) that the undersigned has taken the symbolic possession of the property described herein below under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on the date mentioned against the account. The borrower(s) in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealing with the property will be subject to the charge of the Bank for the amounts, interest, costs and charges thereon. The borrowers'/mortgagors' attention is invited to the provisions of sub-section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Name of borrower(s), Loan Account No	Description of the property mortgaged (Secured Asset)	Date of Demand Notice	Date of Symbolic Possession Notice	O/s Amount as on date of Demand Notice
Mr. Pintubhai Nanabhai Dantani Mrs. Minaben Pintubhai Dantani 306/3324	All that piece and parcel of the property situated at Survey No. 97 Paiki, 98/5/6/7 Paiki 1, Plot No. 25 Paiki Middle Side, Near Bapunagar, Near Old Age Homes, Dahod Road, At Vavdi Bujarg, Ta. Godhra, Dist. Panchmahal, Gujarat-389001 and bounded by: North: Plot No. 26, East: Remaining land of said Plot No. 25 Paiki, West: Remaining land of said Plot No. 25 Paiki, South: 6.00 Meter Road	04.10.2021	07.02.2022	Rs.10,53,539.26
Mr. Rajeshbhai Govindbhai Dantani Mrs. Rekhaben Rajeshbhai Dantani 306/3486	All that piece and parcel of the property situated at Survey No. 98/4 Paiki 10, Plot No. 10, Paiki South Side, Near Bapunagar, Behind Moonlight Petrol Pump, Dahod Road, At Vavdi, Bujarg, Ta. Godhra, Dist. Panchmahal, Gujarat-389001 and bounded by: North: Remaining land of said Plot No. 10 paiki, East: Survey No. 98/5 Paiki Plot No. 65, West: 6.00 Meter Road, South: Plot No. 11	04.10.2021	07.02.2022	Rs.12,24,520.62
Mr. Kishanbhai Keshavlal Dantani Mrs. Rekhaben Kishanbhai Dantani 306/3326	All that piece and parcel of the immovable property situated at Survey No. 97 Paiki, 98/5/6/7 Paiki 1, Plot No. 25 Paiki East Side, Near Bapunagar, Near Old Age Home, Dahod Road, At Vavdi Bujarg, Ta. Godhra, Dist. Panchmahal, Gujarat-389001 and bounded by: North: Plot No. 26, East: Plot No. 24, West: Remaining land of said Plot No. 25 Paiki, South: 6.00 Meter Road	04.10.2021	07.02.2022	Rs.10,53,611.26

Place: Godhra
Date: 12/02/2022

Authorised Officer
Bandhan Bank Limited

JINDAL WORLDWIDE LIMITED

CIN: L17110GJ1986PLC008942

Regd. & Corp. Office: "Jindal House", Opp. Dmart, I.O.C Petrol Pump Lane, Shivrangani Shyamal 132 Ft Ring Road, Satellite, Ahmedabad – 380015

Phone: 079-71001500 • E-Mail Id: csjindal@jindaltextiles.com • Website : www.jindaltextiles.com

STATEMENT OF STANDALONE & CONSOLIDATED UN-AUDITED FINANCIAL RESULTS

(AS PER SCHEDULE III OF COMPANIES ACT, 2013 AND IND-AS)

* For the Quarter & Period Ended 31st December,2021 *

{Pursuant to Regulation 47(1)(b) of SEBI (LODR) Regulations, 2015}

(Rs. in Lakhs except EPS)

Sr. No.	Particulars	Quarter Ended			9 Months Ended		Year Ended
		3 months ended of C.Y.	Preceding 3 months ended	Corr. 3 months ended of P.Y.	9 months ended of C.Y.	9 months ended of P.Y.	Previous Financial Year ended
		31st Dec., 2021 (Un-Audited)	30th Sep, 2021 (Un-Audited)	31st Dec., 2020 (Un-Audited)	31st Dec., 2021 (Un-Audited)	31st Dec., 2020 (Un-Audited)	31st March, 2021 (Un-Audited)
STANDALONE							
1.	Total income from operations (net)	69192.90	61504.63	62829.51	182618.90	106255.98	170969.63
2.	Net Profit/(Loss) for the period (before Tax , Exceptional and/or Extraordinary items)	4147.87	3300.29	2965.26	9789.87	3527.11	6200.28
3.	Net Profit/ (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items).	4147.87	3300.29	2965.26	9789.87	3527.11	6200.28
4.	Net Profit/(Loss) for the period after tax (after exceptional and/or Extraordinary items)	3117.33	2470.76	2221.32	7350.74	2642.30	4409.83
5.	Total Comprehensive income for the period after share of profit after associates and minority interest [Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	3117.33	2470.76	2221.32	7350.74	2642.30	4409.83
6.	Equity Share Capital	2005.20	2005.20	2005.20	2005.20	2005.20	2005.20
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet as at Previous Financial Year ended 31st March 2021.	NA	NA	NA	NA	NA	39977.20
8.	Earnings per share (of Rs.1/- each) (for continuing and discontinued operations) : 1. Basic	1.55	1.23	1.11	3.67	1.32	2.20
	2. Diluted	1.55	1.23	1.11	3.67	1.32	2.20
CONSOLIDATED							
1.	Total income from operations (net)	67571.51	63050.69	58954.97	183064.74	105776.45	169961.52
2.	Net Profit/(Loss) for the period (before Tax , Exceptional and/or Extraordinary items)	4116.32	3315.49	3290.78	9949.07	3701.53	6241.09
3.	Net Profit/ (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items).	4116.32	3315.49	3290.78	9949.07	3701.53	6241.09
4.	Net Profit/(Loss) for the period after tax (after exceptional and/or Extraordinary items)	3076.91	2500.44	2521.44	7466.67	2791.32	4420.48
5.	Total Comprehensive income for the period after share of profit after associates and minority interest [Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	3077.22	2500.57	2521.48	7467.33	2791.79	4420.82
6.	Equity Share Capital	2005.20	2005.20	2005.20	2005.20	2005.20	2005.20
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet as at Previous Financial Year ended 31st March 2021.	NA	NA	NA	NA	NA	40038.94
8.	Earnings per share (of Rs.1/- each) (for continuing and discontinued operations) : 1. Basic	1.53	1.25	1.26	3.72	1.39	2.20
	2. Diluted	1.53	1.25	1.26	3.72	1.39	2.20

Notes :

1. The above Un-Audited Standalone & Consolidated Financial Results of the Company for the quarter & period ended on 31st December, 2021 have been reviewed and recommended by the Audit Committee and are approved by the Board of Directors at their respective meeting held on 10th February, 2022.

2. The Company has adopted, Indian Accounting Standards prescribed under Section 133 of the Companies Act,2013 ('Ind-AS') from 1st April, 2017 and accordingly these financial results and all the periods presented have been prepared in accordance with the recognition and measurement principles laid down in IND-AS 34 "Interim Financial Reporting" read with relevant rules issued thereunder and the other accounting principles generally accepted in India and discloses the information required to be disclosed in terms of Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015 (as amended).

3. The Statutory Auditors of the Company have carried out a Limited Review of the above Standalone & Consolidated Financial Results of the Company for the quarter & period ended on 31st December, 2021 in terms of Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015 and have issued an unmodified Limited Review Report."

4. The figures for the corresponding previous periods have been regrouped/rearranged wherever necessary, to make them comparable.

5. The above is an extract of the detailed format of Un-Audited Standalone & Consolidated Financial Results for the quarter & period ended on 31st December, 2021 filed with the Stock Exchanges (BSE & NSE) under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015 .The detailed statement of Financial Results alongwith Standalone & Consolidated Independent Limited Review Report is available on the website of BSE Limited (www.bseindia.com), National Stock Exchange of India Limited (www.nseindia.com) and also on the website of the Company (www.jindaltextiles.com).

For and On Behalf of the Board
For JINDAL WORLDWIDE LIMITED

Sd/-(MR. AMIT AGRAWAL)
Managing Director
DIN : 00169061

Date : 11th February, 2022
Place : Ahmedabad



MAKE NEW TRACKS

PULSE 200

PERFORMED BY TRAINED PROFESSIONAL. DO NOT ATTEMPT.

4V FOUR VALVE

STATEMENT OF STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED DECEMBER 31, 2021

(₹ in Crore)

S.No	PARTICULARS	STANDALONE					CONSOLIDATED				
		QUARTER ENDED		NINE MONTHS ENDED		YEAR ENDED	QUARTER ENDED		NINE MONTHS ENDED		YEAR ENDED
		DECEMBER 31, 2021 UNAUDITED	DECEMBER 31, 2020 UNAUDITED	DECEMBER 31, 2021 UNAUDITED	DECEMBER 31, 2020 UNAUDITED	MARCH 31, 2021 AUDITED	DECEMBER 31, 2021 UNAUDITED	DECEMBER 31, 2020 UNAUDITED	DECEMBER 31, 2021 UNAUDITED	DECEMBER 31, 2020 UNAUDITED	MARCH 31, 2021 AUDITED
1	Total income	8,004.90	9,978.45	22,240.89	22,607.12	31,380.47	8,133.30	10,032.61	22,478.30	22,759.08	31,517.09
2	Net Profit for the period before tax (before Exceptional items)	910.69	1,441.82	2,447.92	2,771.26	3,900.38	935.98	1,363.92	2,272.38	2,702.78	3,849.32
3	Net Profit for the period before tax (after Exceptional items)	910.69	1,441.82	2,447.92	2,771.26	3,900.38	935.98	1,363.92	2,272.38	2,702.78	3,849.32
4	Net Profit for the period after tax (after Exceptional items)	686.13	1,084.47	1,845.97	2,099.23	2,964.20	704.24	1,029.17	1,708.49	2,050.77	2,936.05
5	Total Comprehensive Income for the period (Comprising Profit for the period (after tax) and other Comprehensive Income (after tax))	680.61	1,076.13	1,829.39	2,074.21	2,943.14	687.41	1,022.39	1,681.90	2,024.40	2,910.18
6	Equity Share Capital (face value Rs. 2/- per share)	39.96	39.95	39.96	39.95	39.96	39.96	39.95	39.96	39.95	39.96
7	Reserves (excluding Revaluation Reserve)					15,158.47					15,376.46
8	Earnings per share on net profit after tax - face value Rs. 2/- each (In Rupees) a) Basic b) Diluted	34.34 34.33	54.29 54.29	92.39 92.37	105.09 105.09	148.39 148.37	35.23 35.21	51.02 51.02	85.37 85.34	101.97 101.96	146.07 146.04

Notes:-

1 The above is an extract of the detailed format of Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results is available on the Company's website www.heromotocorp.com and also on stock exchange websites, www.bseindia.com and www.nseindia.com

2 Based on the guiding principles given in Ind AS-108 on 'Operating Segments', the Company's business activity fall within a single operating segment, namely automotive segment. Accordingly, the disclosure requirements of Ind AS 108 are not applicable.

3 The situation of Covid-19 pandemic is continuously evolving. The impact assessed may be different from the estimates made as at the date of approval of these financial results and management will continue to monitor any material changes arising due to the impact of this pandemic on financial and operational performance of the Company and take necessary measures to address the situation.

4 On February 10, 2022, the Board of Directors had considered and approved interim dividend @3000% i.e. Rs. 60 per equity share (face value of Rs. 2 per equity share) for the financial year 2021-22.

5 The above results for the quarter and nine months ended December 31, 2021 have been reviewed and recommended by the Audit Committee and approved by Board of Directors in their respective meetings held on February 10, 2022

For and on behalf of Board of Directors
DR. PAWAN MUNJAL
Chairman & CEO
DIN: 00004223

New Delhi,
Date: February 10, 2022

Hero MotoCorp Ltd. - Regd. Office: The Grand Plaza, Plot No.2, Nelson Mandela Road, Vasant Kunj- Phase-II, New Delhi - 110070. | CIN NO. L35911DL1984PLC017354 • Visit www.heromotocorp.com



Ahmedabad

Ahmedabad

ઇન્ડિયન બેંક

INDIAN BANK

ALLAHABAD

ગાંધીનગર શાખા : ૧૯૫-૧૯૬, કિચ્છીકર થોપીંગ સેન્ટર, સેક્ટર-૨૧, ગાંધીનગર, ગુજરાત-૩૮૨૦૨૧. ફોન : ૦૭૬-૨૩૨૨૨૦૮૦ મો.: ૮૮૭૯૨૪૩૯૦૯, ઈ-મેલ : g531@indianbank.co.in

કબજા નોટીસ
(સ્થાવર મિલકત માટે)

આમી ઇન્ડિયન બેંકના અધિકૃત અધિકારીએ સિક્યોરિટાઇઝેશન એન્ડ રિન્સડ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ૨૦૦૨ તથા સિક્યોરિટી ઇન્સ્ટ્રુમેન્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો-૨૦૦૨ના (નિયમ ૩ સાથે વંચાતી) કલમ ૧૩(૧૨) હેઠળ મળેલી સત્તાની રૂએ નીચે સહી કરનાર અધિકારીએ ડિમાન્ડ નોટીસ બારી કરેલ હતી કે જેમાં દેવાદારને નોટીસમાં જણાવેલ બાકી રકમ સદર નોટીસ પ્રાપ્ત થયાની તારીખથી ૬૦ દિવસમાં ચુકવવા જણાવવામાં આવ્યું હતું. દેવાદાર / ગીરવેદાર / જમીનદાર આ રકમ ચુકવવામાં નિષ્ફળ ગયેલ હોવાથી દેવાદારો / ગીરવેદારો / જમીનદારો તેમજ સામાન્ય રીતે બહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે નીચે સહી કરનારે નીચે દર્શાવેલ મિલકતો , સદર નિયમોના નિયમ ૮ સાથે વંચાતી સદર ધારાની કલમ ૧૩(૪) હેઠળ તેમને/તેણીને મળેલ સત્તાઓ મુજબ મિલકતોને કબજો લઇ લીધેલ છે. આથી વિશેષપણે દેવાદાર / ગીરવેદાર / જમીનદાર તથા સામાન્ય જનતાને આ મિલકત અંગે કોઇપણ વ્યવહાર નહીં કરવા ચેતવણી આપવામાં આવે છે અને આ મિલકત અંગેનો કોઇપણ વ્યવહાર ઇન્ડિયન બેંક નીચે જણાવેલ બાકી રકમ અને વ્યાજનાદના વ્યાજ સાથેની રકમના બોજાને આધિન રહેશે. સદર કાયદાની કલમ ૧૩ની પેરા કલમ ૮ની બેગવાજ પ્રત્યે દેવાદારોનું મુકરર મિલકત છોડાવવા માટે બળવાણ સમય બાબતે ધ્યાન દોરવામાં આવે છે.

ક્રમ નં.	દેવાદાર/જમીનદાર અને ગીરવેદારના નામ	ડીમાન્ડ નોટીસની તારીખ/ રકમ	કબજા તારીખ / પ્રકાર	સ્થાવર મિલકતોનું વર્ણન
૧.	શ્રી જસપાલસિંહ કુબેરસિંહ સોલંકી (દેવાદાર અને ગીરવેદાર), શ્રી કુબેરસિંહ છગનસિંહ સોલંકી (દેવાદાર અને ગીરવેદાર) અને શ્રી વિજયસિંહ કાલુસિંહ સોલંકી (જમીનદાર)	૨૯.૦૭.૨૦૨૧ રૂા. ૧૩,૨૬,૮૯૦.૦૦ ૨૮.૦૭.૨૦૨૧ મુજબ + તેના પરનું ભવિષ્યનું વ્યાજ અને ખર્ચ	૦૯.૦૨.૨૦૨૨ સાંકેતિક કબજો	શ્રી જસપાલસિંહ કુબેરસિંહ સોલંકી અને શ્રી કુબેરસિંહ છગનસિંહ સોલંકીના નામે ગામ પેથાપુર, ગાંધીનગરમાં સિટી સર્વે નં. ૧૪૭૨ (જૂનો સિટી સર્વે નં. ૧૪૭૨ અને ૧૪૭૩) ખાતે ગુરૂકુપા એપાર્ટમેન્ટ, પેથાપુર, તાલુકા/જિલ્લા ગાંધીનગર, ગુજરાત ખાતે જમીનમાં પ્રમાણસર ભવિષ્યનું માલિકી અધિકારો અને ૯૧.૮૬ ચો.મી. જિલ્લ અપ એરિયા તરીકેના ફ્લેટ નં. ૪૦૧ ખાતે આવેલ રહેણાંક ફ્લેટના તમામ પીસ અને પાર્સલ. ચતુ:સીમા : પૂર્વ : રોડ, પશ્ચિમ : ફ્લેટ નં. ૪૦૨ અને ૪૦૩, ઉત્તર : માર્ગિન, દક્ષિણ: માર્ગિન
૨.	શ્રી પુષ્કરસિંહ નીરભેસિંહ સક્તાવત (દેવાદાર અને ગીરવેદાર) અને શ્રી કેસરસિંહ શિવસિંહ ચોધાણ (જમીનદાર)	૧૩.૦૪.૨૦૨૧ રૂા. ૧૦,૭૬,૩૭૦.૦૦ ૧૩.૦૪.૨૦૨૧ મુજબ + તેના પરનું ભવિષ્યનું વ્યાજ અને ખર્ચ	૦૯.૦૨.૨૦૨૨ સાંકેતિક કબજો	શ્રી પુષ્કરસિંહ નીરભેસિંહ સક્તાવતના નામે ગાંધીનગરના જિલ્લા અને ઉપ જિલ્લામાં સેક્ટર ૩૦, ગાંધીનગર ખાતે બાગુનિપાર્ક સોસાયટીમાં તેની પર ઘણેલા બાંધકામ સહિત ૧૩૧.૮૭૫ ચો.મી.માપના પ્લોટ નં. ૭૫૬/૨ ખાતે આવેલ રહેણાંક મિલકતના તમામ પીસ અને પાર્સલ. ચતુ:સીમા : પૂર્વ : ૭૬૦/૧ અને ૨, પશ્ચિમ : પ્લોટ નં. ૭૫૦/૧ અને ૨, ઉત્તર : પ્લોટ નં. ૭૪૮/૧ અને ૨, દક્ષિણ : પ્લોટ નં. ૭૫૬/૧ અને ૨
૩.	શ્રીમતી કી સેનથીલ વેલ (દેવાદાર અને ગીરવેદાર)	૦૯.૦૪.૨૦૨૧ રૂા. ૨,૫૭,૩૬૫.૦૦ ૦૯.૦૪.૨૦૨૧ મુજબ + તેના પરનું ભવિષ્યનું વ્યાજ અને ખર્ચ	૦૯.૦૨.૨૦૨૨ સાંકેતિક કબજો	શ્રીમતી સેનથીલ વેલના નામે મોજે પેથાપુર, તાલુકા ગાંધીનગર ખાતે નગર પાલિકા નં. ૪૮૯૦, જૂનો પંચાયત મિલકત નં. ૩૪૫૮/૧ અને ૩૪૫૮/૨, સિટી સર્વે નં. ૨૮૩૦ અને ૨૮૩૧ ધરાયતી તેની પર ૭૨૦ ચો.ફીટ જિલ્લ અપ એરિયાના બંધાવેલ મકાન સહિત ૮૭૦ ચો.ફીટ માપની રહેણાંક મિલકતના તમામ પીસ અને પાર્સલ. ચતુ:સીમા : પૂર્વ : રોડ, પશ્ચિમ : ઠાકોરવાસ, ઉત્તર : પ્રવિણસિંહ વાઘેલાનું મકાન, દક્ષિણ: ડિમ્પતસિંહ નેનસિંહ વાઘેલાનું મકાન

તારીખ : ૦૯.૦૨.૨૦૨૨, સ્થળ : ગાંધીનગર

અધિકૃત અધિકારી, ઇન્ડિયન બેંક

MAZDA LIMITED		EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 31 ST DECEMBER, 2021				
Regd. Office : C/1-39/13/16 GIDC Naroda, Ahmedabad - 382 330 CIN : L29120GJ1990PLC014293		(₹ in Lacs except EPS)				
Sr. No.	Particulars	Unaudited Quarter Ended		Unaudited Period Ended	Audited Year ended	
		31/12/2021	30/09/2021	31/12/2020	31/12/2020	31/03/2021
1	Total Income from operations	4307.74	4345.79	4685.34	11278.19	11216.24
2	Net Profit / (loss) from ordinary activities before tax, exceptional or extra-ordinary items	651.69	682.20	671.39	1753.85	1803.13
3	Net Profit / (loss) from ordinary activities after tax	482.39	514.98	499.71	1339.30	1355.99
4	Net Profit / (loss) for the period after tax (after extraordinary items)	482.39	514.98	499.71	1339.30	1355.99
5	Total Comprehensive Income for the period [comprising profit/ (loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	488.52	537.05	498.53	1373.42	1349.39
6	Paid-up equity share capital (Face Value of ₹ 10 per share)	400.50	400.50	400.50	400.50	400.50
7	Other Equity					14342.32
8	Basic and Diluted Earnings per share of ₹ 10/- each	12.04	12.86	12.48	33.44	33.86
NOTE: The above is an extract of the detailed format of Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. The full format of Unaudited Financial Results for the quarter ended 31/12/2021 are available on the Stock Exchanges website i.e. www.bseindia.com and www.nseindia.com as well as on the Company's Website i.e. www.mazdalimited.com.						
PLACE : AHMEDABAD				FOR & ON BEHALF OF THE BOARD		
DATE : 11/02/2022				PERCY AVARI WHOLE-TIME DIRECTOR		

JINDAL WORLDWIDE LIMITED							
CIN: L17110GJ1986PLC008942							
Regd. & Corp. Office: "Jindal House", Opp. Dmart, I.O.C Petrol Pump Lane, Shivranjani Shyamal 132 Ft Ring Road, Satellite, Ahmedabad – 380015							
Phone: 079-71001500 • E-Mail Id: csjindal@jindaltxtiles.com • Website : www.jindaltxtiles.com							
STATEMENT OF STANDALONE & CONSOLIDATED UN-AUDITED FINANCIAL RESULTS							
(AS PER SCHEDULE III OF COMPANIES ACT, 2013 AND IND-AS)							
* For the Quarter & Period Ended 31st December, 2021 *							
{Pursuant to Regulation 47(1)(b) of SEBI (LODR) Regulations, 2015}							
(Rs. in Lakhs except EPS)							
Sr. No.	Particulars	Quarter Ended			9 Months Ended		Year Ended
		3 months ended of C.Y.	Preceeding 3 months ended	Corr. 3 months ended in P.Y.	9 months ended of C.Y.	9 months ended of P.Y.	Previous Financial Year ended
		31st Dec., 2021 (Un-Audited)	30th Sep, 2021 (Un-Audited)	31st Dec., 2020 (Un-Audited)	31st Dec., 2021 (Un-Audited)	31st Dec., 2020 (Un-Audited)	31st March, 2021 (Un-Audited)
STANDALONE							
1.	Total income from operations (net)	69192.90	61504.63	62829.51	182618.90	106255.98	170969.63
2.	Net Profit/(Loss) for the period (before Tax , Exceptional and/or Extraordinary items)	4147.87	3300.29	2965.26	9789.87	3527.11	6200.28
3.	Net Profit/ (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items).	4147.87	3300.29	2965.26	9789.87	3527.11	6200.28
4.	Net Profit/(Loss) for the period after tax (after exceptional and/or Extraordinary items)	3117.33	2470.76	2221.32	7350.74	2642.30	4409.83
5.	Total Comprehensive income for the period after share of profit after associates and minority interest [Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	3117.33	2470.76	2221.32	7350.74	2642.30	4409.83
6.	Equity Share Capital	2005.20	2005.20	2005.20	2005.20	2005.20	2005.20
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet as at Previous Financial Year ended 31st March 2021.	NA	NA	NA	NA	NA	39977.20
8.	Earnings per share (of Rs.1/- each) (for continuing and discontinued operations) : 1. Basic	1.55	1.23	1.11	3.67	1.32	2.20
	2. Diluted	1.55	1.23	1.11	3.67	1.32	2.20
CONSOLIDATED							
1.	Total income from operations (net)	67571.51	63050.69	58954.97	183064.74	105776.45	169961.52
2.	Net Profit/(Loss) for the period (before Tax , Exceptional and/or Extraordinary items)	4116.32	3315.49	3290.78	9949.07	3701.53	6241.09
3.	Net Profit/ (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items).	4116.32	3315.49	3290.78	9949.07	3701.53	6241.09
4.	Net Profit/(Loss) for the period after tax (after exceptional and/or Extraordinary items)	3076.91	2500.44	2521.44	7466.67	2791.32	4420.48
5.	Total Comprehensive income for the period after share of profit after associates and minority interest [Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	3077.22	2500.57	2521.48	7467.33	2791.79	4420.82
6.	Equity Share Capital	2005.20	2005.20	2005.20	2005.20	2005.20	2005.20
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet as at Previous Financial Year ended 31st March 2021.	NA	NA	NA	NA	NA	40038.94
8.	Earnings per share (of Rs.1/- each) (for continuing and discontinued operations) : 1. Basic	1.53	1.25	1.26	3.72	1.39	2.20
	2. Diluted	1.53	1.25	1.26	3.72	1.39	2.20

Notes : 1. The above Un-Audited Standalone & Consolidated Financial Results of the Company for the quarter & period ended on 31st December, 2021 have been reviewed and recommended by the Audit Committee and are approved by the Board of Directors at their respective meeting held on 10th February, 2022.

2. The Company has adopted, Indian Accounting Standards prescribed under Section 133 of the Companies Act, 2013 (Ind-AS) from 1st April, 2017 and accordingly these financial results and all the periods presented have been prepared in accordance with the recognition and measurement principles laid down in IND-AS 34 "Interim Financial Reporting" read with relevant rules issued thereunder and the other accounting principles generally accepted in India and discloses the information required to be disclosed in terms of Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015 (as amended).

3. The Statutory Auditors of the Company have carried out a Limited Review of the above Standalone & Consolidated Financial Results of the Company for the quarter & period ended on 31st December, 2021 in terms of Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015 and have issued an unmodified Limited Review Report."

4. The figures for the corresponding previous periods have been regrouped/rearranged wherever necessary, to make them comparable.

5. The above is an extract of the detailed format of Un-Audited Standalone & Consolidated Financial Results for the quarter & period ended on 31st December, 2021 filed with the Stock Exchanges (BSE & NSE) under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015 .The detailed statement of Financial Results alongwith Standalone & Consolidated Independent Limited Review Report is available on the website of BSE Limited (www.bseindia.com), National Stock Exchange of India Limited (www.nseindia.com) and also on the website of the Company (www.jindaltxtiles.com).

For and On Behalf of the Board
Sd/-
For JINDAL WORLDWIDE LIMITED

(MR. AMIT AGRAWAL)
Managing Director
DIN : 00169061

Date : 11th February, 2022
Place : Ahmedabad

મજા નોટીસ

વિવર મિલકત માટે)

કાંકગરોડી ઇન્ડસ્ટ્રીઝ એન્ડ રીપર રીપર તથા

મજા નોટીસ બાદ કરેલ હતી

વિવર / જમીનવાદાર આ રકમ સુકુવવામાં

એ દર્શાવેલ મિલકતો, સદર નિયમોના

વિવર / ગીરવેદાર / જમીનવાદાર તથા

ન બેંક નીચે જણાવેલ બાકી રકમ અને

જોડાવવા માટે મળવાપાત્ર સમય બાબતે

વર્ણન

સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ સોલ્ડીના નામે ગામ

સિદ્ધી સર્વે નં. ૧૪૭૨ અને ૧૪૭૩) ખાતે

ગાંધીનગર, ગુજરાત ખાતે જમીનમાં

૧૯.૬૬ ચો.મી. વિશ્વ અપ એસિયા

ના તમામ પીસ અને પાર્સલ. ચતુ: સીમા :

માર્જિન, દક્ષિણ: માર્જિન

ગીનગરના જુલ્લા અને ઉપ જુલ્લામાં

તેની પદ થયેલા બાંધકામ સહિત

જણાવેલ રહેણાંક મિલકતના તમામ પીસ

અને ર

ગાંધીનગર ખાતે નગર પાલિકા નં.

૩૩૫૫/૨, સિદ્ધી સર્વે નં. ૨૮૩૦ અને

અપ એસિયાના બંધાવેલ મકાન સહિત

પીસ અને પાર્સલ. ચતુ: સીમા : પૂર્વ :

જણાવેલાનું મકાન, દક્ષિણ: હિમ્મત સિદ્ધિ

અધિકૃત અધિકારી, ઇન્ડસ્ટ્રીઝ બેંક

NEELAMALAI AGRO INDUSTRIES LTD.

Regd. Office: Katary Estate, Katary P.O., Coonoor, Nilgiris District – 643213.
TamilNadu. Tel: 0423 - 2284235, Fax: 0423 - 2284080
Corporate Identity Number (CIN): L01117TZ1943PLC000117,
Website :www.neelamalaiagro.com, E-mail: seeneelamalai@avtplantations.co.in

EXTRACT FROM THE UNAUDITED FINANCIAL RESULTS
FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31ST DECEMBER, 2021

(Rs. In Lakhs, Except EPS)

Sl. No.	Particulars	Standalone			Consolidated				
		Quarter Ended		Nine Months Ended	Quarter Ended		Nine Months Ended		
		31.12.2021	31.12.2020	31.12.2021	31.12.2020	31.12.2021	31.12.2020		
		Unaudited			Unaudited				
1	Total income from operations	808.13	686.37	2,331.70	2,366.79	808.13	686.37	2,331.70	2,366.79
2	Net Profit / (Loss), before exceptional items and tax (before share in profit of associates and joint venture)	(135.56)	82.26	562.52	689.99	(135.56)	82.26	192.87	319.29
3	Net Profit / (Loss) after exceptional items and before tax(after share in Profit of Associates & Joint Venture)	(135.56)	134.22	562.52	741.95	1,107.22	886.42	2,838.57	2,083.32
4	Net Profit / (Loss) after Tax	(132.94)	146.07	435.61	621.11	1,109.84	898.27	2,711.66	1,962.48
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(132.94)	146.07	435.61	621.11	1,100.03	917.29	2,733.15	2,166.33
6	Paid up Equity Share Capital (Face Value Rs.10/- per share)	62.21	62.74	62.21	62.74	62.21	62.74	62.21	62.74
7	Other equity as shown in the Audited Balance Sheet of Previous Year				4,873.60				18,930.49
8	Earnings Per Share (of Rs.10/- each) (Not Annualised) Basic & Diluted (Rs.)	(21.36)	23.28	70.03	99.01	178.41	143.19	435.91	312.82


Note:

1. The above is an extract of the detailed format of Quarterly / Year to date Financial Results filed with the Stock exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly / Year to date Financial results are available on the Stock Exchange website, www.bseindia.com and also on the website of the Company, www.neelamalaiagro.com

2. The Board of directors in the meeting held on February 11, 2022, declared an interim dividend of Rs.10 per share (100%) on the face value of Rs. 10/- each, amounting to Rs.62.21 Lakhs for the financial year 2021-22.


Place : Chennai
Date : 11.02.2021

AJIT THOMAS
CHAIRMAN
DIN : 00018691



IFCI LIMITED
आई एफ सी आई लिमिटेड
(A Government of India Undertaking)
(महाराष्ट्र सरकार का उपक्रम)

Registered Office: New Delhi-110 019
IFCI Tower, 61 Nehru Place, New Delhi-110 019
Phone: 011-41732000
Fax: 011-26488471
Website: www.ifcilt.com
CIN : L74899DL1993GOI053677



75
आज़ादी का
अमृत महोत्सव

**EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS (STANDALONE & CONSOLIDATED)
FOR THE QUARTER AND PERIOD ENDED DECEMBER 31, 2021**

(₹ in crores)

Particulars	Standalone Results						Consolidated Results					
	Quarter Ended 31/12/2021 (Unaudited)	Quarter Ended 30/09/2021 (Unaudited)	Quarter Ended 31/12/2020 (Unaudited)	Period Ended 31/12/2021 (Unaudited)	Period Ended 31/12/2020 (Unaudited)	Year Ended 31/03/2021 (Audited)	Quarter Ended 31/12/2021 (Unaudited)	Quarter Ended 30/09/2021 (Unaudited)	Quarter Ended 31/12/2020 (Unaudited)	Period Ended 31/12/2020 (Unaudited)	Period Ended 31/12/2020 (Unaudited)	Year Ended 31/03/2021 (Audited)
1. Total income from operations	100.75	106.38	400.97	432.76	1,543.34	1,396.92	284.18	373.01	610.12	1,057.08	2,084.95	2,093.81
2. Net Profit / (loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(328.51)	(663.41)	(883.88)	(1,897.78)	(1,485.66)	(2,147.23)	(279.22)	(556.72)	(861.01)	(1,710.41)	(1,421.85)	(2,087.16)
3. Net Profit / (loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	(328.51)	(663.41)	(883.88)	(1,897.78)	(1,485.66)	(2,147.23)	(279.23)	(559.56)	(861.01)	(1,713.26)	(1,421.85)	(2,084.79)
4. Net Profit / (loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	(731.01)	(525.88)	(740.17)	(1,974.67)	(1,109.17)	(1,957.81)	(684.82)	(444.72)	(717.99)	(1,821.99)	(1,062.61)	(1,911.58)
5. Total Comprehensive Income for the period (Comprising Profit/ (loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)	(671.13)	(547.83)	(726.58)	(1,903.92)	(1,082.71)	(1,935.68)	(213.43)	(273.93)	(696.82)	(994.63)	(803.13)	(1,495.37)
6. Equity share capital (Face Value of Rs.10/- each)	2,041.98	2,041.98	1,895.99	2,041.98	1,895.99	1,895.99	2,041.98	2,041.98	1,895.99	2,041.98	1,895.99	1,895.99
7. Other equity (as per annual audited balance sheet as at 31st March)	-	-	-	-	-	476.11	-	-	-	-	-	1,841.97
8. Earnings per share (not annualised for the interim periods):												
(a) Basic (₹)	(3.58)	(2.58)	(3.90)	(9.67)	(5.85)	(10.33)	(3.46)	(2.37)	(3.84)	(9.27)	(5.73)	(10.24)
(b) Diluted (₹)	(3.58)	(2.58)	(3.90)	(9.67)	(5.85)	(10.33)	(3.46)	(2.37)	(3.84)	(9.27)	(5.73)	(10.24)

Notes:

- The above financial results were reviewed by the Audit Committee and approved by the Board of Directors at the meeting held on 11th February 2022. These results have been subjected to limited review by M/s M.K. Aggarwal & Co, Chartered Accountants.
- The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the results are available on the Stock Exchange websites (www.nseindia.com and www.bseindia.com) and on the company's website, www.ifcilt.com.
- For the items referred in Regulation 52(4) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the pertinent disclosures have been made to Stock Exchange websites (www.nseindia.com and www.bseindia.com) and on the company's website, www.ifcilt.com.

BY ORDER OF THE BOARD
Sd/-
(Manoj Mittal)
Managing Director &
Chief Executive Officer

Place: New Delhi
Date: 11th February, 2022

In Development of the nation Since 1948